

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West ON LIC # 10530
Investment | Insurance | Mortgages

परदेशां देशी महक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4tahomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal4tahomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 06 MAY, 2022 Vol. 19, No. 18 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

કોરોનાથી દુનિયામાં 62 લાખ નહીં પણ 1.50 કરોડનાં મોત: ડબલ્યુએચઓનો નવો ફણગો

ડબલ્યુએચઓના એક્સેસ મોર્ટાલિટી ડેટામાં મહામારીની અસરથી થયેલાં મૃત્યુને પણ ધ્યાનમાં લેવાયા

ન્યૂયોર્ક

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને એક્સેસ મોર્ટાલિટી ડેટાના ગાણિતિક મોડેલના આધારે વિશ્વમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કર્યો હતો. એ પ્રમાણે કોરોનાથી દુનિયામાં 62 લાખ નહીં, પરંતુ દોઢ કરોડ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. આ અહેવાલમાં કોરોના મહામારીની અસરથી થયેલા મૃત્યુઆંકને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

વિશ્વમાં કોરોનાથી ૬૨,૭૦,૩૨૬ લોકોનાં મોત થયા છે. ૫૧ કરોડ કરતાં વધુ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું. એમાંથી વિવિધ અહેવાલો પ્રમાણે ૬૨થી ૬૩ લાખ લોકોએ જીવ ખોયો હતો. જોકે, હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને આ આંકડો બે ગણો હોવાનું કહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસના કહેવા પ્રમાણે દુનિયામાં ૨૦૨૦ અને ૨૦૨૧ એમ બે વર્ષ દરમિયાન દુનિયામાં દોઢેક કરોડ લોકોનાં કોરોનાથી મોત થયા હતા. અહેવાલમાં આ રેન્જ ૧.૩૩ કરોડથી



૧.૬૬ કરોડ સુધી આંકવામાં આવી હતી. એનો અર્થ એ કે કોરોનાથી મૃત્યુઆંક ઓછામાં ઓછો એક કરોડ તેત્રીસ લાખ, વધુમાં વધુ એક કરોડ ૬૬ લાખ સુધી હોઈ શકે છે. કોરોનાથી સત્તાવાર મૃત્યુ આંક અત્યાર સુધી ૬૨થી ૬૩ લાખ નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના આ અહેવાલમાં કોરોના મહામારીની અસરથી થયેલા મૃત્યુને પણ ધ્યાનમાં લેવાયા છે. એટલે કે કોરોના મહામારી દરમિયાન કોરોના કોમ્લિકેશનના કારણે પોસ્ટ કોવિડ ડેથને પણ ધ્યાનમાં લેવાયા હતા. તે ઉપરાંત કોવિડ મહામારી દરમિયાન અન્ય સારવાર કોરોનાના કારણે ન થઈ હોય તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોરોનાથી ભારતમાં સૌથી વધુ 47 લાખ લોકોના મોત થયા : WHO

નવી દિલ્હી

વિશ્વ આરોગ્ય સંગઠને એમ પણ જણાવ્યું છે કે વિશ્વમાં હજી સુધી જે મૃત્યુને ગણતરીમાં નથી લેવાયા તે પૈકીના અડધોઅડધ મૃત્યુ ભારતમાં થયેલાં છે. અહેવાલ કહે છે કે ભારતમાં મહામારીને કારણે 47 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં, અને ખાસ કરીને મે અને જૂન 2021 દરમિયાન મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં હતાં. પરંતુ ભારત સરકારે જાન્યુઆરી-2020 થી ડિસેમ્બર-2021 દરમિયાન સત્તાવાર મૃત્યુઆંક 4,80,000 જ દર્શાવેલ છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠને એમ પણ જણાવ્યું કે ભારત દ્વારા

આ સમાહે પૂરા પાડવામાં આવેલા નવા અંકોની સમીક્ષા કરવાની હજી બાકી છે. WHOના અંદાજના જવાબમાં આ અંકો પૂરા પાડવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટમાં કોરોનાના મૃતક પરિવારને વળતર ચૂકવવા માટે થયેલી અરજીમાં કોર્ટે ભારત સરકારની માત્ર કોરોનાના કારણે જ મૃત્યુ થયું હોય એવી પદ્ધતિને નકારી કાઢી હતી. સરકારે એવી પદ્ધતિ આપવાની હતી કે માત્ર કોરોનાના કારણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો જ તેને કોવિડ મૃત્યુ માનવું. આવા કિસ્સામાં કોઈ વ્યક્તિ પહેલેથી ડાયાબીટીસ, હૃદયરોગ કે અન્ય રોગથી પીડિત હોય અને તેને

કોરોનાની અસર થઈ હોય, મૃત્યુ પામે તો તેને કોરોનાના મૃત્યુ તરીકે ગણવામાં આવતું નહીં. સુપ્રીમ કોર્ટે દરેક વ્યક્તિને વળતર ચૂકવવાનો આદેશ આપતા સત્તાવાર આંક કરતા ઘણા વધારે લોકોને વળતર મળ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશે આંકડા રજૂ કર્યા હતા અને કુલ ૧,૬૮,૩૨૬ના સત્તાવાર મૃત્યુ સામે ૩,૭૨,૨૬૧ લોકોએ વળતર માટે અરજી કરી હોવાના એફીડેવિટ ફાઈલ કર્યા હતા. આ દર્શાવે છે કે કેન્દ્ર સરકારે પોતાના સત્તાવાર આંકમાં હજી પણ આરોગ્ય વિભાગની માત્ર ફોર્મ્યુલા જ જાળવી રાખી છે.

ગ્રીષ્મા હત્યા કેસ: આરોપી ફેનિલને ફાંસીની સજા

PAGE NO. 02

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585

More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

ભારતે WHOના મૃતકના દાવા સામે વાંધો ઉઠાવ્યો

ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મૃત્યુના અંદાજો માટે જે ગાણિતિક મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સામે પણ વાંધો નોંધાવ્યો હતો. ભારતે નિવેદનમાં જણાવ્યું છે કે ભારતે ગણતરીની પ્રક્રિયા અને મોડેલ સામે વાંધો નોંધાવ્યો હોવા છતાં ભારતની ચિંતાની પરવા કર્યા વિના વિશ્વ આરોગ્ય સંગઠને મૃત્યુઆંક સંબંધી અતિશયોક્તિભર્યા અંદાજો જાહેર કર્યા છે.

CIBC
Mortgage advice that comes to you
For expert advice contact me today

Dhires Shah
Mobile Mortgage Advisor
Tel : 647-248-0246
dhires.shah@cibc.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુઆમાં ચાહ સખરો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

ગ્રીષ્મા હત્યા કેસ: આરોપી ફેનિલને ફાંસીની સજા

12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી

સુરત

સુરતના ચક્ર્યારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ સ્પીડી ટ્રાયલના અંતે બુધવારે કોર્ટે તેને દોષી ઠેરવ્યા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલ સાંભળી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આ કેસને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં મુક્યો હતો. આ સાથે જ જજે સરકારપક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રીષ્માના હત્યાકાંડ ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.

કામરેજના પાસોદરામાં ગત તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનિલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરિયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનિલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફિરિયાદી ભાઈ ધ્રુવ વેકરિયા પર પણ આરોપી ફેનિલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થતાં ત્રણ તબક્કે આરોપી વિરુદ્ધનો ચૂકાદો મુલતવી રહ્યો હતો. ગઈ તા.21મી એપ્રિલના રોજ કોર્ટમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકાર પક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કર્યો હતો.

ફેનિલને કોર્ટે હત્યા, હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો



કોર્ટે આરોપીને એકથી વધુ વાર પોતાના બચાવ માટે છેલ્લી તક આપી હતી. કોર્ટે આરોપીને પોતે જે કંઈ કહેવા માંગે તે કોર્ટે પોતાના ચૂકાદામાં ટાકવા જણાવ્યું હતું. કોર્ટે આરોપી ફેનિલને પૂછ્યું હતું કે, તમે એક નિ:સહાય યુવતીનો વધ કર્યો છે. તો મારે કલમથી તમારો વધ કેમ ન કરવો? પરંતુ આરોપી ફેનિલે કંઈ પણ કહેવાની ના પાડીને મોન સેવ્યું હતું. જેથી કોર્ટે બચાવપક્ષે સજાના મુદ્દે દલીલ કરવા સમય માંગતી અરજીને મંજૂર કરી તા.22મી એપ્રિલ સુધી સુનાવણી મોકુફ રાખી હતી. અગાઉ કોર્ટની આ મુદત દરમિયાન આરોપીની કસ્ટડી ન આવતાં તથા આરોપીના બચાવપક્ષના વકીલ કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિવાર્ય સંબોગોના કારણે ગેરહાજર રહેતાં કોર્ટે ચૂકાદો તા. 5 મી મે સુધી અનામત રાખ્યો હતો.

સરકાર પક્ષની દલીલો : ■ ગ્રીષ્મા હત્યા કેસમાં દોષી ઠેરવા ફેનિલ ગોયાણી વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફાંસીની સજા માટે માંગ કરી હતી. ■ જેના સમર્થનમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટે માઈસિંગ તથા બચ્ચનસિંગના કેસમાં રેરેસ્ટ ઓફ રેર કેસના રેસીયો દર્શાવતા આરોપીના ઉગ્ર તથા શાંત થતાં સંબોગો આરોપીની વિરુદ્ધ હોવાની સ્પૂઆત કરી હતી. ■ સરકાર પક્ષે આરોપી ફેનિલે પ્રોફેશનલ કિલરની જેમ ગુનાને અંજામ આપવા કહેલી પૂર્વ તૈયારી અને તેના ગુનાઈત માનસ અને ગુનાઈત વર્તણુકને પણ ધ્યાનમાં લેવા માંગ કરી હતી. ■ સરકાર પક્ષે જણાવ્યું હતું કે આરોપીએ એકતરફી પ્રેમમાં એક આશાસ્પદ યુવતિને સરેઆમ તેના જન્મદાતા માતા પિતાની નજર સામે જ રહેસી નાખી છે. ■ આરોપીની નાની વય નહીં પણ ગ્રેવીટી ઓફ ઓફેન્સને પણ અદાલતે ધ્યાનમાં લેવો જોઈએ. ■ આરોપીએ નાની ઉંમરે કોઈ શાતિર દિમાગના પ્રોફેશનલ કિલરની જેમ ભોગ બનનારને બાનમાં લઈને સમાજને ભયમાં મુક્યો છે. બનાવ સ્થળે હાજર લોકોને કોઈ પણ આગળ આવે તો ગ્રીષ્માને ગળે ચપ્પુ હુલાવી દેવાની ધમકી આપી જાહેર જનતાને પણ બાનમાં લીધી છે. ■ જેથી આ માત્ર કોઈ એક વ્યક્તિ વિરુદ્ધનો નહિ પરંતુ સમાજ વિરોધી ગુનો છે.

બચાવપક્ષની દલીલો : ■ આરોપી ફેનિલના બચાવ પક્ષે ઝમીર શેખ તથા અજય ગોડલીયાએ મુખ્યત્વે ફાંસીની સજા અંગે વૈશ્વિક પરિસ્થિતિ અંગે મતમતાંતર હોવાની સ્પૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે વર્ષ -2002માં મીહુસિહ વિ. સ્ટેટ ઓફ પંજાબના કેસમાં ડેથ સેવ્ટેન્સને ગેરબંધારણીય ગણાવી હોવાની સ્પૂઆત કરી હતી. ■ બચાવપક્ષે આ કેસને મીડીયા ટ્રાયલ તથા પોલીસ તપાસમાં ગંભીર ભુલો કરી હોવાનો આક્ષેપ કરી આરોપીની નાની વયને અને ભવિષ્યને ધ્યાને લઈ ઓછી સજા કરવા માંગ કરી હતી. બચાવ પક્ષે જણાવ્યું હતું કે દરેક સંતને તેનો ભૂતકાળ અને દરેક પાપીને પોતાનું ભવિષ્ય હોય છે. ■ આરોપી સામે પણ તેનું ભવિષ્ય છે. આરોપીએ ઉશ્કેરાટમાં આવીને આ કૃત્ય કર્યું હોઈ, રેરેસ્ટ ઓફ રેર કેસ ન ગણાય. આમ પણ રેરેસ્ટ ઓફ રેર કોને ગણવો તે અંગે કોઈ ચોક્કસ માપદંડ કે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું નથી. ■ ફેનિલ ગોયાણીના વકીલે જણાવ્યું હતું કે આરોપીની યુવાન વયના છે. તેનો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી. આરોપીની માથે ઘરની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.

ફેનિલને ફાંસી પર લટકાવી દેવાય એવી ઈચ્છા: ગ્રીષ્માના પિતા



ફાંસીની સજા બાદ ગ્રીષ્માના માતા-પિતા જ નહીં રાજ્યના લોકો પુશ છે. સજા સંભળાવ્યા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે, કોર્ટના નિર્ણયથી હું ખૂબ પુશ છું. પોલીસથી માંડીને રાજ્ય સરકારે ખૂબ જ સહકાર આપ્યો છે. મારી માંગ હતી એ સંપૂર્ણપણે પૂરી થઈ છે. હવે મને એક જ આશા છે કે ફેનિલને ફાંસીએ લટકાવી દેવામાં આવે. આપણા દેશની કોઈ પણ દીકરી સાથે આવું કૃત્ય ન બને. જાહેરમાં આવું કૃત્ય કરનારી વ્યક્તિ એકવાર ફાંસી જોઈ જશે તો આવું કૃત્ય કરતા વિચાર કરશે.

ટોરોન્ટોમાં સસ્તા દરની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા વિચારણા

કાઉન્સિલનાં કમિટીનાં સભ્યોએ યોજનાની તરફેણમાં મતદાન કર્યું ટોરોન્ટો

ટોરોન્ટોનાં મેયરની કમિટીએ બુધવારે જણાવ્યું હતું કે, તેઓ શહેરની આજુબાજુનાં વિસ્તારમાં સસ્તી મ્યુનિસિપલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા વિચારી રહ્યા છે. કમિટી સર્વાનુમતે કનેક્ટ ટોરોન્ટો પ્રોગ્રામનું નવિનીકરણ કરી એનો અમલ કરવાનો વિચાર કરી રહી છે. કાઉન્સિલનાં કમિટીનાં સભ્યોએ 11 મેના રોજ આ યોજનાની તરફેણમાં મતદાન કર્યું હતું. શહેરનાં રહેવાસી પૂરતી સસ્તા દરની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા દરેક પરિવાર સુધી પહોંચે તેવું

આયોજન કર્યું છે.

પ્રાથમિક તબક્કે આ યોજના શહેરના વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો પણ લઈ શકે તેવી સસ્તી યોજના હશે. કમિટીએ મ્યુનિસિપાલિટીને આ યોજના આડે આવતાં રાજકીય અવરોધો દૂર કરવામાં આવે અને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા ઝડપથી શરૂ કરી શકાય તેવા કામમાં મદદ કરે તેવી માંગ કરી છે. સસ્તી હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાનો નિર્ણય લેવાનું કારણ એવું છે કે, હજુ થોડા સમય પહેલાં શહેરનું એક પ્રતિનિધિ મંડળ મેયર જહોન ટોરીને મળ્યું હતું અને આ મુલાકાત દરમિયાન શહેરમાં ઈન્ટરનેટ સેવાની આવશ્યકતા તથા તે સસ્તી અને ઝડપી હોય તે બાબતે માંગણી કરાઈ હતી. તેનાં અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009
Canada

FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS

SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE

JAGDISHBHAI SEVAK
Insurance Broker

647-236-7620

sevak_2007@hotmail.com • www.shivfinancialservices.ca

"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH
REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX
CROSSROADS REALTY INC.

કેનેડામાં નિવાસી માટેની 2 મિલિયન અરજી પડતર

કામચલાઉ રહેવાસીઓનાં વિઝા અને વર્ક પરમિટમાં નોંધપાત્ર વધારો થયો : સરકાર તરફથી સમસ્યા ઉકેલવા યોજના જરૂરી

ટોરોન્ટો

કેનેડામાં વસાહતીઓની અરજીઓનો ઝડપથી નિકાલ કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં પણ તમામ પ્રકારની 2 મિલિયન લોકોની અરજી પડતર થઈ ગઈ છે.

હંગામી અને કાયમી નિવાસીની અરજીનો ભરાવો વધ્યો છે, જ્યારે નાગરિકતા માટેની અરજીના ભરાવામાં ઘટાડો થયો છે. જે એપ્રિલ સુધીમાં 4 લાખનો ભરાવો હતો. જે આ અગાઉ માર્ચ મહિનામાં 4,53,000 હતો. ગયા ઊનાળામાં અરજીનો ભરાવો વધતો ગયો હતો.

મીડિયાના નવા ડેટા 28 એપ્રિલ સુધી આઈઆરસીસી તરફથી મળ્યા છે, જે 11મી એપ્રિલનાં આંકડાઓ સાથે મળે છે. મીડિયાએ નવા ડેટા માટેની માંગણી પણ કરી છે. જે માહિતી પણ આઈઆરસીસી તરફથી મળી છે.



અરજીના ભરાવાની આંકડાકીય સ્થિતિ

- એપ્રિલ 11-12, 2022માં 2,031,589.
- માર્ચમાં 15 અને 17, 2022માં 1,844,424.
- ફેબ્રુઆરી 1, 2022માં 1,815,628.
- ડિસેમ્બર 15, 2021માં 1,813,144.
- ઓક્ટોબર 27, 2021માં 1,792,404.
- જુલાઈ 6, 2021માં 1,447,474.

એ મુજબ માર્ચ અને એપ્રિલ દરમિયાન કામચલાઉ રહેવાસીઓનું પ્રમાણ વધ્યું છે, જે 11મી એપ્રિલનાં રોજ અગાઉનાં આંકડા કરતાં 1.1 મિલિયન અરજદારો વધુ છે. જેમાં કામ માટે તેમજ અભ્યાસ માટેની પરમિટ 11મી માર્ચ સુધીની પ્રક્રિયામાં હતી. જેનો આંકડો 8,70,000

જેટલો થાય છે. આઈઆરસીસીનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ કામચલાઉ રહેવાસીઓનાં વિઝા અને વર્ક પરમિટમાં નોંધપાત્ર વધારો થયો છે. જેનું કારણ કેનેડા-યુકેન ઓથોરાઈઝેશન ફોર ઈમર્જન્સી ટ્રાવેલ છે. આ કાર્યક્રમ હેઠળ આઈઆરસીસી એવા લોકોને કેનેડા લાવવા માંગે છે, જેનાં વિઝા

પ્રક્રિયા હેઠળ છે. જેનો આંકડો 29 એપ્રિલ સુધી 180,903 જેટલો છે. જેમાં 11 એપ્રિલ સુધી મળેલી સ્ટડી પરમિટ, સ્ટડી પરમિટ એક્સટેન્શન, ટીઆર વિઝા, વિઝિટર રેકોર્ડ, વર્ક પરમિટ અને વર્ક પરમિટ એક્સટેન્શન મળીને કુલ અરજી સંખ્યા 1,102,375 જેટલી થાય છે.

મારા માટે આ અકલ્પનીય : વિજય મળ્યા બાદ મેટી રોઝનો પ્રત્યાઘાત

મેટી રોઝને 29,299 યુએસ ડોલરનું વધારાનું ઈનામ અપાઈ

ટોરોન્ટો

નોવાસ્કોશિયાની ચેમ્પિયન વિજેતા મેટી રોઝે મંગળવારે રાત્રે 21મી જીઓપાર્ટી સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. આ 23 વર્ષીય મેટી રોઝ ટ્રિવટર અનેક સુવિધાઓ વચ્ચે ઉછરી છે. આ સ્પર્ધામાં જુલિઆ કોલિન પણ પાંચમા ક્રમે વિજેતા રહી હતી. રોઝને આ સ્પર્ધામાં 29,299 યુએસ ડોલર વધારાનું ઈનામ અપવામાં આવ્યું હતું અને આમ તેની કુલ કમાણી 506,584 યુએસ ડોલર થઈ હતી.

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રોઝે જણાવ્યું હતું કે, હું હજુ પણ માની શકતી નથી કે આ ખરેખર સાચું છે. જો કે, તેને થયેલી આ કમાણી તે કઈ રીતે વાપરશે એ બાબતે કેટલાંક આશ્ચર્યજનક

તર્ક તેમણે આપ્યા હતા.

તેણે કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, હું મારી કમાણીના મોટાભાગનું રોકાણ કરીશ અથવા તો મને ખાવાનો શોખ હોવાથી હું ખાનપાનની દુકાન ચાલુ કરીશ. પોતાના અનેક ચાહકોના સવાલોનાં જવાબ આપતાં રોઝે જણાવ્યું હતું કે, મારા ભવિષ્યમાં શું છે, એ જાણ્યા વિના કંઈ ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ હું કોઈ સાહસ ચોક્કસ કરીશ.

જો કે, આ તબક્કે હું કોઈ પણ જાતની પ્રતિબદ્ધતા દર્શાવી શકતી નથી. મારે એન્જેલા કિસનરના એક શૈક્ષણિક કાર્યક્રમમાં તેનો સામનો કરવાનો છે.

જીઓપાર્ટી રેઈલી બોક્સ સ્કોર મુજબ રોઝે 38 વાર પ્રયત્નો કર્યા હતા અને 33 વખત તેણે તેમાં સફળતા મેળવી હતી. જીતવા માટે 87 ટકા મેળવવા જરૂરી છે. રોઝે યોગ્ય પ્રત્યાઘાત આપી 89 પોઈન્ટ સાથે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો.

ઓન્ટેરિયોમાં પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરાયા

ટોરોન્ટો

ડગ ફોર્ડે તેની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાત મુદ્દાના કાર્યક્રમ સાથે ઓન્ટેરિયોની ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. રાજ્યની આ ચૂંટણીના પ્રચારની ભુધવારથી શરૂઆત કરાઈ હતી. નેનોઝ રિસર્ચ સર્વે કે જેમાં 500થી વધુ લોકોની સાથે મીડિયા તરફથી એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં આયોજનમાં સીપી 24 પણ જોડાઈ હતી.

જાણવા મળ્યા મુજબ હાલમાં 36.9 ટકા ઓન્ટારિયનો ટોરીઝનાં ટેકેદાર છે, જ્યારે લિબરલ કે જેનું નેતૃત્વ સ્ટિવન ડેલ ડુકો સંભાળે છે, તેનાં ટેકેદારોનું પ્રમાણ 30.4 ટકા છે. આન્ડ્રે હોવાર્થ અને તેની પાર્ટી એનડીપી 23.7 ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે. જ્યારે ગ્રીન પાર્ટી 4.3 ટકા સાથે ચોથા ક્રમે આવે છે. 9 ટકા મતદારોનો અભિપ્રાય હજુ સુધી જાણી શકાયો નથી.

ચૂંટણી પહેલા થયેલા સરવેના તારણો દર્શાવે છે કે, જીટીએમાં કે જ્યાં ટોરીની પાર્ટી 1 પોઈન્ટથી આગળ છે. જ્યારે લિબરલ પાર્ટી ત્રીજા ક્રમે છે. તેને આ સર્વેમાં 30 ટકા મત મળ્યા હતા પરંતુ ઓન્ટેરિયોમાં અન્ય જગ્યાએ ટોરીને 11 પોઈન્ટ મળ્યા છે. જ્યારે લિબરલ્સને 15 પોઈન્ટ મળ્યા છે, જે એનડીપી કરતાં વધારે છે.



પ્રિમિઅર ડગ ફોર્ડ આ ચૂંટણીમાં 29.9 ટકા સાથે આરામથી ચૂંટાઈ શકે તેવી સ્થિતિમાં જણાય છે અને તેના ટેકેદારો પણ માને છે કે આ પક્ષનું નેતૃત્વ વ્યવસ્થિત કામ કરે છે. જ્યારે 17 ટકા લોકોએ જણાવ્યું હતું કે સ્ટિવન ડેલ ડુકો તેમની પ્રથમ પસંદગી છે અને તેના મતદાતાઓ આ પક્ષ માટે મતદાન કરવા ઉત્સુક છે. જ્યારે આન્ડ્રે હોવાર્થ સંબંધી આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે આશરે 22 ટકા લોકોએ જણાવ્યું હતું કે, એનડીપીના આ નેતા પ્રિમિયર માટે અમારી પહેલી પસંદગી છે. આ અભ્યાસનું આયોજન 23 એપ્રિલ અને 2 મેની વચ્ચે કરવામાં આવ્યું હતું.

ટોરોન્ટોમાં મકાનના ભાવમાં કડાકો, રિયલ એસ્ટેટને માઠી અસરના સંકેત

માત્ર જીટીએ વિસ્તારમાં લાંબા સમય સુધી મકાનોના ભાવ ઉંચા રહેશે

ઓન્ટેરિયો

બેન્ક ઓફ કેનેડાએ વ્યાજના દરમાં વધારો કર્યો છે અને હજુ વ્યાજ દર વધવાના સંકેત આપ્યા છે. એવું જણાય છે કે, કેનેડાના સૌથી મોટા શહેરનું રિયલ એસ્ટેટનું લાલચોળ બજાર હવે ઠંડું પડવા લાગ્યું છે.

હાઉસ સિગ્મા વેબસાઈટ બજારનાં વલણો અને મિલકતોના ભાવની ચડ-ઉતર પર સતત નજર રાખે છે. તેના બિઝનેસ ડેવલપમેન્ટ રિરેક્ટર મિશેલ કારને કહે છે કે, ગ્રેટર ટોરોન્ટોના કેટલાંક વિસ્તારોમાં સિંગલ ડીટેચ્ડ મકાનોના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ૧લી ફેબ્રુઆરીથી ૧૯ એપ્રિલ, ૨૦૨૨ના નવા આંકડા પ્રકાશિત કરવામાં આવ્યાં છે, એ મુજબ મકાનના ભાવ ઘટાડા તરફી વલણ ચાલી રહ્યાં છે. ગ્રેટર નોર્થડા એરિયામાં ફેબ્રુઆરી મહિનામાં ડીટેચ્ડ હોમમેઈડના ભાવે વેચાયા હતા. એપ્રિલ મહિના કરતાં તેના ભાવ ૧૨.૧ ટકા ઘટીને ૧.૬૫ મિલિયન ડોલરને બદલે ૧.૪૫ મિલિયન ડોલર થયાં હતાં. એજ સમયગાળામાં ઘટાડા સાથે સેમી ડીટેચ્ડ મકાનોના ભાવ ૧૩.૫ ટકાના ઘટાડા સાથે ૧.૩૩થી ઘટીને ૧.૧૫ મિલિયન ડોલર થયાં હતાં. સૌથી મોટો ઘટાડો ફ્રી હોલ્ડ ટાઉન હાઉસમાં ૨૨.૬ ટકા નોંધાયો હતો. જે ૧.૨૪ મિલિયન ડોલર પરથી ઘટીને ૯૬૦.૦૦૦ ડોલર થયો હતો. કોન્ડોમિનિયમના ભાવમાં સહેજ



ઓછો ઘટાડો થયો હતો. એટલે કે, ૭૪૦,૦૦૦ ઉપરથી ઘટીને ૬૯૦,૦૦૦ ડોલર થયાં હતાં. હાઉસ સિગ્માના મતે ચડસાચડસી મકાનોના ભાવવધારાનું મૂળ કારણ છે. મકાનોની યાદીમાં ખોટું વેચાણ દેખાડી બજારમાંથી મકાનો પાછાં ખેંચી લેવાય છે. ટોરોન્ટો રિજિયોનલ રિયલ એસ્ટેટ બોર્ડના (ટીઆરઆરઈબી) ચીફ માર્કેટ એનાલિસ્ટ જેસન મર્સર કહે છે કે, ફેબ્રુઆરી અને માર્ચમાં જીટીએમાં તમામ પ્રકારનાં મકાનોની સરેરાશ કિંમતમાં સાધારણ વધારો જોવા મળ્યો હતો. ટીઆરઆરઈબીએ જણાવ્યું હતું કે, મકાનના ભાવ હજુ બે આંકડાના દરે વધે છે, ક્યારેક ઘટ્યાં પણ હશે, આમ છતાં દર મહિને વસાહતીઓ, નોકરીના પ્રમાણમાં વધારો અને મકાનોની અપૂરતી ફાળવણીને કારણે જીટીએ વિસ્તારમાં લાંબા સમય સુધી મકાનોના ભાવ ઉંચા જ રહેશે.

ગર્ભપાત સમર્થન-વિરોધી ચર્ચાથી કેનેડિયન મહિલાઓમાં ઉત્સુકતા

ટોરોન્ટો

અમેરિકામાં મહિલાઓનાં કાયદેસરનાં ગર્ભપાતનાં અધિકારોનો અંત આવે તેવી શક્યતા જણાય છે. આ બાબતે અમેરિકામાં ચાલી રહેલી ગરમાગરમ ચર્ચા પર કેનેડાની મહિલાઓ પણ ઉત્સુકતા દર્શાવી રહી છે અને કેનેડાની દક્ષિણ સરહદના વિસ્તારમાં આ નિર્ણયનો રાજકીય પ્રભાવ કેવો હશે તે બાબતે ચર્ચા ચાલી રહી છે.

લંડનમાં લાંબા સમયથી ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલાં નિવૃત્ત ડો. ફેઝર ફેલોઝ કે જેઓ ઓન્ટેરિયોમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે અમેરિકાની સુપ્રિમ કોર્ટે રો વિરુદ્ધ વેડ કેસમાં ચુકાદો આપતાં મહિલાઓનાં ગર્ભપાતનાં અધિકારને રદ કરે છે અને આ ચુકાદો સમસ્યાઓમાં વધારો કરશે.

કારણ કે મહિલાઓ ઈચ્છે છે કે તેઓ જો બાળક ન ઈચ્છતી હોય તો ગર્ભપાત કરાવવાનો તેનો અધિકાર છે. બે દાયકા પહેલાં 1990માં ગર્ભપાત વિરોધી કાયદા સામે ભારે મોટી ઝૂંબેશ ચલાવવામાં

આવી હતી અને આરોગ્ય ક્ષેત્રમાં આ વિશે ખાસ જોગવાઈ કરવાની માંગણી કરવામાં આવી હતી. ફેલો કહે છે કે, હું જાણું છું કે મહિલાઓ આ બાબતે મક્કમ છે અને તેનો આ અધિકાર જળવાઈ રહે તેવું એ ઈચ્છે છે. અમેરિકામાં ગર્ભપાતનું સમર્થન કરતો કાયદો અમલમાં આવ્યો ત્યારથી હંમેશા ચર્ચામાં રહ્યો છે અને તેથી તેની અસર અમેરિકાના ઉત્તરનાં પડોશી દેશ કેનેડાની મહિલાઓ અમેરિકાની આ બાબતની સ્થિતિ પર ધ્યાન આપી રહી છે. ફેલોએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, આપણાં રાજકારણીઓ પણ કેનેડાનાં રાજકારણની સરેરાશ માનસિકતા સાથે સામ્ય ધરાવે છે અને તેઓ પણ ગર્ભપાતને સમર્થન આપતા કાયદાનો દબાવે અવાજે વિરોધ કરી રહ્યા છે. તેઓ ડાહી-ડાહી વાતો કરે છે કે, મહિલાઓને સલામતીપૂર્વક ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવી જોઈએ. સ્વાભાવિક રીતે કેનેડાનાં દક્ષિણ વિસ્તાર અને રાજ્યમાં અમેરિકામાં ગર્ભપાતનાં કાયદા સંબંધી જે કોઈ નિર્ણય લેવાશે તેની ભારે મોટી અસર અહીં પણ જોવા મળશે.

તંત્રી સ્થાનેથી

ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બેરોજગારીનો દર પણ વધ્યો

ભારતમાં અર્થતંત્ર ફરી ડામાડોળની સ્થિતિ તરફ જઈ રહ્યું હોય તેવા સંકેત બુધવારે રીઝર્વ બેંકે કરેલા નિર્ણય પરથી મળ્યો હતો. આરબીઆઈએ રેપો



તંત્રી - પ્રકાશક
સ્વદેશ

રેટ વધારતા જ હવે લોનનાં વ્યાજ વધશે. હોમ લોનથી માંડીને કોર્પોરેટ સુધીની બધી લોન મોંઘી થઈ જતા લોકો પર ભારણ વધશે. લોનનો હમો વધે તેની અસર ચાલુ લોન પર પણ પડશે. તેથી અત્યારે લોન લીધી છે, તેનો હમો પણ વધી જશે. ભારતમાં કોરોના કાળમાં આર્થિક રીતે પડેલા ફટકાથી લાખો લોકો આજે પણ બેહાલ છે. વેપાર-ધંધાની સ્થિતિ હજી પણ કોવિડ પહેલાના સમય જેવી થઈ નથી. તેવા સમયે દેશની પ્રજા માટે વધુ એક મુશ્કેલી આવી છે.

લાંબા સમય સુધી રાજકીય દબાણને શરણે થયા પછી અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં વધારો કરી દીધો હતો. બુધવારે રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ અંગે નિવેદન આપવાની હોવાથી વ્યાજ દર વધવાની અટકળો ચાલી હતી. આ સાથે જ શેરબજારોમાં પણ તેની અસર વર્તાવા માંડી હતી. દાસ જાહેરાત કરે એ પહેલા જ શેરબજારમાં કડાકો બોલાયો હતો. જે બાદ બપોરે દાસે સંબોધનમાં રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૪૦ ટકાનો વધારો કરવાનું એલાન કર્યું હતું. દાસે રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા રાખ્યો છે પણ કેશ રીઝર્વ રેશિયો ૪ ટકાથી વધારીને ૪.૫૦ ટકા કરી નાંખ્યો છે.

દાસે પ્રવચનમાં કુગાવાનો દર વધશે એવો સંકેત પણ આપ્યો છે. અત્યારે જ છૂટક કુગાવો સાત ટકા થઈ ગયો છે. જ્યારે જથ્થાબંધ કુગાવો તો ૧૪ ટકાને પાર થઈ ગયો છે. દાસે વાત વાતમાં કહી દીધું કે, આ હજુ શરૂઆત છે અને લોકોએ હજુ મોંઘવારીનો વધારે માર સહન કરવા તૈયાર રહેવું પડશે. દાસે જેવી જાહેરાત કરી તે પછી શેરોની કિંમતમાં ફરી ધબડકો થવા લાગ્યો. બીએસઈ સેન્સેક્સ બીજા ૧૨૦૦ પોઈન્ટ તૂટીને ૫૬ હજારની અંદર ઉતરી ગયો. એનએસઈનો નિક્કટી પણ સાડા ત્રણસો પોઈન્ટ ઉતરીને ૧૭ હજારની અંદર આવી ગયો. મોટાભાગના શેરોમાં કડાકો બોલી ગયો અને રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવી ગયો.

રાષ્ટ્રીયકૃત, કોમર્શિયલ, સહકારી સહિતની બેંકો રીઝર્વ બેંક પાસેથી નાણાં લે તેના પર વ્યાજ ચૂકવે તેને રેપો રેટ કહેવાય છે. રીઝર્વ બેંકે રેપો રેટ ૪.૪૦ ટકા કર્યો તેનો અર્થ એ કે, બેંકો રીઝર્વ બેંક પાસેથી જે પણ ફંડ લે તેના ઉપર તેમણે વાર્ષિક ૪.૪૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે. દેશની દરેક બેંકે તેને મળેલી ડીપોઝિટ્સમાંથી ચોક્કસ રોકડ રકમ સીક્યુરિટીના રૂપમાં રીઝર્વ બેંકમાં મૂકવી ફરજિયાત છે. આ રકમને કેશ રીઝર્વ કહેવાય છે. ડીપોઝિટના જેટલા ટકા રકમ મૂકવી પડે તેને કેશ રીઝર્વ રેશિયો કહેવાય. રીઝર્વ બેંક બેંકો દ્વારા મૂકાતાં આ નાણાં ઉપર જે વ્યાજ ચૂકવે એ રીવર્સ રેપો રેટ કહેવાય છે. રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા જ રખાયો તેનો અર્થ એ થાય કે, બેંકો રીઝર્વ બેંકમાં જે ફંડ મૂકશે તેના પર તેમને વધારે વ્યાજ નહીં મળે અને પહેલાંની જેમ જ ૩.૩૫ ટકા વ્યાજ મળશે.

રીઝર્વ બેંકે રેપો રેટ વધાર્યો તેથી બેંકોએ રીઝર્વ બેંક પાસેથી ઉચા વ્યાજે નાણાં લેવા પડશે. તેના કારણે લોન ઉચા વ્યાજે આપવી

પડશે, તેથી લોનનાં વ્યાજ વધશે. હોમ લોનથી માંડીને કોર્પોરેટ સુધીની બધી લોન મોંઘી થશે. લોકો મોંઘવારીના મારથી આમ પણ બેવડ વળેલા છે ત્યાં હવે લોનના હમા પણ વધશે તેથી લોકોની હાલત બગડશે. રીઝર્વ બેંકે લાંબા સમયથી વ્યાજ દર બદલ્યા નહોતા. છેલ્લે ૨૦૨૦ના મે મહિનામાં વ્યાજ દરો ઘટાડયા ત્યારથી રેપો રેટ ૪ ટકા ઉપર, જ્યારે રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર સ્થિર હતા. કોરોનાના કારણે ૨૦૨૦-૨૧નું નાણાકીય વર્ષ બહુ કપરું સાબિત થયું છે.

૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ પર પણ આગલા વરસના ઓછાયા હતા. તેના કારણે ઉદ્યોગ-ધંધા હજુ મંદા જ છે ત્યાં વ્યાજ દર વધારાનો આકરો ડોઝ ભારતીય વેપાર ધંધાને અસર કરશે તે નિશ્ચિત છે. દાસે કુગાવો વધ્યો તેના માટે રશિયા-યુક્રેન યુધ્ધને જવાબદાર ગણાવ્યું છે. આ યુધ્ધના કારણે ઘણા બધી ચીજોની ઉપલબ્ધતા પર અસર પડી છે તેથી ભાવ ઉચકાઈ ગયા છે. ઉદાહરણ તરીકે યુક્રેનમાંથી મોટા પ્રમાણમાં સનફલાવર ઓઈલ આપણે ત્યાં આવતું હતું. યુધ્ધના કારણે યુક્રેનથી માલ આવતો નથી, તેમાં બજારમાં ખાદ્યતેલની અછત ઉભી થઈ, તેમાં બીજાં તેલના ભાવ વધી ગયા છે. આ હાલત બીજી ઘણી ચીજોમાં પણ થઈ છે તેથી દાસની વાત સાવ ખોટી નથી પણ ભાવોને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ નિવડી છે એ પણ હકીકત છે.

જો કે, દાસ એ કોઈ રાજકીય હોદ્દેદાર કે સરકારના પ્રવક્તા નથી. એટલે તે આ બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરે. પરંતુ ભારતમાં ચીજવસ્તુઓનો ભાવવધારો ચાલુ જ રહેશે તો સામાન્ય જનતાને માથે મોટી આફત નિશ્ચિત છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, દૂધ, શાકભાજી વગેરે જીવનજરૂરીયાતની ચીજોના ભાવ પહેલાંથી આસમાને છે, હજુ તેમાં વધારો થશે. કોરોનાકાળ પછી આપણી નિકાસ વધી છે પણ જોઈએ એવા પ્રમાણમાં વધી નથી, વિદેશી રોકાણ પણ જંગી પ્રમાણમાં આવતું નથી. કોરોનાના કારણે લોકો પાસે હાથ પર બહુ રોકડ નથી, તેથી સ્થાનિક સ્તરે પણ લેવાલી નથી, તેથી બજારમા સુસ્તી છે.

બે દિવસ પહેલાં જ રીપોર્ટ આવ્યો છે કે, દેશમાં બેરોજગારી વધી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા પ્રમાણે, એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૩ ટકા થઈ ગયો છે. માર્ચમાં બેરોજગારીનો દર ૭.૬૦ ટકા હતો તેમાં વધારો થયો છે. વળી આ વખતે તો ગામડાં કરતાં શહેરોમાં બેરોજગારી વધારે છે. માર્ચમાં શહેરોમાં બેરોજગારીનો દર ૮.૨૮ ટકા હતો એ વધીને ૯.૨૨ ટકા થયો છે. ભારતમાં શહેરો જંગી પ્રમાણમાં રોજગારી આપે છે. શહેરોમાં બેરોજગારી વધે તેનો અર્થ એ થાય કે, અર્થતંત્ર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મોટી સરકારે આ સ્થિતિનો ઉકેલ લાવવો પડશે. નહીંતર ભારતમાં સ્થિતિ વધુ વણસી જશે તે પણ નિશ્ચિત છે. છેલ્લા અઢી વર્ષથી ભારતમાં કોરોનાને કારણે વેપાર, ધંધા, ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. તેવા સંજોગોમાં રોજગારની ગાડી હજી પાટે ચઢી નથી ત્યારે આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં વધારાનો નિર્ણય પ્રજા માટે મોટી આફત નોતરશે તેવી શક્યતા વધુ છે. વાસ્તવમાં આરબીઆઈનું આ પગલું ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યું છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



- ✓ Mice
- ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



- ✓ Cockroach
- ✓ Bedbug
- ✓ Animal Control

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



- ✓ Bird Control
- ✓ WASPS and
- ✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator



DIVINE YOGA
By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



અરવલ્લીનો યુવક હની ટ્રેપનો શિકાર, ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ દાખલ

અરવલ્લી

ધનસુરાનાના જીનેશ પટેલ નામના યુવકને ઈન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશવી પટેલ સાથે મિત્રતા થઈ હતી. પોતાના મોજશોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે અભિનેત્રી યશવી પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા યુવકને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા બંબેર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે અભિનેત્રી યશવી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રામ વિગતો મુજબ, યશવી પટેલે જીનેશ પટેલ નામના યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પરિવાર સાથે મુલાકાત પણ કરાવી હતી. બન્ને જણાં થોડા સમયમાં લગ્ન કરી લઈશું એવું કરીને

યશવીએ શોપિંગ, ફી ભરવા તેમજ પપ્પા બીમાર હોવા જેવા અલગ-અલગ બહાના બતાવીને જીનેશ પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે યુવકે પોતાના અને અભિનેત્રી વચ્ચે થયેલી ચેટ અને વીડિયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. અભિનેત્રી દ્વારા અવાર નવાર રૂપિયાની માંગણીઓ કરવામાં આવતા યુવકને પોતે છતરાતો હોવાની શંકા ગઈ હતી. આથી જીનેશ યશવીની માંગણીઓ પૂરી કરવાનું બંધ કરી દેતા અભિનેત્રીએ પણ તેનો સંપર્ક કાપી નાંખ્યો હતો. આખરે યુવક નાસીપાસ થઈ ગયો હતો. જો કે સામાજિક આગેવાનોએ હિમત આપતા તેણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મહેસાણાના મુદરડામાં યુવાનને મંદિરમાં સ્પીકર વગાડવાની સજા રૂપે મોત મળ્યું

મહેસાણા

મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં એક યુવાનને માતાજીના મંદિરમાં સ્પીકર વગાડવાની સજા રૂપે મોત મળ્યું છે. લાંઘણજ પોલીસે આ મામલે ૬ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરી દીધા છે. સ્પીકર ધીમું વગાડવા મામલે થયેલી તકરાર બાદ મામલો હત્યા સુધી પહોંચી જતા નાનકડા ગામમાં ચક્રચાર થવા પામી છે. માતાજીના મંદિરમાં સાંજની આરતી ટાંણે દીવાબત્તી કરી સ્પીકર વગાડવું એ સામાન્ય બાબત છે. પણ આ આમ બાબતમાં મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં એક ૪૦ વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. મુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર અને તેમના નાના ભાઈ જસવંતજી ઠાકોરે ઘરના કમ્પાઉન્ડમાં

મેલડી માતાજીનું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં બંને ભાઈઓ સેવા પૂજા કરી માતાજીની આરતી સમયે લાઉડ સ્પીકર વગાડતા હતા, જે બાબત તેમના ઘર નજીક રહેતા લોકોને ખૂંચતી હોવાને કારણે મંગળવારે સાંજે ૭ વાગે આ મામલે ઝગડો થયો હતો. જેમાં સદાજી રવાજી ઠાકોર, વિષ્ણુજી રવાજી ઠાકોર, બાબુજી ચેલાજી ઠાકોર, જયંતીજી રવાજી ઠાકોર, જવાનજી ચેલાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોર નામના ૬ શખ્સ લાકડી અને ધાંકા સાથે બંને ભાઈઓ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બંને ભાઈઓને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જશવંતજી ઠાકોરનું મોત થયું હતું. પોલીસે હુમલો કરનાર ૬ શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધા છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services 2 Fogging Services 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા કચોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

ખેડા પાલિકાના 28ને સભ્યપદેથી દૂર કરવા હુકમ

જૂના બિલ્ડિંગના ખોટા શરતી કરારનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા કાર્યવાહી : તમામ સભ્યોને પાટનગરમાં હાજર રહેવા તાકિદ કરાઈ

નડિયાદ

ખેડા નગરપાલિકાના ૨૮ સભ્યોને બુધવારે સભ્યપદેથી દૂર કરવાના હુકમથી રાજકીય હડકંપ મચી ગયો હતો. નગરપાલિકાના જૂના બિલ્ડિંગના ખોટા શરતી કરારનો વિવાદ છેવટે ૨૮ સભ્યોને ભારે પડ્યો છે.

ખેડા શહેરમાં આવેલ વેદ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ હોસ્પિટલ દ્વારા ખેડા નગરપાલિકાનું જુનું બિલ્ડિંગ

ભારે માંગવામાં આવ્યું હતું. જે માટેનો તા.૧૮.૧.૨૦૨૦નો પત્ર પાલિકાના ઈનવર્ડમાં ૧૫.૨.૨૦૨૦થી નોંધાયેલો છે. એ જ દિવસે એટલે કે ૧૫.૨.૨૦૨૦ના રોજ ખેડા નગરપાલિકાની સામાન્ય સભા ભરાયેલી હતી. જેમાં પાલિકા પ્રમુખ દ્વારા વધારાના કામોમાં નં.૨૧માં વેદ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ હોસ્પિટલ ખેડાને ૯ વર્ષ ૧૧ માસ માટે ભારે આપવા ઠરાવ



નં. ૬૫થી સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ. એ પછી તા.૩૦.૬.૨૦૨૦થી પાલિકાના તત્કાલીન પ્રમુખ ધર્મિષ્ઠાબા

ધર્મેન્દ્રસિંહ મહીડા અને કારોબારી ચેરમેન દિનેશભાઈ દલસુખભાઈ રાઠોડ દ્વારા વેદ હોસ્પિટલ સાથે શરતી કરાર

કરવામાં આવ્યા હતા.

આ બાબતે મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ધ્યાને આવતા રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બિલ્ડિંગ ભારે આપતા પહેલા ગુજરાત નગરપાલિકા અધિનિયમ - ૧૯૬૩માં દર્શાવ્યા મુજબની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી. આથી આ અધિનિયમની કલમ ૩૭ મુજબ પગલાં લેવા માટે ગત ૨૮મી

એપ્રિલના રોજ પાલિકાના સભ્યોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં પાંચમી મેના રોજ બપોરે સાડા ત્રણ કલાકે ગાંધીનગરની કચેરીમાં પાલિકાના સભ્યોને હાજર રહેવા જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન નગરપાલિકાના ૨૮ સભ્યોને તેમના સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પાલિકામાં એકસામટા ૨૮ સભ્યોને દૂર કરાતા સત્રાટો છવાઈ ગયો છે.

ગુમ હરિહરાનંદ ભારતી આખરે નાસિકથી મળ્યા: વડોદરા લાવવા તજવીજ

વડોદરા

રાજ્યના અલગ અલગ પાંચ સ્થળોએ આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાના મામલે વડોદરા સહિત અલગ-અલગ શહેરની પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હરિહરાનંદ ભારતી મહારાજ મહારાષ્ટ્રના નાસિકમાં સલામત છે. તેઓને હાલ મહારાષ્ટ્રથી એક ટેક્સીમાં વડોદરા લાવવામાં આવી રહ્યા છે. આ માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આપી હોવાનું જાણવા મળ્યું છે. ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી છેલ્લા ૩ દિવસથી ગાયબ થતાં અલગ અલગ શહેરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ભરતીમાં કૌભાંડના આક્ષેપ, અનસૂચિત જનજાતિ આયોગનું MSUને અલ્ટીમેટમ

વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપો વચ્ચે સેનેટ સભ્ય દ્વારા પછાત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરીને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને પત્ર લખવામાં આવ્યો હતો.

આ મામલામાં હવે આયોગે યુનિવર્સિટીને એક પત્ર લખીને તાકિદ કરી છે કે, ૩૦ દિવસમાં ઉપરોક્ત આક્ષેપોને લઈને આયોગને અહેવાલ સુપરત કરવામાં આવે અને જો યુનિવર્સિટી આ સમયમાં અહેવાલ સુપરત નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આયોગ દ્વારા


યુનિવર્સિટીને સમન્સ પાઠવવામાં આવશે અને યુનિવર્સિટી સત્તાધીશોને આયોગ સમક્ષ રુબરુ હાજર થવું પડશે. ટેકનોલોજી ફેકલ્ટીના સેનેટ સભ્ય અને અધ્યાપક સુનિલ કહારે ભરતીમાં પછાત વર્ગના ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો અને કેટલીક પોસ્ટ પર જાણી જોઈને ઉમેદવારોની ભરતી નહીં કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને આ અંગે ગત ઓક્ટોબર મહિનામાં એક પત્ર લખ્યો હતો. તે વખતે વાઈસ ચાન્સેલર તરીકે પ્રો. પરિમલ વ્યાસ હતા. આયોગ દ્વારા વાઈસ ચાન્સેલર તરીકે તેમને નોટિસ આપી હતી.

હાલોલની યુવતીએ જયપુર ખાતે મિસિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો

પંચમહાલ



પરણિત યુવતીઓ માટે યોજાતી સૌંદર્ય સ્પર્ધામાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સમાં હાલોલની દર્શના પટેલે મિસિસ ઈન્ડિયા યુનિવર્સનું ટાઈટલ જીતી અને ઈતિહાસ સર્જ્યો છે. સમગ્ર ભારતમાંથી પસંદગી પ્રક્રિયા બાદ જયપુર ખાતે સૌંદર્ય સ્પર્ધામાં ૨૨ યુવતીઓની વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અલગ અલગ રાઉન્ડ બાદ ૨૨ યુવતીઓ પૈકી ૫ યુવતીઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

પેટલાદમાં મોડીરાત્રે એક જ કોમના 2 જથ વચ્ચે પથ્થરમારો અને મારામારી MGVCCLના પૂર્વ કર્મીએ ન્યાય માટે નગ્ન થઈને દેખાવો કરતા હોબાળો

ટોળાં સામે રાયોટીંગનો ગુનો : જૂની અદાવતમાં વાતાવરણ તંગ બનતા પોલીસ દોડી આવી

આણંદ

પેટલાદના દેવકુવા વિસ્તારમાં રહેતા રફીયોદીન શેખ અને જાકીરહુસેન વચ્ચે અગાઉ કોઈ મામલે તકરાર થઈ હતી. આ ઝઘડાની અદાવતને લઈ બન્ને વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો. જેને લઈ રફીયોદીન શેખ, મોઈદીન શેખ, અસલમુદીન શેખ, વસીમભાઈ શેખ, રાજા ઉફે અલ્લુ શેખ, શાહરુખ મલેક, જાકીર મલેક, સમીરભાઈ પઠાણ, ટીકુ મલેક, મોહમ્મદ સકીલ સૈયદ અને સોહેલ ઉફે સુલતાન સહીતના



શખ્સોએ ભેગા મળી જાકીરહુસેનને માર મારવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ જાકીરહુસેનના પક્ષે પણ કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતા અને બન્ને

જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થતા મારામારી થઈ હતી. જેમાં જાકીરહુસેનને ચપ્પાના ઘા વાગતા લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યારે આ તકરારમાં વચ્ચે છોડાવવા પડેલ મોહસીનને પણ માથામાં ધારીયું વાગી જતા ઈજાઓ પહોંચી હતી. બન્ને પક્ષો દ્વારા એકબીજા ઉપર ભારે પથ્થરમારો કરાતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ પેટલાદ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

વડોદરા

વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય દરવાજા પાસે મંગળવારે પૂર્વ કર્મચારી દ્વારા નગ્ન હાલતમાં ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચ્યો હતો. એમજીવીસીએલમાં ફરજ બજાવતા હેમંત ગાંધી નામના દિવ્યાંગ કર્મચારીને વર્ષ 2016 થી હેરાન કરવામાં આવી રહ્યા હતા જેને કારણે તેઓ અવારનવાર પોલીસમાં ફરિયાદ તો પણ આપી હતી છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં એટલું જ નહીં જાન્યુઆરી 2019 થી તેઓનું પગાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને

કર્મચારી એ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો પણ કરી હતી. એમજીવીસીએલના એક આઈએએસ અધિકારી સમક્ષ તેમણે ઈચ્છામૃત્યુની પણ માંગણી કરી હતી ત્યારે આ અધિકારીએ કર્મચારીને બચાવવાની વાત કરવાને બદલે ઉત્તર તો જવાબ આપ્યો હતો. આજે એમજીવીસીએલની મુખ્ય કચેરી પાસે નગ્ન હાલતમાં ઉભા રહી તેમણે વિરોધ શરૂ કર્યો હતો અને પોતાને ન્યાય મળે તે માટેની માગણી કરી હતી હેમંત ગાંધીએ જણાવ્યું હતું કે મારો કોઈ વાંક ગુનો ન હતો છતાં પણ મારો પગાર અટકાવી દેવામાં આવ્યો છે.

અખાત્રીજ નિમિત્તે ડાકોર મંદિરમાં રણછોડારાયને ચંદનના લેપ કરાયા

નડિયાદ

ડાકોરના શ્રીરણછોડારાયજીના મંદિરમાં મંગળવારે અક્ષયનૃતિયા (અખાત્રીજ)ના પર્વની ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરજીને ચંદનના લેપ કરી ગરમીની આ સીઝનમાં શ્રીજી સન્મુખ પાણીના કુવારાથી પણ ઠંડક કરવામાં આવી હતી. વૈષ્ણવ સંપ્રદાયના અન્ય મંદિરોમાં પણ તા. ઉજીને મંગળવારથી શ્રીજીને ચંદનના લેપ કરવામાં આવ્યા હતા. ડાકોરના શ્રીરણછોડાજી મંદિરમાં દર વર્ષે અખાત્રીજથી શ્રીજીને બપોરે રાજભોગ સમયે ચંદનના વાધા ધરાવવામાં આવે છે. રાજા રણછોડને ચંદનનાવાધા પહેરાવવામાં આવ્યા હતા. મંદિરમાં પરંપરા અનુસાર અખાત્રીજથી જેઠ સુદ પૂનમ સુધી શ્રીજીને ચંદનના લેપ કરી પાણીના કુવારાથી ઠંડક કરવામાં આવે છે.

વિધાનગર પાલિકા પ્રમુખના સગા દ્વારા ધમકી અપાતા પરિવારનું ઉપવાસ આંદોલન

દબાણ દૂર ન કરી સત્તાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ

આણંદ

વિધાનગરના હરિઓમનગરમાં રહેતા સંજયભાઈ માછી દ્વારા વિધાનગર પાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યા મુજબ તેઓની ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની અરજી સંદર્ભે અવકુડાના આદેશનો અમલ કરાયો નથી. ઉપરાંત આ મામલે કાર્યવાહી કરવા માટે પ્રમુખને મળવાનું જણાવતા તેઓ માનસિક હેરાનગતિ ભોગવી રહ્યા છે, સામાવાળા દબાણકર્તા પ્રમુખના સગાં હોવાથી તેઓને ધમકાવતા હોવાનું અને માનસિક ત્રાસ અપાતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે વિધાનગર પાલિકા

દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે પોતાના પરિવારજનો સાથે ગત સોમવારના રોજથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં વિધાનગર શહેર કોંગ્રેસ દ્વારા સંજયભાઈ તથા તેમના કુટુંબને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આજે વિધાનગર શહેર કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન પર બેઠેલ અરજદારોની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓની રજૂઆત યોગ્ય હોઈ જાહેર ટેકો આપ્યો હતો. સાથે સાથે સામાવાળા પાલિકા પ્રમુખના અંગત સગા હોઈ દબાણ દૂર ન કરી સત્તાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

વડોદરામાંથી પકડાયેલા ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર વસિમ મુબઈથી ફરાર

વડોદરા

ન્યુ સમા રોડ વિસ્તારની અરવિંદબાગ સોસાયટીના મકાનમાંથી પકડાયેલા ડ્રગ્સ કારોબારના પ્રકરણમાં ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ યુસુફ મકરાણીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે, તેના પુત્રનો કોઈ પત્તો લાગ્યો નથી. એસઓજીની ટીમે અરવિંદબાગના મકાનમાં દરોડો પાડી હિમાંશુ પ્રજાપતિને ૩.૭.૨૨ લાખના પાર્ટી ડ્રગ્સ મેથામ્ફેટામાઈન સાથે ઝડપી પાડ્યો હતો. તેના મકાનમાં ડ્રગ્સ લેવા આવેલા ડિપ્લોમા એન્જિનિયર વિજય પ્રજાપતિને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. બંનેના રિમાન્ડ પુરા થતાં જેલમાં મોકલવામાં આવ્યા છે. ડ્રગ્સ કેરિયરોની પૂછપરછ દરમિયાન હાલોલના સપ્લાયર મોહમ્મદ યુસુફ મકરાણીનું નામ ખૂલ્યું હતું.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

**CANADA
IMMIGRATION**



**SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)**

Last minute student admission

Please contact us on

416-745-2466 or 91-9428973911

- Conestoga
- Fanshawe
- Algoma
- Seneca
- Georgian
- Saskatchewan
- Humber
- Algoma polytechnic
- Lambton
- Canadore
- Mohawk

**ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM**

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
DETENTION REVIEWS /
CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL
APPLICATIONS

CANADA

94- 499 Main Street South, Shoppers World Mall,
Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

VADODARA

101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri,
Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

AHMEDABAD

139 Iscon Emporio, Beside Star Bazaar Satellite
Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

Email.: info@siis.ca

Website.: www.siis.ca

: Specialized in :

**Job Offer & LMIA
Entrepreneur
Investor Business
Self Employed
Farm Investor**

નર્મદા પરિક્રમા પૂર્ણ, 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી પરિક્રમા ભાજપ કાર્યાલય પર વિરોધ કરનારા AAP કાર્યકરોને પોલીસની હાજરીમાં માર મરાયો



નર્મદા

ચૈત્રી અમાસે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની પૂર્ણાહૂતિ થઈ ત્યારે અંદાજે પોણો લાખ જેટલા ભક્તો ઉમટયા હતા. પરિક્રમાવાસીઓ ગામલાકોના આતિથ્ય ભાવ અને સેવાથી ગદ્ગદિત થયા હતા.

કેવડીયા કોલોની થી રાજપીપળા જતા માર્ગે નર્મદા કિનારે આવતા રામપુરા તેમજ સામે કાંઠે તિલકવાડા સુધી નર્મદા નદી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર માસમાં આ પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પરિક્રમા માટે પહેલા દિવસથી જ ભારે ભીડ જોવા

મળી હતી. જેથી આખા મહિનામાં અંદાજે 10 લાખથી વધુ ભક્તોએ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરી હોવાનું સ્થાનિકોનું માનવું છે. પરિક્રમા દરમિયાન ભક્તોને સહેજ પણ અગવડ ના પડે તે માટે માર્ગમાં આવતા રામપુરા, માંગરોલ, ગુવાર, તિલકવાડા, વાસણ, રંગણ સહિતના તમામ ગામો અને આસપાસના ગ્રામજનોએ ભંડારા અને ખાણીપીણીની વિનામૂલ્યે સેવા પુરી પાડી હતી. જેથી તેમનો ભાવ જોઈ પરિક્રમાવાસીઓ પણ ગદ્ગદ થઈ ગયા હતા. આ ઉપરાંત વડોદરાથી પણ સેવા માટે ગયેલા ભક્તોએ આખો મહિનો ભંડારો ચલાવ્યો હતો.

સુરત

સુરત ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ મારી લીધા હતા. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુદ્દાબાદના નારા લગાવ્યા હતા. સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો.



પાટીલના નેતૃત્વમાં ગુંડાગર્દીનું અભિયાન

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, ભાજપ અમારાથી ડરી ગઈ છે તેથી ગુંડા ગર્દી પર ઉતરી આવી છે. સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુંડાગર્દીનું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં શરૂ કર્યું છે. પરંતુ અમે ભાજપના ગુંડાઓ થી ડરતા નથી અમે કેજરીવાલ ના સૈનિકો છે અને સામનો કરીશું તેમ કહેવાયું હતું.

આપના નેતાઓ હુમલો કરવા આવ્યા હતા : BJP

શહેર ભાજપ દ્વારા આપ ઉપર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપે કહ્યું હતું કે, આપના નેતાઓ અમારી પર હુમલો કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત એક નેતાએ કહ્યું હતું કે અમે કોઈને નડતાં નથી પરંતુ અમને કોઈ નડશે એને છોડીશું પણ નહીં. નિરંજન ઝાંઝમેરા એ કહ્યું હતું., અમારા પ્રદેશ કાર્યાલય પર આપના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

સુરતમાં નિર્માણાધિન ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસને કેન્દ્ર સરકારની મંજૂરી

કોઈ પણ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડાયમંડ એક્સપોર્ટ કરી શકાશે

સુરત

ડાયમંડ નગરી સુરતના બજોદમાં નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સ આગામી દિવસોમાં ધમધમતું કરવાની તૈયારીના ભાગ રૂપે કસ્ટમ હાઉસને સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પહેલા ફેસની પરવાનગી આપી દેવામાં આવી છે. જેથી ડાયમંડ બુર્સનો કોઈ પણ વેપારી દેશના કોઈ પણ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડાયમંડ એક્સપોર્ટ કરી શકશે.

મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ હોવી એ બાબત હીરા ઉદ્યોગકારો માટે ગૌરવની બાબત ગણાય છે. પરંતુ સુરતના બજોદ ખાતે નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સ ભારત ડાયમંડ બુર્સને આખું પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સનું કામ હાલમાં અંતિમ તબક્કામાં છે અને આગામી દિવાળી તહેવાર સુધીમાં ધમધમતું કરી દેવામાં આવે તેવી શક્યતા છે. જેને પગલે ડાયમંડ બુર્સના વેપારીઓને ધંધામાં કોઈ સમસ્યા ઉભી નહીં થાય તે માટે અત્યારથી જ કેટલીક કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસને પ્રથમ ફેસની પરવાનગી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બીજા ફેસમાં નોટિફિકેશન અને ત્રીજા ફેસમાં કસ્ટમ દ્વારા એસઓપી નક્કી કરવામાં આવશે.



દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

1 LB \$20 વધુ દર LB ના \$6
 11 LB \$55 વધુ દર LB ના \$6
 23 KG \$185, વધુ દર KG ના \$10
 30 KG \$230, વધુ દર KG ના \$10

ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)
 519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2
 Chandni Chowk Plaza, ATN Wireless Board Door
 Open Last Unit Ours
 Phone
 647-761-1317,
 647-657-9631
 -----: MON-FRI : -----
 11.00 AM to 7.00 PM
 : SAT-SUN :
 1.00 PM to 6.00 PM

Scarborough
 WE ARE RE-OPENING
 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex,
 Phone
 647-761-1317
 647-657-9631
 905-673-9631
 -----: MON-THU : -----
 2.00 PM to 7.00 PM
 FRIDAY WEEKLY OFF
 : SAT-SUN :
 11.00 AM to 6.00 PM

Mississauga
 WE MOVED TO
 6800 REXWOOD ROAD, UNIT - D
 : Phone :
 905-673-9631
 647-761-1317
 647-657-9631
 -----: MON-FRI : -----
 9.30 AM to 5.00 PM

૬૪૭-૭૬૧-૧૩૧૭

www.firstflightcanada.com

HELP WANTED - HOTEL MANAGER

Looking for young single or couple for daily hotel operations. Students with work permit welcome to apply. Require Excellent customer services skill, Communication in English, Supervision skill, and work in Team. Good gross salary and free apartment on site too

Location : Sudbury

Email; sudbury_inn@yahoo.ca



સ્વદેશ
CANADA

Registration # 869127209
 Publication Mail Agreement /
 Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,
 Brampton ON L6S 0B4.
 416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi

Director : Nilesh Tailor

Sub Editor : Chhaya Gandhi

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.



નિષ્ફળતાઓની ચિંતા ના કરો: મલાઈકા અરોરા

મલાઈકા અરોરાએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં મોટિવેશનલ પોસ્ટ શેર કરતાં તે વાયરલ થઈ છે. મલાઈકા ની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મોટાભાગે ફેશન, ફિટનેસ અને ફિલોસોફીને લગતી પોસ્ટ જોવા મળે છે. પાપારાઝી ફોટોગ્રાફર્સની પણ તે મનપસંદ સ્ટાર છે જે તેના જીમ લુક કે સલૂન વિઝિટ લૂકને વારંવાર કેપ્શન કરતા હોય છે. મલાઈકાએ જેક કેનફિલ્ડનો એક ક્વોટ શેર કરતાં લખ્યું છે કે નિષ્ફળતાની ચિંતા ના કરો. તેને બદલે તમે એવી બાબતો વિશે ચિંતા કરો જેના માટે પ્રયાસ નહીં કરવાથી તમે તે ચુકી ગયા છે.



સ્પર્દેશ

FRIDAY, 06 MAY, 2022

36 કરોડનો ડ્રેસ પહેરવા કિમ કર્દાશિયાએ 21 દિવસમાં વજન ઘટાડ્યું



ફેશનની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલા 2022 યોજાયો છે, જેમાં 2 મે ની રાતે સિતારાઓ ખૂબ જ સુંદર સુંદર ડ્રેસમાં જોવા મળ્યા હતા. જેમાંથી દર્શકો અને લોકોની આંખો કોઈના પર અટકી હોય તો તે છે કિમ કર્દાશિયા, જેમણે પોતાના બોયફ્રેન્ડ પીટ ડેવિડસનની સાથે આ ઇવેન્ટમાં એન્ટ્રી કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વખતે તેમના ગ્લેમરસ લૂક કરતા તેમના વેટની ચર્ચા ચારેબાજુ થઈ હતી. કિમે મેટ ગાલામાં મેટેલિન મનરોના આઈકોનિક લુકને જ રિફ્રેશ કર્યું હતું. આ ગાઉનમાં પોતાને ફીટ કરવા માટે તેમણે વેઈટ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે 21 દિવસની અંદર જ 7 કિલો વજન ઘટાડ્યું હતું. કિમનો આ ગાઉન મેટેલિન મનરોની યાદ અપાવે છે, જે તેમણે 19 મે 1962 ના મેડસિન સ્કવાયર ગાર્ડનમાં રાષ્ટ્રપતિ જહોન એફ. કેનેડીના બર્થ ડે પરપોર્નસ માટે પહેર્યો હતો.

કરણ સાથેની કોફી થઈ પુરી, ફેન્સને હવે નહિ મળે બોલિવૂડની ચટપટી ગોસિપ



કરણ જોહરના પોપ્યુલર ટોક શો કોફી વિથ કરણના ફેન્સને ઝટકો લાગી શકે છે. કોફી વિથ કરણ શો ઘણા વિવાદો સાથે જોડાયેલો છે અત્યાર સુધી બોલિવૂડ સેલેબ્સના ઘણા રાજ ખોલવા માટે જાણીતા આ શોને હવે બાય બાય કહેવાનો સમય પણ આવી ચૂક્યો છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "હેલો, કોફી વિથ કરણ શો 6 સીઝનથી મારા અને તમારા જીવનનો એક ભાગ રહ્યો છે. મને એવું લાગે છે કે આ શો એ કંઈક તો પ્રભાવ પાડ્યો હશે, અને પોપ કલ્ચરના ઇતિહાસમાં ક્યાંક તો જગ્યા બનાવી છે, અને તેથી જ ભારે મનની સાથે આ અનાઉન્સ કરી રહ્યો છું કે, કોફી વિથ કરણ શો હવે પાછો શરૂ નહીં થાય." આ શોને લઈને એવી પણ જાહેરાતો હતી કે, આ શો માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરણના મહેમાન હશે. હવે કરણના આ મેસેજ પછી લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

ડબલ 'એ' સાથે કામ કરવું આજીવન સંભારણું

પંજાબી કુડી રકુલ પ્રીત સિંહે વર્ષ ૨૦૦૮માં દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો અને જોતજોતામાં ત્યાં જામી પણ ૨૦૧૮માં આવેલી 'અચ્ચારી'એ તેને વત્તાઓછા અંશે હિન્દી ફિલ્મોદ્યોગમાં સ્થાપી. પરંતુ તેના એક વર્ષ પછી આવેલી 'દે દે પ્યાર દે'એ બોલીવૂડમાં રકુલનું સ્થાન મજબૂત બનાવી દીધું. તાજેતરમાં જ રકુલની 'રનવે ૩૪' રજૂ થઈ. અભિનેત્રી માને છે કે આ મૂવીનું શૂટિંગ તેના માટે આજીવન સંભારણું બની રહેશે. બાર વર્ષથી પણ વધુ સમયથી ફિલ્મોમાં કામ કરતી હોવા છતાં રકુલ આજે પણ ફિલ્મની પસંદગી તેના માતાપિતાને પૂછ્યા વિના નથી કરતી. આનું કારણ સમજાવતાં તે કહે છે કે મને માત્ર એવી ફિલ્મોમાં જ કામ કરવાની ઈચ્છા છે જે લોકો સપરિવાર જોઈ શકે. અમે બંને ભાઈ-બહેન અમારા માતાપિતા સાથે બેસીને જે ફિલ્મ જોઈ શકીએ તે મૂવી બધા દર્શકો પરિવાર સાથે બેસીને જોઈ જ શકે. તે વધુમાં કહે છે કે કદાચ આ રીતે સિનેમાની પસંદગી કરવા જતાં તે એક દશક પુરાણી લાગે તોય મને કાંઈ વાંધો નથી. રકુલે 'રનવે ૩૪' ની પસંદગી વિશે જણાવ્યું હતું કે મેં અગાઉ 'દે દે પ્યાર દે'માં અજય દેવગણ સાથે કામ કર્યું હતું. તેમની સાથે ફરીથી કામ કરવાની વાતથી જ હું ઉત્સાહમાં આવી ગઈ હતી. વળી તેનું ડિગ્રેશન પણ અજય દેવગણ સ્વયં કરી રહ્યાં હતાં. મને તેની પટકથા પણ બહુ ગમી ગઈ હતી. તદુપરાંત તેમાં મને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક પણ મળી રહી હતી. આ ફિલ્મમાં આટલું બધું હોવાથી તે સ્વીકારતી વખતે મને બે વખત વિચારવાની પણ જરૂર નહોતી. 'રનવે ૩૪'માં રકુલને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો મોકો મળ્યો તેથી તે ફૂલી નથી સમાતી. તે કહે છે કે અમિતાભ બચ્ચન આજે પણ યુવાનોને શરમાવે એટલા ઊર્જાવાન ફિલ્મો પ્રત્યેનું તેમનું સમર્પણ કાબિલે તારીફ છે. તેઓ સેટ પર સમયથી પહોંચી જતાં અને શૂટિંગ પૂરું થયા પછી તુરંત નીકળી જવાની ઉતાવળ બલ્કે બીજા દિવસના સીન માટે રિહર્સલ કરવાનો આગ્રહ રાખતાં. ખરું કહું તો અભિનય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા બેજોડ છે. તે શૂટિંગ દરમિયાનનો એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે હું બિસ્કિટ નહોતી ખાતી તેથી અમિતાભ બચ્ચને મને ત્રણ જાર ભરીને સુકો મેવો આપ્યો હતો. અને એ જાર મેં યાદગીરી તરીકે સાચવી રાખ્યાં છે.



સિને જગતમાં અક્ષય કુમારના 30 વર્ષ પૂરાં, યશરાજ ફિલ્મ્સે પૃથ્વીરાજનું પોસ્ટર કર્યું શેર

એક્શન, કોમેડી, રોમાન્સ, બાયોપિક... એવી કોઈ શૈલી નથી જેમાં અક્ષય કુમારે અભિનય ન કર્યો હોય. બોલિવૂડ જેવા કઠિન ક્ષેત્રમાં 30 વર્ષ સુધી તમારી જાતને ટકાવી રાખવી અને દરેક શૈલીમાં તમારી ઓળખ બનાવવી એ સરળ કાર્ય નથી. 'સોગંધ' (1991) ફિલ્મથી મોટા પડદા પર પદાર્પણ કરવાથી લઈને ખિલાડી ફેન્સાઈઝીમાં એક્શન, હેરા ફેરીમાં કોમેડી, ટોચલેટ: એક પ્રેમ કથામાં મહત્વના મુદ્દાઓને લઈને અક્ષય કુમારે દરેક વખતે તેની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. જો કે આ વખતે YRFએ અભિનેતાને સિનેમામાં 30 વર્ષ પુરા કરવા પર સરપ્રાઈઝ આપ્યું છે. હકીકતમાં YRFએ અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું નવું પોસ્ટર શેર કરીને અભિનેતાના સિનેમામાં 30 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી.


શારા પહેરીને સલમાનની ઈદ પાર્ટીમાં પહોંચી કંગના

મુંબઈ: સલમાન ખાનની ઈદ પાર્ટીની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ વખતે ઈદ પાર્ટીનું આયોજન સલમાનની બહેન અર્પિતા અને જીજ્ઞા આયુષ શમરોએ કર્યું હતું. બોલીવૂડની તમામ હસ્તીઓ આ પાર્ટીમાં બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ જોવા મળી હતી અને હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કંગના રનૌત અવારનવાર પોતાના ઉત્સાહથી ચાહકોનું દિલ જીતી લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંગના રનૌતે સતત ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોને નિશાન બનાવ્યા છે. અને તેના આ વિસ્તમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. અને આ વિસ્તમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં કંગના રનૌત જે રીતે ઈદ પાર્ટીમાં પહોંચી છે ત્યારે લોકો તેને જોઈને ટ્રોલ કરી રહ્યા છે. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગના રનૌતે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આ દરમિયાન તેણે મીડિયા ફોટોગ્રાફર સામે જોરદાર પોઝ આપતી જોવા મળી હતી. શારા સૂટમાં તેણી ખૂબ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાંથી સામે આવેલા કંગના રનૌતના વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.



વેબ સીરીઝ માટે કિતી સેનન અને શ્રદ્ધા કપૂર વચ્ચે હોડ

મુંબઈ : શેખર કપૂરે ધ ઈમમોર્ટલ ઓફ મેલહુઆના હક્ક ખરીદી લીધા છે અને તેના પર વેબ સીરીઝ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ વેબ સીરીઝની ઘોષણા શેખર કપૂરે માર્ચ મહિનામાં જ કરી દીધી હતી. હવે તે વેબ સીરીઝ માટે સ્ટાર કાસ્ટ વિશે નિર્ણય લઈ રહ્યો છે. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, આ સીરીઝમાં સતીના રોલ માટે શેખર કપૂરે શ્રદ્ધા કપૂર અને કિતી સેનોનનો સંપર્ક કર્યો છે. આ બન્ને અભિનેત્રીઓ સાથે શેખર કપૂરે છેલ્લા બે મહિનાથી વાતચીત કરી રહ્યો છે. તેમની સાથે તેણે વેબ સીરીઝની વાર્તા અને પાત્ર પર પણ વિસ્તારમાં વાતચીત કરી છે. તેમજ બન્નેનો લુક ટેસ્ટ પણ લેવાઈ ગયો છે. એક ન્યૂઝ પોર્ટલના અનુસાર, આ વેબ સીરીઝમાં શિવ ખી પત્ની સતીનો રોલ બહુ મહત્વ ધરાવે છે. તેથી શેખર કપૂરે કોઈ દમદાર અભિનેત્રીને લેવા માંગે છે. તેણે શ્રદ્ધા કપૂર અને કિતી સેનોન બન્ને સાથે વાતચીત કરી છે. આ વેબ સીરીઝમાં સતીના પાત્રનું કાસ્ટિંગ થયા પછી જ શેખર કપૂરે ભગવાન શિવના રોલ માટે અભિનેતા અંગે નિર્ણય લેશે. જોકે આ બન્ને અભિનેત્રીઓ સાથે મેળ ખાતા અભિનેતા માટે પણ શેખર કપૂરની શોધ ચાલુ જ છે. શેખર કપૂરને આ વેબ સીરીઝના શૂટિંગ માટે એક સાથે તારીખ જોઈએ છીએ.





હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

રશિયા સામે લડવા માંગતા યુરોપીયન દેશોએ ગેસ અને તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધવા પડશે

યુરોપના દેશો સામે રશિયાનો આર્થિક ક્ષેત્રે મોરચો

રશિયા અને યુકેન વચ્ચેનું યુદ્ધ અપેક્ષા કરતાં વધુ ચાલ્યું છે. આ યુદ્ધ ક્યારે ખતમ થશે, તેની આગાહી કરવી પણ હવે મુશ્કેલ બન્યું છે. કારણ કે, ખરું યુદ્ધ આર્થિક મોરચે ચાલી રહ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લદાયા છે. કારણ કે યુકેન પર હુમલો કરવાના રશિયાના પગલાનો મહત્તમ દેશોએ વિરોધ કર્યો છે. જ્યારે તેનો મુકાબલો રશિયા ખનિજ તેલ અને કુદરતી વાયુનું વેચાણ રૂબલમાં કરીને કરી રહ્યું છે. રશિયા આમ કરીને એક કાંકરે ત્રણપક્ષી મારવા માગે છે. એક રશિયા ડોલરનો વિકલ્પ આપવા માંગે છે. રૂબલની ડિમાન્ડ વધવાથી ડોલર સામે રૂબલના ભાવો ઊંચકાઈ ગયા છે. જ્યારે યુરોપના દેશો દ્વારા યુકેનની મદદ કરવામાં આવી રહી છે તેનો બદલો રશિયા તેલ અને ગેસના વેચાણમાં દાદાગીરીથી વાળી રહ્યું છે. યુરોપના દેશો તેમની ખનિજ તેલ અને કુદરતી વાયુની જરૂરિયાતો માટે રશિયા ઉપર વધુ પડતા નિર્ભર છે.

૨૦૧૪માં રશિયાએ યુકેન ઉપર હુમલો કરીને તેનો ક્રીમિયા પ્રાંત પોતાની અંદર જોડી દીધો, તેના બદલામાં યુરોપના દેશો રશિયાના તેલ અને ગેસનો વિકલ્પ શોધી રહ્યા છે, પણ હજુ સુધી તેમને સફળતા મળી નથી. યુરોપના દેશોને તેમની જરૂરિયાતનું ૨૫ ટકા ખનિજ તેલ અને ૪૦ ટકા ગેસ રશિયા પૂરો પાડે છે. યુરોપને તેલ અને ગેસ વેચીને રશિયા રોજના ૮૫ કરોડ ડોલરની કમાણી કરે છે. રશિયાની જે આવક છે, તેમાં ૪૩ ટકા હિસ્સો તેલ અને ગેસનો છે. રશિયાનો ગેસ મેળવવા યુરોપના દેશોમાંથી પસાર થતી પાઈપલાઈન નાખવામાં આવી છે. જો રશિયા યુરોપને તેલ અને ગેસ વેચવાનું બંધ કરે તો યુરોપના દેશોમાં ઊર્જાની ભયંકર કટોકટી પેદા થાય તેમ છે. યુરોપના દેશો તેલ અને ગેસની ચૂકવણી યુરોમાં કે ડોલરમાં કરે છે, પણ રશિયા હવે તેમની પાસે રૂબલમાં ચૂકવણી માગી રહ્યું છે.

પોલાન્ડ અને બલ્ગેરિયાએ રૂબલમાં ચૂકવણી કરવાનો ઈનકાર કરતાં રશિયાએ તેનો બળતણનો પુરવઠો અટકાવી દીધો છે. યુરોપના દેશો રશિયન સરકારની માલિકીની ગાઝપ્રોમ નામની કંપની પાસેથી પોતાની જરૂરિયાતના તેલ અને ગેસ ખરીદે છે. યુરોપના દેશોની સરકાર કહે છે કે તેમણે રશિયન કંપની સાથે સોદો કર્યો ત્યારે ચૂકવણું યુરોમાં કે ડોલરમાં કરવાની શરત રાખવામાં આવી હતી. હવે



રશિયા રૂબલમાં રકમ માગી રહ્યું છે, કારણ કે અમેરિકા દ્વારા તેની બેન્કોના કારોબાર પર અંકુશ મૂકવામાં આવ્યો છે. રશિયાની બેન્કો ડોલરના હસ્તાંતરણ માટે સ્વિફ્ટ સિસ્ટમનો ઉપયોગકરી શક્તી નથી. પોલેન્ડે તો આ વર્ષના અંત સુધીમાં રશિયાના તેલ અને ગેસ પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાનું આયોજન કર્યું હતું. પોલેન્ડે પોતાના બંદર પર પ્રવાહી કુદરતી વાયુની સ્ટીમરોને લાંગરવાની સવલત ઉપલબ્ધ કરી નાંખી છે.

જ્યારે બલ્ગેરિયા કહે છે કે હમણાં તો તેની પાસે ગેસનો પૂરતો જથ્થો છે. પોલેન્ડ અને બલ્ગેરિયાને ખનિજ તેલની તકલીફ પડી શકે તેમ નથી. કારણ કે, બીજા દેશો પણ તે માટે તૈયાર છે. યુરોપના દેશને ચિંતા છે કે જો

પોતાનું ખાતું ખોલાવવું પડશે. તેમાં તેમણે ડોલરમાં કે યુરોમાં રકમ જમા કરાવવી પડશે. ગાઝપ્રોમ બેંક તેને રૂબલમાં બદલી આપશે. યુરોપના દેશો આ જ બેન્કમાં રૂબલનું ખાતું પણ ખોલાવશે. તેમાં રૂબલ જમા થશે.

આ રૂબલનો ઉપયોગ રશિયાને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. ગાઝપ્રોમ બેન્ક પાસે જે યુરો કે ડોલર આવશે તેનું તે વેચાણ કરીને રૂબલ ખરીદશે. યુરોપના દેશો દ્વારા સતત રશિયાના તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે. તેનું પેમેન્ટ નિયમિત સમયાંતરે કરવામાં આવતું હોય છે. યુકેનનું યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત પેમેન્ટની તારીખ નજીક આવી રહી છે. યુરોપના દેશો કહે છે કે તેઓ કરારની કલમ મુજબ ડોલર કે યુરોમાં જ

પ્રાસંગિક
ધવલ શુક્લ

યુકેનને મદદ કરનારા યુરોપીયન દેશોને રશિયાએ ખનીજ તેલ અને કુદરતી વાયુ બદલ રૂબલમાં ચૂકવણું કરવા દબાણ માંડ્યું છે. જેથી રશિયામાં મોટી આર્થિક કટોકટો સર્જાઈ નહીં અને અમેરિકાને યોગ્ય જવાબ મળી રહે

રશિયા પોલેન્ડ અને બલ્ગેરિયાની જેમ તેમનો પણ ગેસનો પુરવઠો અટકાવી દેશે તો તેમના દેશોમાં મોંઘવારી હદ બહાર વધી જશે. રશિયા દ્વારા નાખવામાં આવેલી નવી શરતો મુજબ યુરોપના દેશોએ રશિયાની ગાઝપ્રોમ બેન્કમાં

ચૂકવણી કરશે. જો રશિયા બળતણનો પુરવઠો બંધ કરી દે તો યુરોપમાં કટોકટી પેદા થઈ શકે છે. યુરોપના દેશો જેમ રશિયાના તેલ અને ગેસ પર નિર્ભર છે, તેમ રશિયાનું અર્થતંત્ર પણ તેની આવક પર નિર્ભર છે.

જો યુરોપના દેશો રશિયાથી આયાત કરવાનું બંધ કરી દે તો રશિયામાં આર્થિક કટોકટી પેદા થવાનું નિશ્ચિત છે. જો કે રશિયાએ ભારતને સસ્તા ભાવે ખનિજ તેલ વેચવાનો પ્રારંભ કરીને તેનો ઉપાય શોધી કાઢ્યો છે. જો યુરોપના દેશો રશિયાનો માલ ખરીદવાનો ઈનકાર કરે તો ભારત અને ચીન તે ખરીદવા તૈયાર છે. તેથી રશિયાને યુરોપના દેશોનો કોઈ પગલાની અસર થાય નહીં. અમેરિકાએ યુદ્ધની સજા તરીકે રશિયન બેન્કોને રિવિફ્ટ સિસ્ટમથી બાકાત કરી નાખી, તેના બદલાના રૂપમાં રશિયા દ્વારા યુરોપના દેશોને રૂબલમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે રશિયા દ્વારા પોલેન્ડને અને બલ્ગેરિયાને ગેસનો પુરવઠો બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. તે પણ રશિયા દ્વારા છેડવામાં આવેલા આર્થિક યુદ્ધના હથિયાર તરીકે મનાય છે. તેમ કરીને વ્લાદિમિર પુતિન પુરવાર કરવા માગે છે કે તેઓ યુરોપના દેશોને પણ પોતાની મરજી મુજબ નચાવી શકે છે.

વળી તેનું પેમેન્ટ ગાઝપ્રોમ બેન્ક દ્વારા કરવાની શરત કરીને તેમણે આ બેન્કને પણ વધુ આર્થિક પ્રતિબંધોથી બચાવી લીધી છે. અમેરિકા અને યુરોપ દ્વારા રશિયા પાસેથી તેલ કે ગેસ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જો રશિયા રૂબલમાં પેમેન્ટના મુદ્દે યુરોપના દેશોને તેલ અને ગેસ આપવાનું બંધ કરે તો તે પણ એક જાતના યુદ્ધની ઘોષણા જ હશે. યુરોપના અને અમેરિકાના દેશો દ્વારા યુકેનને સીધી નહીં પણ આડકતરી સહાય આપવામાં આવે છે, તેના કારણે યુકેન બે મહિનાથી રશિયા સામે ટકી રહ્યું છે. વિયેટનામ યુદ્ધની જેમ આ યુદ્ધ પણ લાંબુ ચાલે તો રશિયાને પણ આર્થિક નુકસાન થશે. હકીકતમાં યુરોપના દેશો રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદીને રશિયાને યુદ્ધમાં મદદગાર થઈ રહ્યા છે.

જો યુરોપના દેશો રશિયા પાસેથી ગેસ ખરીદવાનું બંધ કરે તો રશિયા મુશ્કેલમાં મૂકાઈ શકે છે. રશિયા પોતાનું તેલ સ્ટીમરો દ્વારા ભારત અને ચીનને મોકલી શકે છે, પણ ગેસ મોકલી શકે તેમ નથી, કારણ કે ગેસનું વહન પાઈપલાઈન વડે થાય છે. રશિયાથી કોઈ પાઈપલાઈન ભારત કે ચીન સુધી જતી નથી. રશિયાથી ભારત કે ચીન સુધી પહોંચે તેવી પાઈપલાઈન નાખવી હોય તો તેમાં દાયકા નીકળી જાય. જો યુરોપના દેશો રશિયા સામે લડવા માગતા હોય તો તેમણે ગેસ અને તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધી કાઢવા પડશે.

મેકઅપને પરફેક્ટ રાખવો છે? જાણો આ ટિપ્સ

મેકઅપ પ્રોડક્ટ્સ

ગરમીની એન્ટ્રી થઇ ચૂકી છે. પારો વધવાની અસર મેકઅપ ઉપર પડે છે. પરસેવો અને ચીકાશને કારણે મેકઅપ ફેલાઇ જવો એ સામાન્ય સમસ્યા છે. ગરમીમાં એવું તે શું કરી શકાય કે મેકઅપ પરફેક્ટ રહે.

સનસ્ક્રીન

ઉનાળામાં સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવાથી ત્વચાને નુકસાન થાય છે. રૂટિનમાં એસપીએફ 30વાળું સનસ્ક્રીન હોવું જોઈએ. સનસ્ક્રીનનો અલગથી ઉપયોગ ન કરવો હોય તો તમે એવા મોઇશ્વરાઇઝની પસંદગી કરી શકો જેમાં સનસ્ક્રીનનું પ્રમાણ સારું એવું હોય. ઘરેથી બહાર નીકળો ત્યારે તેને ચહેરાની સાથે ગળા અને હાથ ઉપર લગાવો. તમે કોલેજ ગોઈંગ ગર્લ હોવ અથવા વર્કિંગ હોવ તો પર્સમાં સનસ્ક્રીનની નાની ટ્યૂબ કે બોટલ રાખી શકો છો. વોટરપ્રૂફમાં જવાનું હોય તો વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો.



મેકઅપ પ્રોડક્ટ્સ : આપણને લિપસ્ટિકના પરફેક્ટ શેડ અથવા બ્લશ ગમતાં હોય છે. જ્યાં સુધી લિપસ્ટિક પૂર્ણ ન થઇ જાય અથવા બ્લશ ખરાબ ન થઇ જાય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કર્યે જ રાખીએ છીએ. ક્યારેય તેની એક્સપાયરી ડેટ આપણે ખેતા જ નથી. તો હવે દરેક મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ ઉપર એક વખત નજર કરી લો અને જરૂર લાગે તો તેને જરા પણ સંકોચ વગર ડસ્પોઝિશનમાં નાંખી દો.

બેઝ મેકઅપ : આપણે ત્વચાની સારસંભાળમાં તો ધ્યાન આપીએ છીએ પરંતુ મેકઅપ પ્રોડક્ટ ઉપર એટલું ધ્યાન આપતાં નથી. ઉનાળામાં ઓઇલ ફ્રી મોઇશ્વરાઇઝનો ઉપયોગ કરો. તેની સાથે ફાઉન્ડેશન પણ ઓઇલ ફ્રી પસંદ કરો. હવે ઓઇલ ફ્રી અને વોટરપ્રૂફ એમ બંને પ્રકારની મેકઅપ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તમને કેટલા પ્રમાણમાં પરસેવો થાય છે એ બાબતનું ધ્યાન રાખીને મેકઅપ પ્રોડક્ટ ખરીદો.

સ્કબનો ઉપયોગ કરો

ઉનાળામાં સ્કબ કરવાનું ટાળે છે. તેઓ એવું વિચારે છે કે એક્સફોલિએશનની શી જરૂર છે? પણ આ વાતને મગજમાંથી કાઢી નાખો. ઠંડીકતમાં ત્વચાને ગરમી દરમિયાન એક્સફોલિએશનની વધારે જરૂર પડે છે. બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ અને પોર્સના બ્લોકેજથી છુટકારો મળે છે. ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.

લોશન

ગરમીમાં પરસેવો થવાના ડરને લીધે યુવતીઓ મોઇશ્વરાઇઝ લગાવવાનું ટાળે છે, પરંતુ ત્વચા સોફ્ટ અને નરિશ્વ બની રહે એ માટે વોટર બેઝ મોઇશ્વરાઇઝનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારનું મોઇશ્વરાઇઝ ત્વચા એક્સોર્બ કરી લે છે તેથી ત્વચા ચીકણી લાગતી નથી. એ રીતે બોડી લોશન ઉપર પણ લાગુ થાય છે. ઓઇલ અને ગ્લિસરીન બેઝ લોશનનો ઉપયોગ કરશો તો તમારે ચીકાશનો સામનો કરવો પડશે.

શીર્ષક : વાદળ
કવચિત્રી : હિના મોદી

દૂર... દૂર...
એક ટેકરી પર
ઘનઘોર અંધકાર વચ્ચે-
ભયાનક વીજળીનાં ચમકારે,
ટીંબેથી ખરી પડ્યું...
બિચ્ચારું... એક વાદળ !

અફળાતું ચાલ્યું, ઝીંકાતું ચાલ્યું;
પર્વતોની ઠોકર ખાતું ચાલ્યું,
વહેતું ચાલ્યું -
ને, કહેવાયું-
આહલાદક ઝરણું.
દૂર... દૂર... ૦
વહેતું ચાલ્યું, દોડતું ચાલ્યું;
મોટી-મોટી ચઢાનોમાં હાફતું ચાલ્યું;
છોલાતું ચાલ્યું, ઘસાતું ચાલ્યું;
પથ્થરો સાથે પ્યાર કરતું ચાલ્યું,
ને, કહેવાયું-
ઝળઝળ ઝરણું.
દૂર... દૂર... ૦
ભોંકાતું ચાલ્યું, કણસતું ચાલ્યું;
સૂકાતું ચાલ્યું, મરતું ચાલ્યું;
અધમૂઆ શ્વાસે શ્વાસતું ચાલ્યું
ને, કહેવાયું-
રળિયામણું ઝરણું -
દૂર... દૂર... ૦
એક ટેકરી પર
ઘનઘોર અંધકાર વચ્ચે-
ભયાનક વીજળીનાં ચમકારે,
ટીંબેથી ખરી પડ્યું...
બિચ્ચારું... એક વાદળ !

સાયબર સુરક્ષા સંશોધકોએ AvosLocker રેન્સમવેરના નવા પ્રકારનો ખુલાસો કર્યો છે. જે અનપેરડ સુરક્ષા ખામીઓનો લાભ લઈને નેટવર્કમાં દાખલ થઈ સાયબર એટેક કરવા માટે એન્ટીવાઈરસ સર્વિસને પણ હાની પહોંચાડી બંધ કરે છે જેથી સીસ્ટમ પર એટેક કરવું ખુબ જ સરળ રહે છે.

Trend Micro સંશોધકો, ક્રિસ્ટોપર ઓર્ડોનેઝ અને એલ્વિન નીટોએ વિશ્લેષણમાં જણાવ્યું હતું કે Avast એન્ટીવાઈરસની એન્ટી-રૂટકીટ ડ્રાઈવર ફાઈલ (asWarPot.sys) નો ઉપયોગ કરીને સંરક્ષણ સોલ્યુશનને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. જેનો સૌપ્રથમ એટેક USA માં જોવા મળ્યો છે. વધુમાં, રેન્સમવેર Nmap NSE સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને Log4j નબળાઈ (Log4shell) માટે બહુવિધ એન્ટીપોઈન્ટ્સને સ્કેન કરવામાં પણ સક્ષમ છે.

AvosLocker રેન્સમવેર એ REvil રેન્સમવેર ફેમીલીમાંથી છુટા પડેલા હેકર ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેન્સમવેર નાણાકીય સેવાઓ અને સરકારી સુવિધાઓ સહિત યુ.એસ.માં નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્યાંકિત કરે છે.

Ransomware-as-a-Service (RaaS) દ્વારા જુલાઈ



2021 માં જણાવવામાં આવ્યું હતું કે AvosLocker રેન્સમવેર સીસ્ટમ પર એટેક કર્યા બાદ ડેટા એનક્રિપ્ટ કરે છે, ડેટા ની ચોરી કરે છે, ત્યાર બાદ નાણાકીય માંગણી કરે છે અને જો પીડિત નાણા ની ચુકવણી ન કરે તો તે ડેટા ની હરાજી કરે છે.

માર્ચ 2022 માં યુ.એસ. ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI) દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી અનુસાર રેન્સમવેર કાર્ટેલ દ્વારા દાવો કરાયેલા અન્ય લક્ષિત પીડિતો સીરિયા, સાઉદી અરેબિયા, જર્મની, સ્પેન, બેલ્જિયમ, તુર્કી, યુ.એ.ઈ., યુ.કે., કેનેડા, ચીન અને તાઈવાનમાં સ્થિત હોવાનું

કહેવાય છે.

ટ્રેન્ડ માઈક્રો દ્વારા એકત્ર કરવામાં આવેલ ટેલિમેટ્રી ડેટા દર્શાવે છે કે 1 જુલાઈ, 2021 અને ફેબ્રુઆરી 28, 2022 વચ્ચે ખાદ્ય અને પીણા ક્ષેત્ર સૌથી વધુ હિટ ઉદ્યોગ હતો, ત્યારબાદ ટેકનોલોજી, ફાઈનાન્સ, ટેલિકોમ અને મીડિયા વર્ટિકલ્સ આવે છે. રિમોટ સર્વર પર હોસ્ટ કરેલ HTML એપ્લિકેશન (HTA) ચલાવવા માટે Zohoના ManageEngine ADSelfService Plus સોફ્ટવેર (CVE-2021-40539) માં રિમોટ કોડ એક્ઝિક્યુશન ખામી માટેના શોષણનો લાભ લઈને હુમલા માટેના પ્રવેશ બિંદુને સુવિધા

આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સંશોધકો સમજાવે છે કે HTA એ એક અસ્પષ્ટ પાવરશેલ સ્ક્રિપ્ટનો અમલ કર્યો જેમાં શેલકોડનો સમાવેશ થાય છે, જે મનસ્વી આદેશો ચલાવવા માટે [કમાન્ડ-એન્ડ-કંટ્રોલ] સર્વર સાથે પાછા કનેક્ટ કરવામાં સક્ષમ છે. આમાં સર્વરમાંથી ASPX વેબ શેલ તેમજ AnyDesk રિમોટ ડેસ્કટોપ સોફ્ટવેર માટે ઈન્સ્ટોલરનો સમાવેશ થાય છે. જેમાંથી નેટવર્કને સ્કેન કરવા માટે ટૂલનો ઉપયોગ કરી એન્ટીવાઈરસ સોફ્ટવેરને નિષ્ક્રિય કરી તમામ એન્ટીપોઈન્ટ્સ પર રેન્સમવેર પેલોડને છોડવામાં આવે છે. જેથી તમામ નેટવર્કને હાની પહોંચે છે.

હાની પહોંચેલા એન્ટીપોઈન્ટ પર નકલ કરાયેલા કેટલાક ઘટકો Log4Shell રિમોટ કોડ એક્ઝિક્યુશન ફ્લો (CVE-2021-44228) માટે નેટવર્કને સ્કેન કરવા માટે Nmap સ્ક્રિપ્ટ અને બહુવિધ એન્ટીપોઈન્ટ પર દૂષિત બેચ સ્ક્રિપ્ટ પહોંચાડવા માટે PDQ નામનું માસ ડિપ્લોયમેન્ટ ટૂલ છે. બેચ સ્ક્રિપ્ટ તેના ભાગ માટે ક્ષમતાઓની વિશાળ શ્રેણીથી સજ્જ છે. જે તેને વિન્ડોઝ અપડેટ, વિન્ડોઝ ડિફેન્ડર અને વિન્ડોઝ એરર રિકવરી નિષ્ક્રિય કરવા ઉપરાંત સુરક્ષા ઉત્પાદનોના સલામત બૂટ અમલને અટકાવવા, નવું એડમિન એકાઉન્ટ બનાવવા અને રેન્સમવેર બાઈનરી લોચ કરી રહ્યા છીએ.

beinghumanmj

- લીંબુમાં ક્ષારીય ગુણ હોવાથી પેટમાંના સ્ટ્રાવિતએસિડને નાશ કરે છે પરિણામે અપચાની તકલીફ દૂર થાય છે. તેમજ ગળામાં અને પેટમાં બળતરા ઓછી થાય છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચો લીંબુનો રસ ભેળવીને પીવું.
- તુલસી એસિડિટીમાં થતી બળતરાથી રાહત અપાવીને પેટને આરામ પહોંચાડે છે. પેટ અને ગળામાંની બળતરાથી રાહત પામવા માટે તુલસીના ચાર-પાંચ પાનને ચાવીને ખાવા. થોડા પાણીમાં તુલસીના પાનને ઉકાળવા. આ પાણી હુંફાળું જ પીવું.
- મોટા ભાગે ભોજન પછી લોકો વરિયાળીનું સેવન કરતા હોય છે. વરિયાળી આહારને પચાવવામાં મદદગાર છે. તેમજ પેટ અને ગળાની બળતરામાં પણ ઠંડક આપે છે.
- ગોળ લાભકારી ઉપાય માનવામાં આવે છે. સેવન પાચનક્રિયાને તેજ કરીને એસિડિટીથી બચાવે છે. વધુ પડતું ભારી ભોજન ખાવાનું હોય તો ભોજન કરતા પહેલા ગોળની ગાંડી ખાઈ લેવી. તેમજ એસિડિટીના કારણે પેટમાં અને ગળામાં થતી બળતરાથી છુટકારો પામવા માટે ગોળની ગાંડી ખાઈ લેવી.
- એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં સમાયેલા

આ નુસખાથી મેળવો એસિડિટીમાં રાહત



નિયમિત ભોજનમાં એક વાડકી દહીંનો સમાવેશ કરવાથી એસિડિટીમાં રાહત થશે

એન્ટીઇન્ફલેમેટરી ગુણોથી એસિડિટીથી થતી બળતરાથી રાહતપહોંચાડે છે. જ્યૂસ બનાવવા માટે એલોવેરાનાપાનમાંથી પલ્પ કાઢી તેને પાણીમાં ભેળવી જ્યૂસ તૈયાર કરવો. દિવસમાં બે-ત્રણ વખત આ જ્યૂસનું સેવન કરવું.

■ અડધો ચમચો જીરણો ભૂક્કો, અડધો ચમચો તજન પોવાડર, એક ઈંચ આદુનો ટુકડો અને એક ગ્લાસ પાણી.

- એક તપેલામાં એક ગ્લાસ પાણી નાખવું તેમાં સમારેલો આદુ, જીરણો અને તજનો ભુક્કો નાખવો. ૫-૭ મિનિટ માટે ઉકાળવું. સ્વાદમાટે તેમાં ગોળ પણ નાખી શકાય. ઉકળે પછી ગેસ પરથી નીચે ઉતારી હુંફાળું પીવું.
- આમળા પર સંચળ લગાડીનેઆમળાનું સેવન કરવાથી ફાયદો થાય છે. આમળા ન હોય અને તેની પીપરમીન્ટ હોય તો પણ સેવન કરી શકાય છે.
- જે ફળોમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેનું સેવન કરવાથી રાહત થાય છે. કલિંગર અને કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેના સેવનથી પેટમાંના એસિડ પાતળું થાય છે જેથી આરામ અનુભવાય છે.
- ફૂદીનાના સેવનથી છાતીમાં થતી બળતરાથી રાહત થાય છે. ભોજન પછી ફૂદીનાના બે પાન ચાવીને ખાવા.
- દહીં પેટમાં થતા એસિડને રોકવામાં મદદ કરે છે. તેમજ પેટમાંની બળતરાને ઓછી કરવામાં કારગર છે. નિયમિત ભોજનમાં એક વાડકી દહીંનો સમાવેશ કરવાથી એસિડિટીમાં રાહત થાય છે.

ગુજરાતમાં મર્જરના નામે 6,000 સરકારી શાળા બંધ કરાઈ

ભરૂચમાં કેજરીવાલની સભા: દિલ્હીમાં ભાજપને પ્રાઈવેટમાંથી સરકારી શાળામાં એડમિશન લીધું હોવાનો દાવો

ભરૂચ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચના યાદવિયા ખાતે એક જનસભામાં હાજરી આપી હતી. આદિવાસી સંકલ્પ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં એક કરોડ કરતાં પણ વધારે આદિવાસીઓ રહે છે, સૌને મારા પ્રણામ. સાડા છ કરોડ ગુજરાતીઓને આ મંચ પરથી મારા પ્રણામ. પંજાબના વિજય બાદ આ મારી પ્રથમ જનસભા છે તો અમે

કેજરીવાલે ખાલિસ્તાની સમર્થકને જવાબદારી સોંપી: પાટીલ

ગાંધીનગર : ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સક્રિય થતાં ત્રિપાંખિયો વંગ જામવાનો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જનાદાર મજબૂત કરવા માટે કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. પાટીલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરાપ છે. કેજરીવાલે પાર્ટીમાં ખાલિસ્તાની સમર્થક માનસિકતા વાળા શખ્સને જવાબદારી સોંપી છે. ઠકીકતમાં અરવિંદ કેજરીવાલે મરાઠી સીઆર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા પર સવાલ ઉઠાવ્યો હતો. કેજરીવાલે આને ગુજરાતની જનતાનું ઘોર અપમાન ગણાવ્યું હતું.

આદિવાસીઓને સાથે રાખી રહ્યા મોટી વકત્તા કહી શકાય કે, દેશના 2 છીએ. આદિવાસીઓ પર ખૂબ જ સૌથી ધનવાન વ્યક્તિ પણ ગુજરાતના જુલમ થયા છે. પહેલા અંગ્રેજોએ કર્યા છે અને ગરીબ પણ ગુજરાતમાંથી જ છે અને હવે આ લોકો કરી રહ્યા છે. ભારે છે.'

વધુમાં કેજરીવાલે કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપ અમીરો સાથે ઉભા છે. તેઓ સત્તામાં છે ત્યાં સુધી તેમને વધારે અમીર બનાવી રહ્યા છે.

તમે અમારી પાર્ટીને એક તક આપો, અમે શાળાઓ બનાવીશું. હું તમને બધાને કહેવા માટે આવ્યો છું કે, કેજરીવાલ પણ ખૂબ ઈમોશનલ છે. જે સંબંધો બનાવે છે તે દિલથી બનાવે છે અને જિંદગીભર નિભાવે છે. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મર્જરના નામે 6,000 સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવી. શાળાઓની દીવાલો તૂટેલી છે. શિક્ષકો નથી. લાખો બાળકોનું ભવિષ્ય દાંવ પર લાગ્યું છે પરંતુ આ બધું બદલાઈ શકે છે.

એટીએસે બાવન ગેરકાયદે ઉથિયાર સાથે ૨૨ને ઝડપ્યા

ગાંધીનગર

ગુજરાત એટીએસ સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ઉથિયારોના વેચાણના રેકૉર્ડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એટીએસએ રાજ્ય બહારથી ગુજરાતમાં ઠલવાતા ઉથિયારોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ ગુજરાત એટીએસએ પર જેટલાં ઉથિયારો સાથે ૨૨ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ રાજ્યની બહારથી ઉથિયારો લાવ્યા હતા. જે બાદ આ ઉથિયારોને સૌરાષ્ટ્રમાં વેચતા હતા. જો કે, ગુજરાત એટીએસએ ઝડપેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના જ હોવાનું સામે આવ્યું છે.

માંગરોળ પાસે બે જૂથ વચ્ચે અથડામણ 8 મહિલા સહિત 21ને થયેલી ઈજા

માંગરોળ

માંગરોળ નજીકના શેરીયાજ બારા ગામે મહીયારા સમાજના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 8 મહિલા સહિત 21ને નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી આઠને જુનાગઢ રિફર કરાયા હતા. બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઘટના અંગેની મળતી પ્રાથમિક માહિતી મુજબ અત્રેથી 6 કિ.મિ. દુર આવેલા અને ત્રણેક હજારની વસ્તી ધરાવતા શેરીયાજ બારામાં આજે મોડી સાંજે છોકરાવની નાની એવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવમા

ફેઝલ મુસા શમા, ફરૂક હનીફ શમા, જેતુન મહેમુદ પટેલ, અકબર અયુબ ગોવાલસરી, સબ્બીર જાફર, સાબીરા મુસા ગોવાલસરી, અલ્તાફ જાફર, ફિરોઝ જાફર, ફરૂક ઈસા, સુલેમાન કાદર શમા, મહેબુબ પટેલ, ગફર ઈસા ગોવાલસરી, જેતુનબેન ગોવાલસરી, સાદીક ગફર, જુમા સુલેમાન, હુસેન સુલેમાન, હલીમા જાનીભાઈ, ખેડૂન મુસ્તાક શમા, હલીમા જુમા, સુખરા ઈસ્માઈલ, સુગરા જાફર સહિતનાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી આઠને રીફર કરાયા હતા. બનાવને પગલે ડીવાયએસપી કોડીયાતરે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગુજરાતમાંથી એક મહિનામાં ૫૦ હજારથી વધુ ચાર ધામની યાત્રાએ જશે

અમદાવાદ

અક્ષય તૃતિયાના દિવસથી સાથે બદ્રિનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી એમ ચાર ધામની યાત્રાનો પણ પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાંથી માત્ર મે મહિનામાં જ ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામની યાત્રા કરવા માટે પહોંચશે. ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓનો ધસારાને પગલે અમદાવાદથી દેહરાદૂનનું વન-વે એરફેર બમણું વધીને રૂપિયા ૧૪ હજાર, દિલ્હીનું વન-વે એરફેર રૂપિયા ૭ હજાર થઈ ગયું છે. યમનોત્રીના કપાટ ૩ મેના બપોરે ૧૨:૧૫, ગંગોત્રીના કપાટ ૩ મેના ૧૧:૧૫ અને કેદારનાથના કપાટ ૬ મેના સવારે ૬:૨૫, બદ્રિનાથના કપાટ ૮ મેના સવારે ૬:૧૫ના પુલ્યા હતા.

ગાંધીનગરમાં MBBસની વિદ્યાર્થીનીએ નવમાં માળેથી લગાવી મોતની છલાંગ

ગાંધીનગર

ગાંધીનગર મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નં.૮૦૨માં રહેતી ૨૦ વર્ષિય આસ્થા સંજયભાઈ પંચાસરે એનઆરઆઈ ક્વોટામાં એડમિશન લીધું હતું એમબીબીએસના ત્રીજા વર્ષમાં તે અભ્યાસ કરતી હતી. પરંતુ બીજા વર્ષમાં એટીકેટી પરીક્ષા આપી રહી હતી. સોમવારે તેણીનું એક પેપર પતી ગયું હતું ત્યારે મંગળવારે અન્ય વિષયની પરીક્ષા હતી જો કે, આ પહેલા જ મંગળવારે વહેલી સવારે આસ્થા હોસ્ટેલ બિલ્ડીંગના નવમાં માળના ધાબા ઉપર પહોંચી ગઈ હતી અને ત્યાંથી છલાંગ લગાવી દીધી

હતી. નીચે આરસીસી વર્ક હોવાથી આસ્થાનું માથું પણ ફાટી ગયું હતું. આ ઘટનાને પગલે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીનું આ પ્રકારે મોત થતા અન્ય સહપાઠીઓ પણ હેબતાઈ ગયા હતા. આ મામલે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આસ્થાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેણીના માતા-પિતા દુબઈમાં રહેતા હોવાથી નજીકમાં જ રહેતા તેના દાદાને આ મામલે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.

ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં દેશનું ચોથા ભાગનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની

દેશના ફાર્મા-હેલ્થ સેક્ટરમાં મહિલાઓને પૂરતી તક, યોગ્ય સ્થાન, પૂરતું વેતન મળવું જોઈએ

અમદાવાદ

દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે ૨૪ મિલિયન ડોલર દવાઓ નિકાસ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી અને તેમાંથી ૨૫% યોગદાન માત્ર ગુજરાતનું હતું તેમ કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે.

અમદાવાદ ખાતે યોજાયેલી એમ્પાવરમેન્ટ ઈન ફાર્મા એન્ડ હેલ્થકેર



સેક્ટરની રાષ્ટ્રીય કોન્ફરન્સનું સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, 'મહિલા સંબંધિત ફાર્મા ઈન્ડસ્ટ્રી સેક્ટરના પ્રત્યેકે રીપોર્ટમાં એમ નોંધવામાં આવ્યું છે કે મહિલાઓમાં આત્મવિશ્વાસનો

અભાવ છે એટલે તેમનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું નથી. પરંતુ હકીકત એ છે કે કેટલાક પુરુષોને મહિલાઓ પર વિશ્વાસ નથી. હું દાવા સાથે કહી શકું છું કે આ કાર્યક્રમની રૂપરેખા જેણે પણ તૈયાર કરી છે તે મહિલા નહીં હોય.

અન્ય ક્ષેત્રની માફક ફાર્મા-હેલ્થ કેર સેક્ટરમાં પણ મહિલાઓને મહત્તમ પ્રવેશ, યોગ્ય સ્થાન, પૂરતું વેતન, એકસમાન ઉજળી તક ઉપલબ્ધ થવી જોઈએ તે સમયની માંગ પણ છે.

મંજૂરી વગર રેલી કાઢવાના કેસમાં જિજ્ઞેશ-રેશમાને ત્રણ માસની કેદ

મહેસાણા

આંદોલનકારી તરીકે જાહેર જીવનમાં આવી હાલ રાજકારણી બની ગયેલા રેશમા પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીને મહેસાણામાં ૧૨ જુલાઈ ૨૦૧૭માં પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં સ્થાનિક કોર્ટે ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. આ મામલે કુલ ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે ૧૨ લોકો સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તમામ લોકોને કસૂરવાર ઠેરવીને સજાનું એલાન કર્યું છે. ૨૦૧૭માં સોમનાથ ચોકથી રેશમા પટેલ, જિજ્જેશ મેવાણી ઉપરાંત કન્હેયા કુમારે રેલી કાઢી હતી, પરંતુ તેના માટે પોલીસે કોઈ મંજૂરી નહોતી આપી. જેથી તમામ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું.

ચૂંટણી પહેલા બેઠક દીઠ સરવે કરવા ભાજપની ક્વાયત

સમન્વય બેઠકમાં સંઘ અને તેની ભગિની સંસ્થાઓએ બેઠકવાર ચૂંટણીલક્ષી ફિડબેક આપ્યા

અમદાવાદ

બુધવારે સાંજે અમદાવાદ સ્થિત RSSના હેડક્વાર્ટરમાં ગુજરાત પ્રાંતની સમન્વય બેઠકમાં સંતોષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અઢી કલાક મિટિંગ ચાલી હતી. બેઠકમાં કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ- ઉદ્યોગ ભારતી, વિશ્વ ભારતી, સંસ્કાર ભારતી સહિતની RSSની ભગિની સંસ્થાઓના આગેવાનો તરફથી ફિડબેક રજૂ થયાનું કહેવાયું હતું. અમદાવાદમાં સાંજની આ બેઠક પહેલા બી.એલ.સંતોષ ધંધુકાના ઝાંઝરકા ખાતે ભાજપના અનુસૂચિત જાતિ- SC મુોરયાના આગેવાનો અને કેટલાક ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ હતી.

બે બેઠકે એક વિસ્તારકને મોકલી વિગતવાર સર્વે કરાશે

RSS સાથે બેઠક બાદ ગુરૂવારે જેમને વિસ્તારક તરીકેની જવાબદારી સોંપવાની છે તેમની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભુય લેવલે વિસ્તારક નિયુક્ત કરીને પ્રત્યેક મતક્ષેત્રનો ડિટેલ સર્વે કરવા નિર્ણય કરાયો હતો. મળતી વિગત મુજબ બે બેઠક એક વિસ્તારક મોકલવામાં આવનાર છે. આ વિસ્તારકને ટૂંક સમયમાં જ જે તે મતવિસ્તારમાં મોકલી અપાશે.

સામાન્ય બેઠક ઉપર SC-STને ઉતારાઈ તેવી શક્યતા

વર્ષ 2017માં 14મી વિધાનસભાની ચૂંટણીમાં SC ટિર્ઝવ 13 પેકી 7 બેઠકો ઉપર ભાજપને જીત મળી હતી. જ્યારે 27 ST ટિર્ઝવ પેકી 10 જ બેઠકો મળી હતી. આગામી 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 182 પેકી 40 SC- ST ટિર્ઝવ બેઠકો ઉપરાંત સામાન્ય બેઠક ઉપર પણ આ વર્ગમાંથી આવતા ઉમેદવારને ઉતારશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

કપડવંજ તાલુકાના નિરમાલી ગંગરેપ વીથ મર્ડર કેસમાં 3 આરોપીને ફાંસી

2018ના ચકચારી બનાવમાં 1279 દિવસ બાદ કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

નડિયાદ

કપડવંજ તાલુકાના મોટી ઝેર ખાતે રહેતા ત્રણ સંતાનોની માતા પર ગંગરેપ કરી ફૂરતાપૂર્વક હત્યા કર્યાના બનાવમાં આજે સાડા ત્રણ વર્ષ બાદ કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપી આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. ઉપરાંત હાઈકોર્ટમાંથી ફાંસીની સજાની બહાલી ન આવે ત્યાં સુધી આરોપીઓને જેલમાં જ રાખવાનો અને સખત દંડ સાથે બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરાયો છે. આ બનાવમાં ત્રણ આરોપીઓમાંનો એક મરણ જનારના સગા ભત્રીજાએ કાકી પર બળાત્કાર કરી તેમની હત્યા કરવામાં મદદ કરી હતી.

નિરમાલી ગામના સંગીતાબેનના લગ્ન મોટી ઝેર ખાતે રહેતા મુકેશભાઈ દેવીપૂજક સાથે થયા હતા. મજૂરીકામ કરી જીવન ગુજારતા આ દંપતિને સંતાનમાં બે દિકરા અને એક દિકરી હતા. ગત ૨૮.૧૦.૨૦૧૮ના રોજ સાંજે સાડાછથી સાડા આઠ વાગ્યા દરમ્યાન સંગીતાબેનને ગામમાં જ રહેતા લાલાભાઈ ઉર્ફે કંકુડીયો રમેશભાઈ

વાદી,રહે. ઈન્દિરાનગરી, શીહોરા અને જયંતિભાઈ બબાભાઈ વાદી, રહે. ઈન્દિરાનગરી, શીહોરા, તા. કપડવંજ મોટી ઝેર ચોકડીથી પોતાની મોટર સાયકલ પર અપહરણ કરીને લઈ ગયા હતા. જેઓ નિરમાલી સીમ તરફ જઈ રહ્યા હતા તે સમયે સંગીતાબેનનો ભત્રીજો ગોપી ઉર્ફે ભલાભાઈ

સગા ભત્રીજાએ પણ આરોપીઓની સાથે મળી દુષ્કર્મ ગુજાર્યું હતું

ગીરીશભાઈ દેવીપૂજક જોઈ ગયો હતો. આથી તેને બંને શખ્સોને બૂમ પાડી ઉભા રહેવા જણાવ્યું હતું. પરંતુ બંને નિરમાલી સીમ તરફ ભાગી ગયા હતા.

ત્યારબાદ ગોપી નિરમાલી સીમ તરફ પાછળ પાછળ ગયા હતા. જ્યાં જયંતિભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક જયંતિભાઈનું મોટર સાયકલ પડેલું હતું. જેની પાસે લાલાભાઈ ઉભા હતા. આથી ગોપીએ તેના કાકી સંગીતાબેન વિશે પૂછ્યું હતું. તે સમયે

ખેતર બાજુથી આવી રહેલ જયંતિભાઈએ ગોપીને ચાલ તારી કાકી બતાવુ તેમ કહી જયંતિભાઈના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં મહિલા નિર્વસ્ત્ર અવસ્થામાં બેભાન પડેલા હતા. આથી ગોપીએ તમે આ શું કર્યું તેમ પૂછતા જયંતિભાઈએ અમે અમારુ કામ પતાવી દીધુ હવે તું પણ તારુ કામ પતાવી દે. અને જો તે અમારા કથ્થા મુજબ નહીં કર્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી ગોપીએ પણ પોતાની સગી કાકી પર બળાત્કાર કર્યો હતો. ત્રણેય શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો બાદ ગોપી અને લાલાભાઈએ મહિલાના હાથ પગ પકડી રાખ્યા હતા અને જયંતિભાઈએ સંગીતાબેનના ગળાના ભાગે પગ મુકી તેમની ફૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી.

આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઈ કિરણભાઈ નગીનભાઈ દેવીપૂજક (રહે. નિરમાલી)એ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેની તપાસમાં પોલીસે શંકાના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગૂનો કબૂલી લીધો હતો.

સુરત ગેસ લીકેજ કાંડની તપાસ માટે હાઈકોર્ટમાં PIL

અમદાવાદ

સુરતની સચિન જી.આઈ.ડી.સી.માં ઝેરી ગત જાન્યુઆરીમાં ગેસના લીકેજના કારણે છ મજૂરોના અપમૃત્યુ થયા હતા. આ કેસની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. હાઈકોર્ટે વિવિધ સરકારી વિભાગોને નોટિસ પાઠવી વધુ સુનાવણી ૧૭મી જૂનના રોજ નિયત કરી છે. રિટમાં આક્ષેપ કરાયો છે કે ગુજરાતમાં જોખમી કેમિકલ ઠાલવવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. સચિન જી.આઈ.ડી.સી. ગેસ લીકેજમાં સંગોવાયેલી મહારાષ્ટ્રની કંપનીને અગાઉ મહારાષ્ટ્ર સરકારે ક્લોઝર નોટિસ ફટકારેલી છે. તેથી આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો થાય અને તપાસ માટે સ્વતંત્ર સમિતિની નિમણૂક થવી જરૂરી છે.

સુરતમાં પત્નીનું ગળું કાપી પતિએ 22 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો

સુરત

ડિંડોલીમાં પતિએ પત્નીની ગળું કાપી હત્યા કરી પુત્ર પુત્રીને મૂકી નાસી છૂટ્યો છે. આ ઘટનામાં 22 વર્ષના લગ્નજીવનનો પતિએ અંત આણ્યો છે.

છેલ્લા 20 દિવસથી પતિ ઘરની બહાર રહેતો હતો. નશાની હાલતમાં અગાઉ પણ પુત્ર અને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ બુધવારે તેણે પત્નીની હત્યા કરવાના ઈરાદે પુત્રને નાસ્તો લેવા બહાર મોકલ્યો હતો અને પુત્ર બહાર જતા જ દરવાજો અંદરથી બંધ કરી પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. સુરત શહેરમાં આવેલ સોરી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની હંસાબેન જાલા 22 વર્ષ પહેલા સુરભાઈ જાલા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. તેમના સુખી લગ્ન

જીવનમાં દંપતીને પુત્ર અને પુત્રી હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે લાંબા સમય બાદ ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા અને છેલ્લા ચાર વર્ષથી પત્ની સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી. પતિ પત્નીને મળવા આવતો જતો રહેતો હતો. જોકે છેલ્લા 20 દિવસથી પતિ દારૂના નશામાં આવી પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરતો હતો. પતિ ભૂતકાળમાં પણ પત્ની સાથે અણબનાવને લઈને જીવલેણ હુમલો કરી ચુક્યો હતો. જોકે આજે સુરભાઈ જાલા પોતાની પત્નીના હત્યાના ઈરાદે ઘરે પહોંચ્યો હતો અને પુત્રને પૈસા આપી નાસ્તો લેવા મોકલ્યો હતો, ત્યાર બાદ પત્ની ઘરમાં એકલી હતી તે સમયે એકલતાનો લાભ લઈ પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી નાખી હતી. પતિ ત્યારબાદ બન્ને બાળકોને મૂકીને ફરાર થઈ ગયો હતો.

સંપતિવાન જરૂર બનો પણ ગામડાં અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં : મોદી

સુરતમાં એસઆરકે ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસમાં સમિટ અને એક્ટિવિઝમિશન

સુરત

સંપતિવાન જરૂર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિસંસ્કૃતિ આપણી જડ છે એમ સુરતમાં સરસાણા સ્થિત ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય એસઆરકે ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસમાં સમિટ અને એક્ટિવિઝમિશનનું વચ્ચુંલ ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

વિડીયો કોન્ફરન્સ મારફત પાર્ટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવા આહવાન કર્યું હતું. એગ્રોબેઈઝ



ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બનવા યુવાધનને પણ તેમણે અપીલ કરી હતી. સરદાર સાહેબનું સ્મરણ કરતાં જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કમી નથી આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રે ઉપયોગ કરવો પડશે. વડાપ્રધાને પાર્ટીદાર ગ્લોબલ સમીટના આયોજનને વધાવતાં

કહ્યું કે, રોજગાર, વ્યાપારવૃદ્ધિ અને નવા બિઝનેસની તકો આપતા સરદારધામની સરાહનીય છે. અન્નદાતા ઉર્જાદાતા બની કૃષિ આધારીત ઉદ્યોગોને અપનાવે એવી તાતી જરૂરીયાત છે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૂત સરોવરના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા પણ તેમણે ઉપસ્થિત સૌ શ્રીઓને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ મારફત સમિટને સફળતાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પાર્ટીદાર ગુજરાતની ખમીરવંતી અને મહેનતકશ પ્રજા છે. સ્વબળે સંઘર્ષ કરીને સમગ્ર વિશ્વમાં પાર્ટીદારોએ પાણી બતાવ્યું છે.

સંક્ષિપ્ત સમાચાર

CGSTની ટીમે બોગસ ઇનવોઇસના 156 કેસ કરીને 163 કરોડની ચોરી પકડી

અમદાવાદ: CGSTની ચોરીના કિસ્સાઓ વધી જતાં અધિકારીઓએ ટેક્સ ચોરી કરનારાઓ પર વિજિલન્સ વધારી દીધી છે. CGST નોર્થના અધિકારીઓએ બોગસ ઇનવોઇસ બનાવીને ટેક્સની ચોરી કરનારાઓને પકડીને ટેક્સની વસૂલાત કરી છે. સૌથી વધુ 156 કેસ બોગસ ઇનવોઇસના કરવામાં આવ્યા છે તેમાં 163 કરોડની ટેક્સ ચોરી પકડી છે જે પૈકી 12.60 કરોડની વસૂલાત કરાઈ છે. ટેક્સ ચોરીની સાથે બોગસ ઇનવોઇસ બનાવવાના કેસ વધુ કરવામાં આવતા કરચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બોગસ ઇનવોઇસ સિવાયના 24 કેસ કરવામાં આવ્યા છે જેમાં 14 કરોડની ચોરી પકડાઈ છે અને 6 કરોડની રિકવરી કરવામાં આવી છે. CGST નોર્થના અધિકારીઓ દ્વારા કુલ 183 કેસ કરવામાં આવ્યા છે જેમાં 19 કરોડની કુલ રિકવરી કરાઈ છે. સુપ્રોના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં વધુ કેસ કરવામાં આવશે. કેટલાક વેપારીઓ અને કંપનીઓ રડારમાં આવી ગઈ છે. રિકવરી કરવાની કામગીરી પણ વધારી દેવામાં આવી છે.

માંડવીના અરેઠમાં ઢોલના તાલે નાચી રહેલા વરરાજાને યમરાજ ભેટી ગયા

અમદાવાદ: સુરતમાં અરેઠ ગામે એક લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. વરરાજાનું જ મોત થઈ જતા પરિવારમાં ખુશીનો માહોલ દૂખમાં પરિણમ્યો છે. માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મીતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો. મંડપ મુહૂર્તના પ્રસંગમાં સાંજના જમણવારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ડીજેના કાર્યક્રમમાં બધા નાચતા હતા. તે દરમિયાન વરરાજા મીતેશભાઈ પણ જોડાયા હતાં. જેમને નાચતી વેળા અચાનક જ છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સંબંધીઓ મોટરસાઈકલ પર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતાં. જ્યાંથી ખારડોલી ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સૌરાષ્ટ્રમાં રફ હીરાનાં માલની ખેંચ, લાખો કારીગરોની રોજગારીને અસર

રાજકોટ: કેટલાક વૈશ્વિક પરિબળો અને સુરતનાં સ્થાનિક બજારનાં કારણોસર સૌરાષ્ટ્રની હીરા બજારમાં મંદીનો માહોલ ઉભો થયો છે તેનાં કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રામીણ ક્ષેત્રનાં લાખો કારીગરોની રોજગારી પર અસર થઈ છે. રફ હીરાની સપ્લાય ઘટી છે પરિણામે તેનાં ભાવ ઉંચા ગયા છે અને સામે તેવાર હીરાની માંગ પણ ઘટી છે. સૌરાષ્ટ્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં ખેતી બાદ હીરા ઉદ્યોગ બીજા નંબરનો ઉદ્યોગ છે જેના થકી લાખો યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. અમરેલી, બાબરા, જસદણ, ભાવનગર, લાઠી, ગઢડા, બોટાદ, શિહોર, ભાવનગર સહિતનાં શહેરો હીરા ઉદ્યોગનાં મહત્વનાં કેન્દ્રો છે. આસપાસનાં ગામોમાંથી યુવાનો હીરા ઘસવા માટે આ શહેરોમાં આવી રોજગારી મેળવે છે. સુરતનાં હીરા ઉદ્યોગ સાથે સૌરાષ્ટ્રનો હીરા ઉદ્યોગ જોડાયેલો છે.

ગોંડલ સૌરાષ્ટ્રનું ફૂટ ડિસ્પેચ સેન્ટર બન્યું વર્ષે 300 કરોડથી વધુના ફળોનું ટર્નઓવર


રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં ફૂટ માટેનું ડિસ્પેચ સેન્ટર હવે ગોંડલ બની ગયું છે. કોરોના પછીના સમયમાં બજારો ધીમે ધીમે ચાલુ થયા બાદ આ વર્ષમાં અહીં 290.15 કરોડનું ટર્ન ઓવર થઈ ચૂક્યું છે.એમાં એકલી કેરીનું વેચાણ 43 કરોડથી વધુનું રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રની દ્રાક્ષનું 68 કરોડનું વેચાણ થયું છે. હવે સૌરાષ્ટ્રભરના ફળના વેપારીઓ ગોંડલથી માલ ખરીદવાનું પસંદ કરવા લાગ્યા છે કારણ કે અહીંથી ખરીદેલું ફૂટ વેચાણ માટે તેમજ માર્જિન માટે ફાયદાકારક અને હિતકારક બને છે. ગોંડલમાં ફળોના આઠથી દસ મોટા વેપારીઓ છે.એ મહારાષ્ટ્રમાં દ્રાક્ષના બગીચાઓ રાખી લે છે અને કર્મચારીઓની નિયુક્તિ કરીને સિમલા, હિમાચલ અને કશ્મીરમાં સફરજનની વાડીઓ રાખી લે છે.

સોમનાથ મંદિરમાં હવે તમામ વ્યવહાર સંસ્કૃતમાં થશે, પ્રશિક્ષણ વર્ગોની શરૂઆત

સોમનાથ : સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણનું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ શરૂ થશે. દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટના પુજારી શુદ્ધ સંસ્કૃતની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહથી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે આ વિચારને અનુકરણમાં મૂક્યો છે. કાર્યક્રમનાં ઉદઘાટક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષાએ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃતમાં વસેલું છે. સંસ્કૃત દૂર જવાનો અર્થ એ છે કે, આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે.

મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ : હીટ સ્ટ્રોકથી 25ના મોત, વિદર્ભમાં સૌથી વધુ અસર

મુંબઈ
મહારાષ્ટ્રમાં આ વર્ષે હીટ સ્ટ્રોકથી અત્યાર સુધીમાં 25 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યાં છે. જે છેલ્લા 6 વર્ષોમાં સૌથી વધારે મોતનો આંકડો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાથી જ ખ્યાલ આવે છે કે, માર્ચ અને એપ્રિલમાં જ હીટ સ્ટ્રોકના 374થી વધારે કેસ નોંધાયા છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે, વાસ્તવિક આંકડો આનાથી અધિક હોઈ શકે છે. ભીષણ ગરમીના કારણે 15 લોકોના મોત થઈ ગયા છે. વિદર્ભના નાગપુરમાં 11, અકોલામાં 3 અને અમરાવતીમાં 1



મોત થયું છે. આ સિવાય મરાઠવાડામાં 6 અને ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં 4 મોત થયા છે. મરાઠવાડાના જાલનામાં 2 મોત, જ્યારે ઔરંગાબાદ, હિંગોલી, ઉસ્માનાબાદ અને પરભણીમાં 1-1 મોત

થયા છે. નાગપુર મંડલમાં સૌથી વધુ 295 હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. નાગપુર સહિત વિદર્ભમાં કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ચૂક્યો છે. એપ્રિલ મહિનામાં ચંદ્રપુરનું નામ વિશ્વના 5 સૌથી ગરમ શહેર તરીકે નોંધવામાં આવ્યું હતું. ચંદ્રપુરમાં ગરમીનો પારો 46.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યો હતો. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખાસ કરીને ચંદ્રપુર, અકોલા, યવતમાલ, વર્ધા, બ્રહ્મપુરી, અમરાવતીમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે.

ચારધામ યાત્રા શરૂ: દર્શને જતાં શ્રદ્ધાળુઓની મર્યાદા નક્કી થઈ

કેદારનાથ
ચાર ધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે અને આ યાત્રામાં દરરોજ કેટલા યાત્રિકો ભાગ લઈ શકશે તે ઉત્તરાખંડ સરકારે નક્કી કર્યું છે. પ્રવાસમાં ભીડના વ્યવસ્થાપન માટે સરકારે કરેલી આ વ્યવસ્થાને અમલમાં મુકવી પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ યાત્રામાં રેકોર્ડ ભક્તો દર્શન માટે ધામોમાં પહોંચશે. ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે ચાર ધામમાં જતા યાત્રિકોની સંખ્યા પર દૈનિક મર્યાદા લાદી છે અને હવે પોલીસે

મુસાફરોને આ મર્યાદાને ધ્યાનમાં રાખવાની અપીલ કરી છે. આ વર્ષે ચાર ધામ યાત્રા વ્યવસ્થાની અંતર્ગત દરરોજ 15,000 તીર્થયાત્રીઓને બદ્રીનાથ જવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કેદારનાથની વાત કરીએ તો અહીં દરરોજ માત્ર 12,000 શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. એ જ રીતે ગંગોત્રીમાં દરરોજ 7000 અને યમુનોત્રીમાં 4000 તીર્થયાત્રીઓને મંજૂરી આપવામાં આવશે. ડીઆઈજી એસ નાગન્યાલનું કહેવું છે કે પોલીસ મુસાફરીની વ્યવસ્થા કરવા માટે તમામ પ્રયાસો કરશે.

જુનોમ સિક્વન્સિંગમાં કોરોનાના નવા XE વેરિએન્ટના કેસની પુષ્ટિ

નવી દિલ્હી
ભારતમાં કોરોના વાઈરસ મહામારીનું જોખમ ફરીથી વધી રહ્યું છે. કોરોના સેમ્પલને લઈને હાલમાં જ થયેલા જુનોમ સિક્વન્સિંગમાં કોરોનાના નવા એક્સઈ વેરિએન્ટના કેસની પુષ્ટિ થઈ છે. જેના કારણે એક્સપર્ટ્સમાં ચિંતાના લહેર છે. કોરોનાનો આ વેરિએન્ટ અનેક દેશોમાં નવા કેસ વધવાની કારણે બન્યો છે અને તે અત્યાર સુધીનો સૌથી ઝડપથી પ્રસારિત થતો વેરિએન્ટ છે. એશિયા અને યુરોપના અનેક દેશોમાં કોરોનાની ચોથી નો ભય શરૂ થઈ જ ગયો છે. સાઉદિ આરબમાં તેના

કેસ સૌથી ઝડપથી વધી રહ્યા છે, જેને જોતાં પાંચમી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો ભારતની વાત કરીએ તો, અહીં છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દરરોજ ત્રણ હજારની આસપાસ નવા કેસો સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિએન્ટ મળવો જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં કોરોનાના અન્ય વેરિએન્ટની સરખામણીએ ઝડપથી પ્રસારિત થવાની ક્ષમતા છે. ચોક્કસથી આખા વિશ્વમાં તેના કેસ ઓછા છે પણ જે નવા કેસો સામે આવી રહ્યા છે, તેને જોતા તે જોખમ ઉભું કરી શકે છે.

જોધપુરમાં ઈદ વેળા હિંસા : કફરૂનો સમય બે દિવસ વધારાયો, ઈન્ટરનેટ સેવા બંધ

જોધપુર
ઈદનાં સમયે જોધપુરમાં હિંસા બાદ લગાવવામાં આવેલાં કફરૂનો સમય સીમા ૨ દિવસ વધારી દેવામાં આવી છે. આ સાથે જ ઈન્ટરનેટ પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. જોકે હિંસા બાદ હવે માહોલ શાંત છે. બુધવારે કોઈ અપ્રિય ઘટના નથી બની. પણ પોલીસ પ્રશાસન કોઈ જોખમ ઉઠાવવાં નથી ઈચ્છતું. તેથી કફરૂને ૬ મે સુધી વધારી દેવામાં આવ્યો છે. હિંસાનાં આ કેસ કોઈ અફવાઓ ન ફેલાય તે માટે નેટબંદીને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે. હિંસા બાદ શહેરનાં ખુણે ખુણે પોલીસની ચાપતી નજર છે. કફરૂ નિયમોને સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા આપનારા સ્ટૂડન્ટ્સને સ્કૂલ આવવાં જવાની છૂટ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં બેઠકોની સંખ્યા ૮૩થી વધારીને ૯૦ કરવા પ્રસ્તાવ

નવી દિલ્હી
જમ્મુ કાશ્મીરમાં ૩ સભ્યોના સીમાંકન આયોગે તેમના કાર્યકાળના અંતના એક દિવસ પહેલા ગુરૂવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા બેઠકોના પુનઃનિર્ધારણ સંબંધિત તેના અંતિમ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. જસ્ટિસ (નિવૃત્ત) રંજના દેસાઈના નેતૃત્વ હેઠળના પંચે કેન્દ્રશાસિત પ્રદેશમાં બેઠકોની સંખ્યા ૮૩થી વધારીને ૯૦ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં ૨૪

સીટો છે જે હંમેશા ખાલી રહે છે. માર્ચ ૨૦૨૦માં કેન્દ્ર દ્વારા રચાયેલી પેનલ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષતામાં છે અને તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને નાયબ ચૂંટણી કમિશનર ચંદ્ર ભૂષણ કુમાર, રાજ્ય ચૂંટણી કમિશનર (એસઈસી) કેકે શર્મા અને મુખ્ય ચૂંટણી અધિકારી હેદેશનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં આયોગનો કાર્યકાળ ફરીથી ૨ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. અગાઉ તેમનો કાર્યકાળ ૬ માર્ચ પૂરો થવાનો હતો.

સ્પાઈસજેટની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે જોરદાર આંચકો લાગ્યો, 40 યાત્રી ઘાયલ

મુંબઈ
સ્પાઈસ જેટની મુંબઈ-દુર્ગાપુર ફ્લાઈટમાં રવિવારે એરપોર્ટ પર ઉતરતી વખતે વાતાવરણમાં પલટો આવતા વિમાનમાં મુસાફરી કરતાં ઓછામાં ઓછા 40 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાંથી 10 મુસાફરોની હાલત ગંભીર છે. સૂત્રોએ જણાવ્યું કે ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 1 મેના રોજ



સ્પાઈસ જેટનું બોઈંગ B737 એરક્રાફ્ટ મુંબઈથી દુર્ગાપુર જતી ફ્લાઈટ SG-945નું સંચાલન કરતી વખતે એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. તે સમયે

વાતાવરણમાં ગંભીર વિક્ષેપ સર્જાયો હતો જેના કારણે દુર્ભાગ્યવશ કેટલાક મુસાફરોને ઈજા પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન ઘણા મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. સીટોની ઉપર રાખેલો સામાન નીચે પડી જતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. જોકે પાઈલોટ્સની સૂઝબૂઝને કારણે મુસાફરોથી ભરેલા પ્લેનને યોગ્ય રીતે તોફાનમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આરબીઆઈના રેપોર્ટ વધારીને 4.40 ટકા થયો આરબીઆઈએ રેપોર્ટ વધારી દેતાં હોમ સહિત તમામ લોન મોંઘી થશે

મુંબઈ
ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે અચાનક લગભગ ચાર વર્ષ પછી રેપોર્ટમાં ૪૦ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જેને પગલે હવે બેન્કો તેમના પરનો આ બોજ ગ્રાહકો પર નાંખશે તો હોમ, ઓટો, પર્સનલ સહિત તમામ લોન મોંઘી બનશે અને ઈએમઆઈમાં પણ વધારો થશે. આરબીઆઈએ કોઈપણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વિના એમપીસીસીની ઈમર્જન્સી બેઠકમાં રેપોર્ટ અને સીઆરઆરમાં ફેરફાર કર્યો હતા. રેપોર્ટમાં ૪૦ બેસીસ પોઈન્ટનો વધારો કરતાં તે ૪.૪૦ ટકા થયો હતો જ્યારે સીઆરઆર ૫૦ બેસીસ પોઈન્ટની વૃદ્ધિ સાથે ૪.૫૦ ટકા થયો હતો. પરિણામે લોકો અને કંપનીઓ માટે લોન લેવી મોંઘી બનશે. એમપીસીસીની આગામી બેઠક ૬-૮ જૂને યોજાશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસીસી)એ રેપોર્ટ અને સીઆરઆરમાં વધારો કરવા છતાં એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે.

શાહે સર્જિકલ સ્ટ્રાઈકને કરી યાદ કરતાં કહ્યું ભારત હવે સરહદો સાથે ચેડાં કરનારા લોકો સામે વળતી કાર્યવાહી કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત હવે સરહદો સાથે ચેડાં કરનારા લોકો સામે વળતી કાર્યવાહી કરનારા અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે જોડાઈ ગયું છે. શાહે સાથે જ પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું પણ ઉદાહરણ આપ્યું હતું.

સાંસદ નવનીત રાણાને મળ્યા જામીન, 11 દિવસ પહેલા થઈ હતી ધરપકડ

નવી દિલ્હી
હનુમાન ચાલીસા વિવાદ કેસમાં બુધવારે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણાને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે. રાણા દંપતીને જામીન મળ્યા બાદ અમરાવતી સ્થિત તેમના ઘરે ખુશીનો માહોલ છે. આ સાથે જ જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. જામીન આપતી વખતે કોર્ટે દંપતી માટે ઘણી શરતો પણ મૂકી છે. કોર્ટના આદેશ મુજબ રાણા દંપતી મીડિયા સાથે વાત કરી શકશે નહીં. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે દંપતી ફરી આવો કોઈ ગુનો નહીં કરે. લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાણાએ જાહેરાત કરી હતી કે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર જશે અને હનુમાન ચાલીસાના પાઠ કરશે.

આરબીઆઈના રેપોર્ટ વધારીને 4.40 ટકા થયો આરબીઆઈએ રેપોર્ટ વધારી દેતાં હોમ સહિત તમામ લોન મોંઘી થશે

મુંબઈ
ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે અચાનક લગભગ ચાર વર્ષ પછી રેપોર્ટમાં ૪૦ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જેને પગલે હવે બેન્કો તેમના પરનો આ બોજ ગ્રાહકો પર નાંખશે તો હોમ, ઓટો, પર્સનલ સહિત તમામ લોન મોંઘી બનશે અને ઈએમઆઈમાં પણ વધારો થશે. આરબીઆઈએ કોઈપણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વિના એમપીસીસીની ઈમર્જન્સી બેઠકમાં રેપોર્ટ અને સીઆરઆરમાં

ફેરફાર કર્યો હતા. રેપોર્ટમાં ૪૦ બેસીસ પોઈન્ટનો વધારો કરતાં તે ૪.૪૦ ટકા થયો હતો જ્યારે સીઆરઆર ૫૦ બેસીસ પોઈન્ટની વૃદ્ધિ સાથે ૪.૫૦ ટકા થયો હતો. પરિણામે લોકો અને કંપનીઓ માટે લોન લેવી મોંઘી બનશે. એમપીસીસીની આગામી બેઠક ૬-૮ જૂને યોજાશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસીસી)એ રેપોર્ટ અને સીઆરઆરમાં વધારો કરવા છતાં એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે.

અમારી સરહદો સાથે ચેડા થશે તો જડખાતોડ જવાબ આપીશું : અમિત શાહ

નવી દિલ્હી
શાહે સર્જિકલ સ્ટ્રાઈકને કરી યાદ કરતાં કહ્યું ભારત હવે સરહદો સાથે ચેડાં કરનારા લોકો સામે વળતી કાર્યવાહી કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત હવે સરહદો સાથે ચેડાં કરનારા લોકો સામે વળતી કાર્યવાહી કરનારા અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે જોડાઈ ગયું છે. શાહે સાથે જ પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું પણ ઉદાહરણ આપ્યું હતું.



ચીની મહિલા સાથે નેપાળમાં ક્લબ પાર્ટી કરતા રાહુલ ગાંધીનો વીડિયો વાઈરલ

રેપ પીડિતાને મદદને બદલે પોલીસ અધિકારીએ પણ તેના પર રેપ કર્યો

ભાજપે રાહુલને પાર્ટીમાં વ્યસ્ત રહેતા નેતા ગણાવ્યા તો કોંગ્રેસે બચાવ કર્યો

નવી દિલ્હી, તા.૩

દેશ મોંઘવારી, વીજકટોકટી સહિતની સમસ્યાઓથી ઘેરાયેલો છે તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસે ગયા છે એવા કોંગ્રેસના આક્ષેપો તેને જ ભારે પડી ગયા છે. કોંગ્રેસના આક્ષેપોના બીજા જ દિવસે ભાજપે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક ક્લબમાં પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે લખ્યું છે, વડાપ્રધાનને સલાહ આપનારા રાહુલ પોતે જ પાર્ટીમાં વ્યસ્ત



છે. બીજાબાજુ કોંગ્રેસે ખુલાસો કરતાં કહ્યું, મિત્રના લગ્નમાં જવું હજુ સુધી ગૂનો નથી. ભાજપના આઈટી સેલના વડા

અમિત માલવિયે તેમના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીનો એક ચીની મહિલા સાથે વાત કરતો વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, મુંબઈ પર હુમલા થયા હતા ત્યારે પણ રાહુલ એક નાઈટક્લબમાં હતા. તેમના પક્ષમાં કટોકટી સર્જાઈ છે ત્યારે પણ તે ત્યાં જ છે. તેમનામાં સાતત્યપણું છે. માલવિયે રાહુલનો વીડિયો ટ્વીટ કર્યા પછી સોશિયલ મીડિયા પર તે વાઈરલ થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓ રાહુલ ગાંધીની ટીકા કરવા કૂદી પડ્યા હતા.

ગંગેરેપનો ભોગ બનેલી સગીર વયની યુવતીની ફરિયાદ નોંધીને તેને મદદ કરવાની જગ્યાએ ખુદ પોલીસ અધિકારીએ જ પીડિતા પર રેપ કર્યો હોવાની હાહાકારી ઘટનાએ ઉત્તર પ્રદેશ પર ફરી ધબ્બો લગાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ચાઈલ્ડ લાઈનના કાઉન્સિલિંગમાં આ વાતનો ખુલાસ થયો હતો. પીડિતાની માતાના કહેવા પ્રમાણે યુપીના લલિત પુરમાં 22 એપ્રિલે ચાર વ્યક્તિઓ 13 વર્ષની કિશોરીને ફોસવાલીને ભોગવાઈ લઈ ગયા હતા. જ્યાં તેમણે ત્રણ દિવસ તેના પર રેપ કર્યો હતો. 25 એપ્રિલે ચારે આરોપીઓ પાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી

પાસે કિશોરીને છોડીને ભાગી ગયા હતા. આરોપ છે કે, અધિકારીએ કિશોરીને તેના માતા પિતાને સોંપવાની જગ્યાએ માસીને સોંપી હતી. એ પછી 27 એપ્રિલે કિશોરીને નિવેદન લેવા માટે બોલાવાઈ હતી અને પોલીસ મથક ઈન્ચાર્જ તિલકધારી સરોજે યુવતી પર રેપ કર્યો હોત. પીડિતાની માતાના કહેવા પ્રમાણે 30 એપ્રિલે ફરી કિશોરીને પોલીસ મથકમાં બોલાવાઈ હતી અને યુવતીને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપવામાં આવી હતી. સંસ્થાએ કિશોરીનું કાઉન્સિલિંગ કર્યું ત્યારે ઉપરોક્ત ઘટસ્ફોટ થયો હતો. એ પછી પોલીસે રેપ કરનારા 4 સાથે સાથે પોલીસ અધિકારી સામે પણ ગુનો દાખલ કર્યો છે.

ઉત્તર પ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર, 8નાં મોત



કાસગંજ

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના અશોકપુર હાઈ-વે પર એક બોલેરો અને ટેમ્પો સામસામા ટકરાતા ઘટનાસ્થળે જ 8 લોકોનાં મોત થયા હતા અને અન્ય 11ને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ પ્રવાસીઓને તત્કાલ નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જો કે તમામની હાલત ગંભીર હોવાના કારણે તે પછી તમામને જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ટેમ્પો અને બોલેરોમાં કુલ 19 લોકો સવાર હતા. આ અકસ્માત એ સમયે થયો હતો કે જ્યારે બોલેરોમાં બેઠેલા કાસગંજના લોકો ભોલે બાબાના સત્સંગમાં

સામેલ થવા માટે બહાદુરનગર જઈ રહ્યા હતાં. પટિયાલા ક્ષેત્ર પોલીસસ્ટેશનના તાબામાં આવતા અશોકપુર હાઈ-વે પર પૂરઝડપે આવતા બન્ને વાહનો ધડાકા સાથે ટકરાયા હતા, બન્ને વાહનો એટલી સ્પીડમાં હતા કે બન્ને વાહનોના ભુક્કા બોલી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જિલ્લાના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો. અહેવાલો અનુસાર અકસ્માતમાં 4 મહિલાઓ અને 2 બાળકોનો પણ ભોગ લેવાયો હતો.

દેશમાંથી થતી કુલ નિકાસનો 25 ટકાથી વધુ હિસ્સો ગુજરાત રાજ્યમાંથી થયો

9.63 અબજ ડોલરની નિકાસ સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશમાં અવ્વલ ક્રમ ઉપર રહ્યું

નવી દિલ્હી વર્તમાન કેન્દ્ર સરકાર જ્યારથી સત્તા ઉપર આવી છે ત્યારથી સ્થાનિક ઉત્પાદન ઉપર વધુને વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. અગાઉ, મેઈક ઈન ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે આત્મનિર્ભર ભારત થકી દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બને એવા ઉદ્દેશ સાથે ભારતના મૂડીરોકાણની નીતિઓ ઘડવામાં આવી છે. દેશના કેટલાક એવા રાજ્યો છે

જ્યાં અર્થતંત્રમાં વ્યાપાર અને ઉદ્યોગનો હિસ્સો મોટો છે. ગુજરાત તેમાં સૌથી આગળ છે. ગુજરાતમાં છેલ્લા સાત દાયકાથી ફાંમો, કેમિકલ્સ, કુડ ઓઈલ રીફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ જેવા ઉદ્યોગો સ્થપાયેલા છે. આ ઉપરાંત, દેશમાં સૌથી લાંબો દરીયાકીનારો ઉપલબ્ધ હોવાથી, દેશના અગ્રિમ હરોળના પોર્ટ અહીં કાર્યરત હોવાથી આયાત અને નિકાસમાં રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. દેશની નિકાસમાં આ આંકડો સૌથી વધુ છે.

આની સાથે એ પણ જાણવું જરૂરી છે કે દેશની કુલ નિકાસમાં ૨૭ ટકા એટલે કે દર ૩.૧૦૦ની નિકાસનો ચોથા કરતા પણ વધારે ભાગ ગુજરાત રાજ્યમાંથી વિશ્વના અન્ય ભાગોમાં પહોંચે છે. જાન્યુઆરી ૨૦૨૨ના ઉપલબ્ધ આંકડા અનુસાર ૯.૬૩ અબજ ડોલરની નિકાસ સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશમાં અવ્વલ ક્રમ ઉપર હતું. આવી જ રીતે, દેશની નિકાસમાં સિંહફાળો આપતા જિલ્લાઓમાં પણ ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે.

બિહાર યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 100માંથી 555 માર્ક આપી દીધા

નવી દિલ્હી પરીક્ષા આપનારા તેજસ્વી વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક મેળવવાની અપેક્ષા રાખતા હોય છે. જોકે બિહારની મુંગેર યુનિવર્સિટીએ એવું રિઝલ્ટ આપ્યું છે કે, તેની ચર્ચા ચારે તરફ છે. બિહારના જમુઈ જિલ્લાની કોલેજ મુંગેર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ કોલેજના વિદ્યાર્થી દિલિપ શાહે ગ્રેજ્યુએશનના ફાઈનલ યરની પરીક્ષા આપી હતી. ઈતિહાસના પેપરમાં 100માંથી 555 માર્કસ મળ્યા હતા. જ્યારે તેને કુલ 100માંથી 108 ટકા મળ્યા હતા. એક

વિદ્યાર્થીને પણ ઓનર્સના વિષયોમાં કુલ 800માંથી 868 માર્ક મળ્યા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર કરતા પહેલા અલગ અલગ સ્તરે તેની ચકાસણી થતી હોય છે આમ છતાં આવો છબરડો કેમ સર્જાયો તે અંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્યામા રોયનું કહેવું છે કે, બે વિદ્યાર્થીઓની માર્કશીટમાં આ પ્રકારની ભુલ છે અને આ ટેકનિકલ ખામી હતી. તેને સુધારી લેવામાં આવી છે. સુધારેલું પરિણામ ફરી વેબસાઈટ પર મુકી દેવાયું છે. આ મામલામાં કંટ્રોલર ઓફ એકઝામિનેશનને શો કોઝ નોટિસ પણ અપાઈ છે.

મધ્યપ્રદેશમાં ચોકલેટની લાલચ આપી દુકાનદારે બાળકી પર રેપ કર્યો

ઈન્દોર મધ્યપ્રદેશના મોરેના ખાતે દેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખિટોરા ગામમાં આજે 6 વર્ષની બાળકી પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. માસૂમ બાળકી પોતાના પિતા માટે બીડીનું બંડલ લેવા ગઈ હતી. આરોપી દુકાનદાર રિંકુ શર્માએ બાળકીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હતી. ત્યારબાદ તેને દુકાનની પાછળનાં રૂમમાં લઈ જઈ બળાત્કારની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

બિહારના બક્સરમાં એકસાથે ચાર લોકોની લાશ મળી આવતાં ખળભળાટ

પટના બક્સરમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરી દેનાર તસવીર સામે આવી છે. બિહારના બક્સરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એકસાથે 4 લોકોની લાશ મળી આવી છે. ગુરૂવારે સવારે બાબા ઘાટ પાસે લાશો ગંગાના કિનારેથી મળી આવી છે. એકસાથે 4 લોકોની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક લોકોએ લાશ મળી હોવાની સૂચના પોલીસને આપી હતી. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને કેસની તપાસમાં લાગી ગઈ હતી. જોકે આ લાશ કોની અને ક્યાંથી ગંગા નદીમાં આવી તે પ્રશ્નનો જવાબ હાલમાં કોઈ પાસે નથી.

બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક દેશમાં રૂપિયા 15,000 કરોડની મૂલ્યના કિંમતી ધાતુઓનું વેચાણ

નવી દિલ્હી કોરોના મહામારીના બે વર્ષ બાદ અખાત્રીજે દેશભરના સોના-ચાંદીના બજારમાં જોવા મળી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દેશમાં આજે લગભગ રૂ. 15,000 કરોડની મૂલ્યના કિંમતી ધાતુઓનું વેચાણ થયું છે. બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઈ

શક્યુ ન હતું, પરંતુ આ વખતે કોઈ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે. બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે દેશભરમાં સોના-ચાંદીનું લગભગ રૂ. 15,000 કરોડનો વેપાર થયો છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,900 અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 64,500 હતો, જે તેના ઓગસ્ટ 2020ના ઐતિહાસિક ઉચ્ચ ભાવથી નીચા છે.

કોલકાતાની કોર્ટમાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું

કોલકાતા કોલકાતા કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાનો દાવો કરતા વકીલોના એક વર્ગે એગ્રો-પ્રોસેસિંગ કંપની ક્વેન્ટર વતી હાજર રહેવા માટે પી. ચિદમ્બરમ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચિદમ્બરમ સામે વિરોધ ત્યારે કર્યો જ્યારે નેતા કોલકાતા ઉચ્ચ અદાલતમાંથી બહાર નિકળી રહ્યા હતા. વિરોધ કરી રહેલા વકીલોએ દાવો કર્યો હતો કે, ચિદમ્બરમ કોંગ્રેસ પાર્ટીની ભાવનાઓ સાથે રમી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પશ્ચિમ બંગાળ કોંગ્રેસના વડા અધીર ચૌધરીએ રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા મેટ્રો ડેવલપમેન્ટ શેરના વેચાણને ખાનગી કંપનીને કોર્ટમાં પડકાર્યા બાદ કંપની વતી કોર્ટમાં હાજર રહેવું તેમના માટે યોગ્ય નથી.

અઢી રૂપિયાની શિષ્યવૃત્તિ પર ભયેલો ઇજનેર

ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈકાકા.

ખેડા જિલ્લાના સોજીત્રા ગામના ખેડૂત ઘાભાઈના ઘેર એક દીકરો અવતર્યો. એને ભાઈલાલ નામ આપવામાં આવ્યું. ગામની જ પ્રાથમિક શાળામાં ભણવાની શરૂઆત કરી અને તે છ વર્ષનો થયો ત્યાં જ પિતાનું અવસાન થયું.

ખેતી કરતાં પુત્રએ ભણવાનું ચાલુ રાખ્યું. રાત્રે ખળામાં સૂઈ રહીને પાક સાચવતાં સાચવતાં અભ્યાસ કર્યો. બચપણમાં સત્સંગી સાધુઓનો પરિચય થયો.

ભાઈલાલ સાતમા ધોરણમાં આવ્યો ત્યાં જ માતાનું અવસાન થયું ! એવામાં છપ્પનિયો દુકાળ પડ્યો. હવે મોટાભાઈના ઘેર રહી અંગ્રેજી ચોથું ધોરણ(સાતમા પછી)નું પાસ કર્યું. અંગ્રેજી પાંચમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થતાં વડોદરા રાજ્યની અઢી રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા લાગી. વડોદરામાં એક રૂમ ભાડે રાખી બેત્રણ મિત્રો સાથે રહી કરકસર સાથે ભણતર ચાલુ રાખ્યું. મહિને આઠ રૂપિયાનું ખર્ચ અને શિષ્યવૃત્તિ માત્ર અઢી રૂપિયા.

એ દિવસોમાં મેટ્રિકની પરીક્ષા સીધી આપી શકાતી. મોટાભાઈને લાગ્યું કે ભાઈલાલ સીધી જ મેટ્રિક (આજની એસએસસી) પરીક્ષા પાસ કરે તો ઇજનેરી વિદ્યાશાળામાં પ્રવેશ મળે અને મહિને ૨૫ રૂપિયાની શિષ્યવૃત્તિ મળી જાય તો ખર્ચની ચિંતા ટળી જાય. ભાઈલાલે હા પાડી.

એ વખતે મેટ્રિકની પરીક્ષાનું કેન્દ્ર અમદાવાદમાં અને પરીક્ષાનું પરિણામ 'મુંબઈ સમાચાર'માં આવે. ખૂબ જ તૈયારી કરી ભાઈલાલે અમદાવાદમાં એક સગાના ઘેર રોકાઈ મેટ્રિકની પરીક્ષા આપી. તેઓ પાછા સોજીત્રા ગયા. એ દિવસમાં છાપું ત્રીજા દિવસે મળતું. બહુ ઓછા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તેમાં ભાઈલાલ પાસ થઈ ગયા.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યો પરંતુ પૂણેની ઇજનેરી કોલેજે પ્રવેશ ના આપ્યો. એ વખતે આઝાદીનો જંગ પરાકાષ્ટાએ હતો. એ જ ગાળામાં બંગબંગની શરૂઆત થઈ હતી. એ જ અરસામાં ગુજરાતના સાક્ષર ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીનો સ્વર્ગવાસ થયો. છાપામાં તેમના જીવનની વાતો આવી. તેમાં ગોવર્ધનરામનો સંકલ્પ પણ લખવામાં આવ્યો હતો. આ સાક્ષરે લખ્યું હતું કે 'સાહિત્ય સેવા માટે વાનપ્રસ્થ સ્વીકારવું, કમાણીનો લોભ છોડીને પણ માત્ર સાહિત્યસેવા કરવી.' ગોવર્ધનરામ ત્રિપાઠીએ

ધીકતી વકીલાત છોડીને પણ એમ જ કર્યું હતું. આ વાંચ્યા બાદ ભાઈલાલે પણ એ જ સંકલ્પ કર્યો કે, 'હે પ્રભુ ! એકાવન વર્ષે મને વાનપ્રસ્થ થવા બુદ્ધિશક્તિ આપજે.'

છેવટે ૧૯૦૮માં પૂણેની ઇજનેરી કોલેજમાં પ્રવેશ મળી ગયો. મહિને ૩૩ રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા લાગી. આર્થિક સંકડામણ ઓછી થઈ. ઇજનેરીના અભ્યાસ દરમિયાન જ ભાઈલાલે પુરાતત્વ વિષે એક લઘુ નિબંધ લખ્યો. કોલેજના અધ્યાપકો તો માનવા જ તૈયાર નહોતા કે એક વિદ્યાર્થી આવો નિબંધ લખી શકે.

ઇજનેરીના અભ્યાસ બાદ વડોદરાની શિષ્યવૃત્તિને કારણે ત્યાં જ નોકરી સ્વીકારી. તેમની નિમણૂક મહેસાણામાં થઈ. એ વખતે મહેસાણા વડોદરા રાજ્યમાં આવતું હતું. વડોદરામાં ફરજ સંભાળી લીધી તે દરમિયાન જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દુષ્કાળ રાહતકાર્યો નિહાળવા મહેસાણા આવ્યા. તે મુલાકાત વખતે મહારાજાએ બંગલાઓના વિગતવાર નકશાઓ અને અંદાજો પોતાની મુલાકાત વેળા જ તૈયાર કરી આપવા હુકમ કર્યો. બે મહિનાનું કામ હતું. ઓફિસ મૂંઝાઈ ગઈ પણ ભાઈલાલે કહ્યું : 'આપ કહો તો હું કરી દઉં.'

દિવસરાત મહેનત કરી ભાઈલાલે નકશા અને અંદાજોનું કામ પૂરું કરી દીધું. મહારાજા ખુશ થઈ ગયા.

થોડા વખત બાદ તેઓ બ્રિટિશ રાજ્યની સરકારી નોકરીમાં જોડાયા. તેમને ધુલિયા મુકામે નિમણૂક આપવામાં આવી. ધુલિયામાં કેટલાકને નવાઈ લાગી કે આ નવોસવો કોલેજમાંથી આવેલો છોકરો શું કામ કરશે ? પરંતુ ધુલિયામાં વર્ષોથી અટવાયેલાં કામ ઉકેલી નાખ્યાં. ભાઈલાલની પ્રશંસા થવા લાગી એટલે કેટલાક બળી જવા લાગ્યા.

તેમને પજવવા ઓફિસના એક અદેખા કર્મચારીએ ગોરા ઇજનેરને ચડવણી કરી તેમની બદલી આયંગર નામના ઇજનેરના હાથ નીચે કરી નાંખી. આયંગરે ભાઈલાલને અધરાં કામ સોંપ્યાં પણ ભાઈલાલે તે ઉકેલી નાંખ્યાં. કર્તવ્યપરાયણતા હંમેશાં જીતની હોય છે અને ઈર્ષ્યાળુઓનો હંમેશાં પરાજય થતો હોય છે. ડિપાર્ટમેન્ટે તેમની કદર કરી ૩૮ માણસોના સ્ટાફના તેમને વડા બનાવ્યા અને ૧૦૦ રૂપિયાના પગારમાં વધારો કરી મહિને દોઢસોનો પગાર કરી દેવાયો. એ વખતે સિંધુ નદી (હાલ તે પાકિસ્તાનમાં છે) પર વિશ્વની મોટામાં મોટી સિંચાઈ યોજનાને મંજૂરી મળી હતી.

આ યોજના પર યુવા ઇજનેર ભાઈલાલને મૂકવામાં આવ્યા. ભાઈલાલ મહારાષ્ટ્રથી સીધા સિંધ ગયા. સખ્ત ઠંડી અને ઊંટ પર બેસી સોળ સોળ માઈલની મુસાફરી કરવી પડે. જે વિશાળ અને લાંબી નહેર બનાવવાની હતી. તેમાં વચ્ચે સાત મસ્જિદો આવતી હતી. તેને હટાવવી જરૂરી હતી. ભાઈલાલે આ અત્યંત સંવેદનશીલ બાબત પોતાના હસ્તક લીધી. રૂઢિચુસ્ત લોકોને તેમણે પાટીદારની કુનેહથી



ભાઈકાકાને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જોડાવા નિમંત્રણ મળ્યું. ભાઈકાકાએ પોતાની શરતોએ કામગીરી સ્વીકારી. તેમણે અમદાવાદનાં કામોનો અભ્યાસ કર્યો. પરા વિસ્તારોને ગટરોની જરૂર હતી. 45 લાખનું ખર્ચ અંદાજવામાં આવ્યું. ભાઈકાકાએ એથીયે ઓછા ખર્ચે કામ પૂરું કરી આપવાની તૈયારી બતાવી, પણ રાજકારણીઓના કાવાદવાઓથી યોજના અટવાતી હતી.

સમજાવ્યા અને બધા જ માની ગયા. બધી જ મસ્જિદો દૂર કરી ત્યાં કેનાલો તૈયાર કરી. ગામો-મસ્જિદોનું પુનર્વસન પણ કરાવ્યું. નહેરો ખોદવાનાં યંત્રો ઈંગ્લેન્ડથી છુટ્ટા ભાગોમાં આવતાં. તેને જોડવામાં ગોરા ઇજનેરો પણ ગોથાં ખાઈ જતા. ભાઈલાલે સુંદર આયોજન કરી ગોરા ઇજનેરોને ચકિત કરી દીધા. એ જમાનામાં તેમણે રૂ. ૧ કરોડની બચત કરી આપી.

વિશ્વવિખ્યાત સક્કર બરાજ બંધ તૈયાર થઈ ગયો. કામ તો ચાલુ જ રહ્યું પરંતુ ૫૧ વર્ષની વય થતાં વાનપ્રસ્થનો સંકલ્પ યાદ આવ્યો. વળી સરદાર સાહેબનો સંદેશો આવ્યો કે, 'ગુજરાત આવી જાવ.'

નોકરીનાં પાંચ વર્ષ બાકી હોવા છતાં ભાઈલાલે રાજીનામું મૂકી દીધું. ભવ્ય વિદાય અપાઈ.

સિંધ છોડી ગુજરાત-અમદાવાદ આવ્યા. હવે લોકો તેમને 'ભાઈકાકા' કહેવા લાગ્યા.

ભાઈકાકાને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જોડાવા નિમંત્રણ મળ્યું. ભાઈકાકાએ પોતાની શરતોએ કામગીરી સ્વીકારી. તેમણે અમદાવાદનાં કામોનો અભ્યાસ કર્યો. પરા વિસ્તારોને

પ્રમુખ(મેયર)ને આ ગમ્યું નહીં તેથી સિટી ઇજનેરે ભાઈકાકાને અભિનંદન આપવાના બદલે વ્યંગ કર્યો : 'તમે જાણીબૂઝીને અંદાજમાં વધુ રકમ મૂકી હશે.'

હકીકતમાં પાંચ લાખના અંદાજો પૂણેના ઇજનેરોએ કાઢેલા હતા. નેતાઓને પૈસા ખાવા ના મળ્યા એટલે ભાઈકાકા મૂંઝાયાં હતા.

ભાઈકાકામાં સૌંદર્યદૃષ્ટિ પણ હતી. કાંકરિયા તળાવની આસપાસ ટેકરા હતા. નગરપાલિકા ટેકરા ખોદી કાઢવા વિચારતી હતી, પણ સિટી ઇજનેર તરીકે ભાઈકાકાએ ત્યાં જ મકાનો બનાવવાના બદલે કુદરતી ઢોળાવ પર બગીચા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મહામહેનતે બગીચા માટે રૂ. એક હજારની રકમ મંજૂર કરાવી.

એ વખતે અમદાવાદની પોળોમાં ડામરના પાકા રસ્તા બનાવવાનું કામ શરૂ થયું હતું. પોળો ખોદી નાંખી હોવાથી પોળોના નાકે રોડ પડી રહેતાં. ભાઈકાકાને રેલવે પાટથી મેટલ ઠાલવવા જતી ટ્રુકોને વળતામાં રોડાં ભરી લાવવા કહ્યું. કાંકરિયાની આસપાસના ઊંડા રસ્તા પૂરવા માંડ્યાં. મફતમાં પુરાણ થયું અને રસ્તાઓનું લેવલિંગ થઈ ગયું. કાંકરિયાની આસપાસના ટેકરાઓ પર બાગબગીચા બન્યા. વન-ટ્રી-હીલ, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલયના સંકુલ ઊભા કરી ભાઈકાકાએ આખાયે વિસ્તારને નંદનવન બનાવી દીધો.

અમદાવાદમાં કોટ વિસ્તારની બહાર દિલ્હી દરવાજાથી છેક શાહપુર દરવાજા સુધી જૂના જમાનાની ઊંડી ખાઈ હતી. દુશ્મનો હુમલો ના કરે તે માટે પહેલાંના સમયમાં આવી ઊંડી ખાઈઓ બનાવવામાં આવતી. જમાલપુરથી છેક દિલ્હી દરવાજા સુધી શહેરની આસપાસનો કોટ તૂટે તો જ આ શહેરનો વ્યવસ્થિત વિકાસ થઈ શકે એ ભાઈકાકાની દૃષ્ટિ હતી.

મુસ્લિમોનો સખ્ત વિરોધ હોવાથી આ યોજના ખોરંભે પડેલી હતી, પરંતુ ભાઈકાકાએ મુસ્લિમ લીગના સભ્યોનો અંગત સંપર્ક કરી તેમને પ્રેમથી સમજાવ્યા અને શહેરના વિકાસમાં સહભાગી બનાવવાયા. હલીમની ખડકી તોડતી વખતે અનેક અફવાઓ ફેલાઈ પણ ભાઈકાકાએ બધાંને કુનેહથી શાંત પાડ્યા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટાતા રાજકારણીઓ એ વખતે પણ ભાઈકાકાને મુક્તપણે કામ કરવા દેતા નહોતા. ધરોઈ યોજના અંગે

ભાઈકાકાએ આપેલી સલાહ પણ અવગણવામાં આવી. પરિણામે અમદાવાદને પીવાના પાણી માટે રૂ. ૪ કરોડથી વધુ રકમ આપીને મ્યુનિસિપાલિટીએ તેમાં જોડાવું પડ્યું.

ભાઈકાકા સ્થાનિક નેતાઓથી કંટાળ્યા હતા. એવામાં ૧૯૪૨ના એપ્રિલ માસમાં સરદાર સાહેબ અમદાવાદ આવેલા હતા. ભાઈકાકા એમને મળવા ગયા. સરદાર સાહેબે કહ્યું : 'ભાઈકાકા ! તમે શહેરનાં ઘણાં કામો કર્યાં, હવે ગામડાંઓનાં કામો કરો.'

ભાઈકાકા ઊભા થયા. સરદાર સાહેબે પૂછ્યું : 'ક્યાં જાવ છો ?'

'રાજીનામું આપવા.' ભાઈકાકાએ કહ્યું. સરદાર સાહેબે તેમને હાથ પર લીધેલાં કામો પૂરાં કરી છ મહિના પછી ગામડાંઓનું કામ શરૂ કરવા કહ્યું. પછી ભાઈકાકાએ ચારૂતર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્થાપ્યું. શિક્ષણ સંસ્થાઓ માટે આણંદ આસપાસની જમીનો પસંદ કરી. બાકરોલ ગામના આગેવાનોએ ભાઈકાકાના હાથમાં નકશો

ને પેન્સિલ આપી દેતાં કહ્યું : 'લો... નકશામાં લીટી દોરી દો અને પસંદ કરી લો જેટલી જમીન જોઈએ તેટલી.' સ્થાનિક આગેવાનોનો આટલો જબરદસ્ત વિશ્વાસ ભાઈકાકાએ સંપાદન કર્યો હતો. ૧૯૪૭ની ધનતેરસે કોઈ પણ જાતના ઠઠારા વિના એનું ખાતમુહૂર્ત થયું હતું.

ભાઈકાકા પરના ભરોસાના કારણે બિરલાથી માંડીને અનેક શ્રીમંતોએ દાનનો પ્રવાહ વહેવરાવ્યો. અહીં ડૉ. સી. વી. રામન આવ્યા, જયપ્રકાશ નારાયણ અને રાજાજી પણ આવ્યા. આંબાના ઝાડ નીચે વલ્લભવિદ્યાનગરના નકશા તૈયાર થયા અને અહીં સર્જાયું વલ્લભવિદ્યાનગર, જે આજે એક વટવૃક્ષ છે. ભાઈકાકા એક ઉમદા વ્યક્તિ, કુશળ ઇજનેર, શિક્ષણસંસ્થાઓના પ્રણેતા અને દૂરંદેશી નેતા પણ હતા. છેલ્લે છેલ્લે તેમનો જીવ નર્મદા યોજનામાં હતો. તેઓ કહેતા : 'મને ખાલી રૂ. ૪૦૦ કરોડ આપો, હું સરદાર સરોવર બંધ બાંધી આપું.'

૩૧-૩-૭૦ના રોજ ભાઈકાકા ૮૨ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી 'નર્મદા... નર્મદા' શબ્દો તેમના હોઠ પર હતા. આજે ભાઈકાકાની બરાબરીનો એક પણ ઇજનેર ગુજરાતમાં નથી.

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102

સાહને ધમકાવનાર પત્રકાર પર 2 વર્ષનો પ્રતિબંધ

વરિષ્ઠ પત્રકાર બોરિયા મજુમદાર પર પ્રતિબંધ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો નિર્ણય

મુંબઈ

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહને ઈન્ટરવ્યુ માટે ધમકી આપનાર પત્રકાર બોરિયા મજુમદાર પર BCCI બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. બીસીસીઆઈએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિએ આ મામલામાં મજુમદારને દોષિત ગણાવ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહી થઈ છે. સાહને ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યા પછી, મજુમદાર આ બાબતે તેમની સાથે વાત કરવા

માંગતા હતા, પરંતુ મજુમદારને ના પાડી દેતા ગુસ્સે ભરાયા હતા અને ઈન્ટરવ્યુ ક્યારેય નહીં કરવાની ધમકી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે વરિષ્ઠ પત્રકાર બોરિયા મજુમદાર પર રિદ્ધિમાન સાહને ધમકાવવા બદલ 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. તેમને કોઈપણ સ્ટેડિયમની અંદર જવા દેવામાં આવશે નહીં. તેમને બીસીસીઆઈ સંબંધિત કોઈપણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં. તમામ ખેલાડીઓને બોરિયા મજુમદાર સાથે વાત કરવાની પણ મનાઈ કરવામાં આવશે.



મોકલીને ઈન્ટરવ્યુની માંગણી કરી હતી, જેનો સાહાએ જવાબ ન આપ્યો અને પછી તેને મજુમદાર તરફથી ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. સાહાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સમગ્ર બાબતનો સ્ક્રીનશોટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

શું છે સમગ્ર મામલો ?

19 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાને તેમાં સ્થાન મળ્યું ન હતું. આ પછી વરિષ્ઠ પત્રકાર બોરિયા મજુમદારે સાહાને વોટ્સએપ મેસેજ મોકલીને ઈન્ટરવ્યુની માંગણી કરી હતી, જેનો સાહાએ જવાબ ન આપ્યો અને પછી તેને મજુમદાર તરફથી ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. સાહાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સમગ્ર બાબતનો સ્ક્રીનશોટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

દિલ્હીએ હૈદરાબાદને 21 રનથી હરાવ્યું

મુંબઈ

ઓપનર ડેવિડ વોર્નરે ટી20 ક્રિકેટમાં નોંધાવેલી વિક્રમી અડધી સદી બાદ બોલસંના શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સને અહીં રમાયેલી આઈપીએલની 50મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રનથી પરાજય આપ્યો હતો. દિલ્હીના ત્રણ વિકેટે 207 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદની ટીમ આઠ વિકેટે 186 રન નોંધાવી શકી હતી. હૈદરાબાદની ટીમ માટે માર્કરારમે 42 તથા પૂરને 34 બોલમાં 62 રનની ઈનિંગ રમી હતી. દિલ્હી માટે શાર્દુલ ઠાકુરે 44 રનમાં બે તથા ખલીલ એહમદે 30 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. વોર્નરે પોતાની જૂની આઈપીએલ ટીમ હૈદરાબાદ સામે આક્રમક બેટિંગ કરીને 58 બોલમાં 12 બાઉન્ડેરી અને ત્રણ સિક્સર વડે અણનમ 92 રન બનાવ્યા હતા. તેણે રોવમેન પોવેલ સાથે યોથી વિકેટ માટે 66 બોલમાં અણનમ 122 રનની ભાગીદારી નોંધાવી હતી. પોવેલે 35 બોલમાં ત્રણ બાઉન્ડેરી અને છ સિક્સરની મદદથી 67 રન ફટકારી દીધા હતા.

IPL 2022
29 મેના રોજ અમદાવાદમાં રમાશે ફાઈનલ



IPL 2022 પ્લેઓફ શેડ્યુલ

- 24 મે 2022 - ક્વોલિફાયર 1, કોલકાતા
- 25 મે 2022 - એલિમિનેટર, કોલકાતા
- 27 મે 2022 - ક્વોલિફાયર 2, અમદાવાદ
- 29 મે 2022- ફાઈનલ, અમદાવાદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પ્લેઓફને લઈને મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આ સિઝનના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.

મહિલા ટી20 ચેલેન્જ : આ ઉપરાંત જય શાહે માહિતી આપી છે કે આ વર્ષે ફરી મહિલા ટી20 ચેલેન્જ પણ શરૂ થઈ રહી છે, જે પુણેમાં યોજવાની છે. પહેલા એવી માહિતી હતી કે તે લખનઉમાં હશે, પરંતુ હવે તેનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 23 થી 26 મે સુધી ચાલશે જ્યારે ફાઈનલ 28 મેના રોજ યોજાશે.

બેંગ્લોરે ચેન્નાઈને 13 રનથી હરાવ્યું

મુંબઈ

આઈપીએલ 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. ચેન્નાઈ પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી ચેન્નાઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગયું છે. ઓપનર ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરતા આ ટૂર્નામેન્ટમાં સતત બીજી ફિફ્ટી ફટકારી હતી. જોકે, તે હાઈસ્કોરિંગ ઈનિંગ રમી શક્યો નહોતો અને 37 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. તેણે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે અણનમ 85 રન કર્યા હતા. બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં ધોનીની વિકેટ પડતાં જ કોહલીએ ભારે આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. ધોનીની વિકેટ ટર્નિંગ પોઈન્ટ સમાન હતી.

ઉમરાન મલિકની આગ ઝરતી બોલિંગ, 157 KMPHથી સીઝનનો સૌથી ફાસ્ટ ફેંક્યો બોલ



સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે દર વખતે પોતાની ફાસ્ટ બોલિંગથી લોકોને ચોંકાવી દીધા છે. ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં, ઉમરાન મલિકે 157 KMPHની ઝડપે બોલ ફેંક્યો, જે આ સિઝનનો સૌથી ઝડપી બોલ છે. ઉમરાન મલિકે દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લી ઓવર ફેંકી. આ ઓવરનો લગભગ દરેક બોલ 150થી ઉપરની સ્પીડનો હતો.

પોઈન્ટ્સ ટેબલ

ટીમ	મેચ	જીત	હાર	પોઈન્ટ
ગુજરાત	10	8	2	16
લખનૌ	10	7	3	14
રાજસ્થાન	10	6	4	12
બેંગલુરુ	11	6	5	12
દિલ્હી	10	5	5	10
હૈદરાબાદ	10	5	5	10
પંજાબ	10	5	5	10
કોલકાતા	10	4	6	8
ચેન્નાઈ	10	3	7	6
મુંબઈ	9	1	8	2

કેપ્ટન ધોનીએ હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા, સાંડે પ્રદર્શન કરવા આપ્યા સૂચનો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. બુધવારે રમાયેલી મેચમાં બેંગલુરુએ ચેન્નાઈને 13 રને હરાવ્યું હતું. મેચ બાદ જ્યારે MS ધોનીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે બોલરોના વખાણ કર્યા અને કહ્યું હતું કે, અમે તેમને 173 રન સુધી રોકીને સાંડે પ્રદર્શન કર્યું હતું પરંતુ બેટિંગે અમને નિરાશ કર્યા હતા.



સરદાર પટેલ - લોખંડી પુરુષ - પટેલને અનુલવો

શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, સરદાર તરીકે પ્રિય હતા, એક ભારતીય રાજનેતા હતા. એકતા, સન્માન અને પ્રતિષ્ઠાનો માણસ. તેમના નેતૃત્વ માટે ભારતના લોકો તેમના હંમેશા માટે ઝાણી રહેશે. સરદાર પટેલ વિશે બધા જાણે છે, પરંતુ હવે તેમને અનુભવવાનો સમય આવી ગયો છે. વલ્લભભાઈએ તેમના જાહેર જીવનની શરૂઆત અમદાવાદમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે કરી હતી અને તેઓ ભારતના ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન બન્યા હતા. માટે કહેવું જ જોઈએ કે પટેલે હંમેશા શરૂઆતથી શરૂઆત કરે છે અને રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં બિનશરતી પ્રેમ અને નિઃસ્વાર્થ કાર્યો સાથે માનવતાનું નેતૃત્વ કર્યું છે. જ્યારે પણ આપણે સરદાર પટેલ વિશે વિચારીએ છીએ ત્યારે ક્ષિતિજમાં નેહરુ દેખાય છે, જેમના માટે સરદાર પટેલે ઘણું બલિદાન આપ્યું હતું. લખતી વખતે, મને વારંવાર લાગે છે કે જો મહાન નેતાએ બલિદાન ન આપ્યું હોય તો શું? જો નિયતિએ જવાહરલાલને બદલે વલ્લભભાઈ પટેલની માંગણી કરી હોત, તો ભારત એક મોટી લીગમાં હોત અને સુપર પાવર હોત ? સંજોગો સૂચવે છે કે સરદાર પટેલે અયોગ્ય પ્રભાવ હેઠળ બલિદાન આપ્યું હતું, પરંતુ જ્યારે આપણે મહાન નેતાઓના ડીએનએની તપાસ કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે વાસ્તવિક નેતા જીવનના સૌથી સત્યમાં વિશ્વાસ કરે છે.

ઈન્ડો-કેનેડિયન પરિપ્રેક્ષ્યમાં, આપણે સરદાર પટેલને આપણામાં સાકાર કરવાની જરૂર છે, એકવાર સરદાર પટેલ તમારા માટે છે, જેને નસીબની જરૂર છે... સરદાર પટેલ નબળાઈમાં માનતા નથી, તે ખૂબ ખર્ચ કરે છે; જ્યારે તેણે આજીવન કરી, ત્યારે ન તો તેણે ગેરવાજબી પ્રશ્નો ના કર્યા અને ના જવાબો આપ્યા; વલ્લભભાઈએ હંમેશા અમને લોકો કોલ કરવાની હિમત કરે તે પહેલાં દોડવાની પ્રેરણા આપતા હતા, આ રીતે તેઓ જીવ્યા.

પ્રધાન પટેલ, બેરિસ્ટર એન્ડ સોલિસીટર

રિયલ મેડ્રિડના આખરી મિનિટોમાં ત્રણ ગોલ માંચેસ્ટર સિટી સામે રોમાંચક વિજય

મેડ્રિડ

સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે આખરી મિનિટોમાં ઉપરા-ઉપરી ત્રણ ગોલ ફટકારીને માંચેસ્ટર સિટી સામેની ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઈનલમાં રોમાંચક જીત હાંસલ કરી હતી. માંચેસ્ટર સિટીની ટીમ ૮૯ મિનિટ સુધી ૧-૦થી આગળ હતી અને તેઓ ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં નક્કી મનાતા હતા. જોકે રોડ્રિગોએ ૯૦મી મિનિટે અને ૯૧મી મિનિટે એમ બે મિનિટમાં બે ગોલ ફટકારતાં બાજી પડી હતી. નિર્ધારિત સમય બાદ ઈન્જરી ટાઈમમાં ૯૫મી મિનિટે બેન્ઝેમાએ પેનલ્ટીને ગોલમાં ફેરવતા રિયલને સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં ૩-૧થી

વિજય અપાવ્યો હતો. ફર્સ્ટ લેગ સેમિ ફાઈનલમાં માંચેસ્ટર સિટી ૪-૩થી વિજેતા બન્યું હતું અને બંને સેમિ ફાઈનલ્સના સ્કોર ભેગા કરતાં રિયલ મેડ્રિડે ૬-૫થી માંચેસ્ટર સિટીને હરાવીને ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તાજેતરમાં જ ઉપમું લા લીગા ટાઈટલ જીતી ચૂકેલી રિયલ મેડ્રિડ ક્લબ હવે ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં લીવરપૂલ સામે ટકરાશે. જે મેચ ૨૯મી મે ના રોજ પેરિસમાં યોજાશે. માંચેસ્ટર સિટીએ ફર્સ્ટ લેગની મેચ ૪-૩થી જીતી હતી અને સેકન્ડ લેગની મેચમાં ૩-૩થી મિનિટે રિયાદ મેહરાજના ગોલને સહારે સિટીની કુલ સરસાઈ ૫-૩ થઈ ગઈ હતી.

રશિયન સબમરીનોનો યૂક્રેન પર ફૂઝ મિસાઈલથી હુમલો

હથિયારોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા 6 રેલવે સ્ટેશનો પર હુમલો, રશિયાની તેલ નિકાસ પર તબક્કાવાર પ્રતિબંધ લાદવાનું આહવાન

ખારકિવ

રશિયન દળોએ પૂર્વ યૂક્રેનના વિવિધ શહેરો પર ભારે તોપમારો કર્યો હતો, જેના કારણે સંખ્યાબંધ લોકોનાં મોત થયા છે તેમજ ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તમે યૂક્રેન સેના માટે વિદેશી હથિયારો મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યૂક્રેનના 6 રેલવે સ્ટેશનો પર હુમલો કર્યો છે. જ્યારે બ્લેક સીમાં રહેલી રશિયન સબમરીને યૂક્રેનમાં 2 સ્થળો પર કેલિબર ફૂઝ મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયન સેનાએ લિવમાં હુમલાને કારણે વીજળીનો પૂરવઠો પ્રભાવિત થયો હતો. કારણ કે રોકેટ હુમલામાં 2 પાવર સબસ્ટેશનને ભારે નુકસાન થયું છે. આ સિવાય કિરોવોગ્રાડ



અને વિનિત્સિઆ ક્ષેત્રમાં પણ હુમલા થયાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન યુરોપિયન સંઘે રશિયા પર પ્રતિબંધોને વધારે આક્રમક બનાવવાની તૈયારી દાખવી છે. યુરોપીયન યુનિયનના ટોચના અધિકારીએ યૂક્રેન યુદ્ધ મુદ્દે પ્રતિબંધોના છટ્ટા સેટમાં રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ લાદવાનું આહ્વાન કર્યું છે.

પુતિનના ખાસ મેજર જનરલ આંદ્રેઈ સિમોનોવનું મોત

યૂક્રેને દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનના ખાસ મનાતા સૈન્ય પ્રમુખ જનરલ વાલેરી સિમોનોવ સોમવારે યુદ્ધમાં ઘવાયા છે. તો બીજી તરફ એવા અહેવાલ આવ્યા છે કે પુતિનના જ ખાસ મનાતા રશિયન સૈન્ય મેજર જનરલ આંદ્રેઈ સિમોનોવનું પાર્કિંગમાં મોત થયું છે. અહેવાલો અનુસાર રશિયન સેના કમાન્ડર વાલેરીને હેલિકોપ્ટરમાં બેલગોરોડ લઈ ગઈ છે. યૂક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાએ યૂક્રેનમાંથી બે લાખ બાળક સહિત 11 લાખ યૂક્રેનિયનને બંધક બનાવ્યા છે અને તેમને રશિયા લઈ જવાયા છે. જ્યારે રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે 24 ફેબ્રુઆરીથી હવે સુધીમાં રશિયાના કબજા હેઠળના ડોનબાસમાંથી 10,92,137ને રશિયા લવાયા છે. આ સંખ્યામાં 1,96,356 બાળક સામેલ છે.

રશિયાએ 4.5 મિલિયન ટન અનાજ અવરોધ્યું

યૂક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વિશ્વ સમુદાયને આ ચેતવણી આપી છે. કારણ કે રશિયન સેનાએ કાળા સમુદ્રના બંદરો પર પોતાની ઘોંસ વધારી છે અને અહીંથી જ હાબોનું આવાગમન એકદમ નિયંત્રિત કરી દીધું છે જેના કારણે ખાદ્યાન્નની નિકાસ પર સંકટ સર્જાયું છે. લગભગ 4.5 મિલિયન ટન અનાજ હાલ યૂક્રેનના બંદરો પર અટવાયેલું પડ્યું છે.

રાજકીય-કોમર્શિયલ યુઝર્સ ટ્રિવટર માટે રૂપિયા ચૂકવવા પડશે : મસ્ક

ન્યૂયોર્ક

દુનિયાના સૌથી મોટા ધનકુબેર ઈલોન મસ્કે ટ્રિવટર ખરીદ્યું ત્યારથી ટ્રિવટરની સર્વિસ અગાઉની જેમ મફત મળશે કે કેમ તે અંગે શંકા સેવાતી હતી. આ આશંકાઓનો ઈલોન મસ્કે પોતે જવાબ આપ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝર્સે ટ્રિવટરના ઉપયોગ માટે નાણાં ચૂકવવા પડે તેવી શક્યતા છે. જોકે, મસ્કે સામાન્ય યુઝર્સ અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

ઈલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, ટ્રિવટર સાધારણ યુઝર્સ માટે હંમેશા મફત રહેશે, પરંતુ કોમર્શિયલ/સરકારી

યુઝર્સે કદાચ થોડો ખર્ચ કરવો પડી શકે છે. ઈલોન મસ્ક આગામી સમયમાં ટ્રિવટરને ફેસબુકની જેમ નાણાં કમાવવાનું સાધન બનાવવા માગે છે. એક અહેવાલ મુજબ બેન્કો સમક્ષ મસ્કે મોનેટાઈઝેશન મારફત પણ ભંડોળ એકત્ર કરવાની તૈયારી દર્શાવી હતી. આ સિવાય મસ્કે વેરિફાઈડ ટ્વીટને ઈમ્પેડ અથવા ક્વોટ કરવા પર થર્ડ પાર્ટી વેબસાઈટ પાસેથી પણ નાણાં વસૂલવાની વાત કરી હતી. વધુમાં ટ્રિવટર ખાનગી માલિકીનું બન્યા પછી તેના બિઝનેસ મોડેલ અંગે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.

બેઈજિંગમાં કોરોના કેસ વધતાં નિયંત્રણો લદાયા: સ્કૂલ-રેસ્ટોરન્ટ-મેટ્રો બંધ કરાઈ

શાંઘાઈ

વિશ્વના તમામ દેશોમાં કોરોનાને કારણે અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ચીનના શાંઘાઈ બાદ હવે રાજધાની બેઈજિંગમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ રોકવા માટે સ્કૂલો, રેસ્ટોરન્ટ, બિઝનેસ સિવાય અનેક મેટ્રો સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોને વર્ક ફોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે.

બેઈજિંગમાં ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં



આવી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જેવા આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીનમાં કોરોનાની નવી લહેર પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે. બેઈજિંગમાં

ગુરુવારે કોરોનાના ૫૦ કેસ નોંધાયા હતા. બેઈજિંગના ચ્યાંગ જિલ્લામાં લોકોને વર્ક ફોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે. અહીંયા લગભગ ૩૫ લાખ લોકો વસવાટ કરે છે. તે લોકોને ભીડ-ભાડથી દૂર રહવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય બેઈજિંગના અન્ય જિલ્લામાં ટોંગઝોઉમાં પણ લોકોને વર્ક ફોમ હોમ માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ત્યાં કોઈ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યું નથી. ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

સ્પેનમાં પેગાસસથી વડાપ્રધાન, સંરક્ષણ મંત્રીના ફોન ટેપ થયા

મેડ્રિડ

જાસૂસી સોફ્ટવેર પેગાસસ અંગે સ્પેનમાં એક મોટા ખુલાસાથી હોબાળો મચી ગયો છે. પેગાસસ સોફ્ટવેરથી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને સંરક્ષણ મંત્રી માર્ગરીટા રોબલ્સનો ફોન એપ્રિલ ૨૦૨૧માં એક વખત હેક કરાયો હતો. વધુમાં સ્પેનના અધિકારીઓ અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને પણ નિશાન બનાવવાયા છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. પ્રમુખ ઓફિસના મંત્રી ફેલિક્સ બોલાનોસે કહ્યું, આ ગેરકાયદે દરમિયાનગીરી છે.

રિપોર્ટ્સ નવા નથી. અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો મોબાઈલ ફોન મે ૨૦૨૧માં બે વખત હેક થયો હતો. વધુમાં સંરક્ષણ મંત્રી માર્ગરીટા રોબલ્સનો ફોન એપ્રિલ ૨૦૨૧માં એક વખત હેક કરાયો હતો. વધુમાં સ્પેનના અધિકારીઓ અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને પણ નિશાન બનાવવાયા છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. પ્રમુખ ઓફિસના મંત્રી ફેલિક્સ બોલાનોસે કહ્યું, આ ગેરકાયદે દરમિયાનગીરી છે.

US ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડમાં રિચર્ડ વર્મા સામેલ

વોશિંગ્ટન

જો બાયડેને રિચર્ડ વર્માને ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિની ઈન્ટેલિજન્સ એડવાઈઝરી કાઉન્સિલ તેમના કાર્યાલયનો સ્વતંત્ર ભાગ છે. રિચર્ડ વર્મા હાલમાં માસ્ટરકાર્ડ માટે જનરલ કાઉન્સેલ અને ગ્લોબલ પબ્લિક પોલિસીના વડા છે. આ ભૂમિકામાં, તે યુનાઈટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વમાં કંપનીની કાનૂની અને રાજકીય કામગીરીની દેખરેખ રાખે છે.

100 વર્ષના વૃદ્ધે 100 મીટર દોડ માત્ર 26.34 સેકન્ડમાં પૂરી કરી

વોશિંગ્ટન

સામાન્ય રીતે તમે વૃદ્ધ લોકોને કહેતા સાંભળ્યા હશે કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે. જ્યારે દુનિયામાં એવા પણ લોકો છે જેઓ ઉંમરને લગતા તમામ ભ્રમને તોડીને નવી પ્રેરણા આપે છે. આ વિચોરનો અંદાજો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને જોઈને જાણી શકાય છે. જેમાં ૧૦૦ વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ દોડવાની સ્પર્ધામાં હવા સાથે વાત કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને યુઝર્સ દાંત

નીચે આંગળી દબાવવા માટે મજબૂર થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં દેખાઈ રહેલા ૧૦૦ વર્ષના વૃદ્ધે ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ન માત્ર ભાગ લીધો હતો પરંતુ આ રેસમાં વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ૧૦૦ વર્ષીય લેસ્ટર રાઈટ અમેરિકાની સૌથી જૂની ટ્રેક એન્ડ ફિલ્ડ મીટ પેન રિલેમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ૧૦૦ મીટરનું અંતર માત્ર ૨૬.૩૪ સેકન્ડમાં પૂરું કર્યું હતું.

ભારત અને ફ્રાન્સ G-20 ડ્રાફ્ટ હેઠળ મજબૂત સહયોગ જાળવવા માટે સંમત થયા

ફ્રાન્સ

નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતના સમાવેશ માટેના તેના સમર્થનને રિપિટ કર્યું હતું. એનએસજીમાં સામેલ થવાથી ભારતની પરમાણુ શક્તિ ઝડપથી વધવાની અપેક્ષા છે. આ સાથે જ ભારત અને ફ્રાન્સ જી૨૦ ડ્રાફ્ટ હેઠળ મજબૂત સહયોગ જાળવવા માટે સંમત થયા છે. ભારતે કહ્યું છે કે, તે એનએસજીમાં સામેલ થવાના તેમના પ્રયાસો પર નિર્ણય પર પહોંચવા માટે સભ્ય દેશો સાથે વાતચીત કરશે.

વર્ક પરમીટથી હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે

અમેરિકાએ ખતમ થતી ઇમિગ્રન્ટ વર્ક પરમિટને 18 મહિના લંબાવી

ન્યૂયોર્ક

અમેરિકામાં રહીને કામ કરતા ભારતીયો માટે બાઈડેન તંત્રે વધુ એક રાહતરૂપ જાહેરાત કરી છે. ચીન કાર્ડ ઈચ્છી રહ્યા હોય તેવા લોકો અને એચ-1બી વિઝા હોલ્ડર્સના જીવનસાથી કે જેમણે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ મેળવી લીધું હોય તેમના સહિત ઇમિગ્રન્ટ્સની વિવિધ કેટેગરીઝ માટે ખતમ થતી વર્ક પરમિટને 18 મહિના માટે આપોઆપ લંબાવી

આપવાની બાઈડેન તંત્રે જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલ આ પગલાથી હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે તેમ માનવામાં આવે છે. યુએસ સરકારના આ નિર્ણયથી તત્કાળ આશરે 87,000 ઇમિગ્રન્ટ્સને મદદ મળશે કે જેમનું વર્ક ઓથોરાઈઝેશન લેપ્સ થઈ ગયું છે અથવા તો આગામી 30 દિવસમાં લેપ્સ થઈ શકે છે.

બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્ય બાબતે ઘર્ષણ, 9 ઈજાગ્રસ્ત

ટાકા

બાંગ્લાદેશના પિરોજપુરમાં ચીનની કંપનીએ નિર્માણનો વિરોધ કરનારા સ્થાનિક લોકો વચ્ચે થયેલા વિવાદમાં 3 ચીની સહિત નવ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પિરોજપુરના મથબરિયામાં એક ડેમના નિર્માણ સ્થળ પર આ બબાલ થઈ થઈ હતી. સૂત્રો અનુસાર ઘટના ઉપજિલાના બદુરા ગામમાં ત્યારે શરૂ થઈ જ્યારે સ્થાનિક લોકોએ ચીની કંપની દ્વારા નિર્માણનો વિરોધ કર્યો હતો. ઈજાગ્રસ્ત ચીની નાગરિકોમાં મેનેજર મજમાઓ, પર્યવેક્ષક ચાંગ ડ્યુ, પર્યવેક્ષક લેઈ બો છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સ્થાનિક કાર્યકર્તાઓમાં મુહમ્મદ જિલ્લુર રહેમાન, મુહમ્મદ ઈલિયાસ, નિજામ સિકદર, માણિક, બહાદુર ઉકિલ અને જકારિયા ખાન સામેલ છે.

PM मोदीએ ભારત-નોર્ડિક સમિટમાં લીધો ભાગ

ઇકોનોમી, ટેકનોલોજી સહિતના વિષયો પર ચર્ચા થઈ : ફિનલેન્ડના વડાપ્રધાન મરીન સાનાને પણ મળ્યા

ડેનમાર્ક
ડેનમાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોપનહેગનમાં ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો દિવસ અમારા માટે નોર્ડિક ભાગીદારો સાથે જોડાવવાનો દિવસ હતો, જેના માટે વડાપ્રધાને ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ માહિતી આપી હતી કે, નોર્ડિક નેતાઓ સાથે વડાપ્રધાનની બેઠક તેમના નોર્વેના સમકક્ષ સાથેની બેઠક સાથે શરૂ થઈ હતી. ચર્ચા અને ભાગીદારીનું મુખ્ય કેન્દ્ર ઈકોનોમી અને તેના વિવિધ પાસાઓ હતા. તેનું બીજું ફોકસ



રિન્યુએબલ એનર્જી હતું. આ સંબંધો, સ્વાસ્થ્ય ક્ષેત્ર તેમજ ઉપરાંત ટેકનોલોજી અને રોકાણ ભારતમાં જળ સંસ્થાઓના કરી.

નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સના મરિન કોપનહેગનમાં મળ્યા હતા. ભારત અને ફિનલેન્ડ વચ્ચે વિકાસલક્ષી ભાગીદારી ઝડપથી વધી રહી છે. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ, ટેકનોલોજી અને આવા અન્ય ક્ષેત્રોમાં આ ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. PM મોદી અને ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડા પ્રધાનો કોપનહેગનમાં બીજી ભારત-નોર્ડિક સમિટ પહેલા ફોટો પડાવ્યો હતો. આ અંગે, વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે, સ્ટોકહોમમાં 2018 સમિટ પ્રથમ વખત હતી, જ્યારે ભારતે એક જ પ્લેટફોર્મ પર એક જૂથ તરીકે નોર્ડિક દેશો સાથે જોડાણ કર્યું હતું.



ભારતમાં રોકાણ કરો, આજે ચૂકશો તો પસ્તાશો

ડેનમાર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કમાં બિઝનેસ ફોરમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતા કહ્યું કે, આજે ચૂકી જશો તો પાછળથી 'ફોમો' જેવી સ્થિતિ થઈ જશે. વધુમાં વડાપ્રધાન મોદીએ અહીં ભારતીય સમાજને પણ સંબોધન કરતા કહ્યું કે, ભારતની તાકાત વધે છે ત્યારે દુનિયાની તાકાત પણ વધે છે. મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા હતા, જ્યાં ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફેડરિક્સને તેમનું ઉમળકાભરે સ્વાગત કર્યું હતું.

બર્લિનમાં બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ

બર્લિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બર્લિન પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ત્યાંના ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન એક બાળકીએ પીએમ મોદીએ પેઈન્ટિંગ બતાવી હતી. બાળકીએ પોતાના હાથથી બનાવેલી પીએમ મોદીની પેઈન્ટિંગ બતાવી હતી. પીએમ મોદીએ બાળકીને પૂછ્યું કે આ તસવીરને બનાવવામાં કેટલો સમય લાગશે. તો બાળકીએ કહ્યું કે આને બનાવવામાં લગભગ 1 કલાકનો સમય લાગશે. જે બાદ પીએમએ પ્રશ્ન કર્યો કે આ તસવીર કેમ બનાવી છે? તો બાળકીએ જવાબ આપ્યો, તમે મારા આઈડન છો.



મોદીએ આઈસલેન્ડના PM કેટરિન સાથે કરી મુલાકાત

આઈસલેન્ડ : મોદીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં આઈસલેન્ડના પીએમ કેટરિન જેકોબ્સડોટ્ટર સાથે દ્વિપક્ષીય બેઠક ચોંટી હતી. બંને નેતાઓએ ભૂઉષ્મીય ઉર્જા, અર્થવ્યવસ્થા, ઉર્જા, ખાદ્ય પ્રક્રિયા, ડિજિટલ યુનિવર્સિટીઓ સહિતના ક્ષેત્રોમાં આર્થિક સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આ ઉપરાંત, પીએમ મોદીએ લિંગ સમાનતાને પ્રોત્સાહન માટે PM જેકોબ્સડોટ્ટરના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રગતિ કે લિે અધ્યાત્મ કો પૈમાના બનાઈ

સન ૧૯૨૩, શિકાગો। એડવાટર બીચ હોટલ મેં બેઠક કે લિે નૌ વ્યક્તિ એકત્ર હુે। ઇન નૌ વ્યક્તિયોં મેં world's most successful financiers in terms of money, these financial giants almost literally ruled the world વે દુનિયા કે સબસે સફલ પૂંજીપતિ ઔર નિવેશક થે। અપાર સંપત્તિ કે ધની યે નૌ વ્યક્તિ ઁસ સમય દુનિયા પર રાજ કર રહે થે।

ગ્લેન બ્લૅંડ નામ કે એક લેખક ને અપની પુસ્તક 'સક્સેસ' મેં ઇસ ઘટના કા ઉલ્લેખ કિયા હૈ। ઇન નૌ વ્યક્તિયોં કે જીવન કે ઉત્તરાર્ધ જીવન કી જાંચ સે પતા ચલા કિ ૨૫ સાલ બાદ, ઇન ના વ્યક્તિયોં મેં સે તીન ને આત્મહત્યા કી, ૨ લોગ જૈલ મેં થે ઔર તીન દિવાલિયા હો ગર થે।

આપ ઢી ઁસે કઈ લોગોં કો જાનતે હોંગે જો કઢી અપને ક્ષેત્ર મેં બેતાજ બાદશાહ થે કિન્તુ જલ્દ ઢી અસફલતા કે ગર્ત મેં ગિરે ઔર કાલ કે ગાલ મેં વિલીન હો ગર।

યહાં સ્વાભાવિક રૂપ સે એક પ્રશ્ન ઉઠતા હૈ કિ ઁનકે વિનાશ કા કારણ ક્યા થા? શિક્ષા, સત્તા ઔર ધન કે શીર્ષ પર બેઠે ઇન પ્રભાવશાલી લોગોં કે જીવન મેં ક્યા કમી થી? અસીમિત સંસાધનોં કા અનવરત યોગ કરનેવાલોં કા યોગફલ શૂન્ય ક્યોં હુઆ? કેવલ ઢૌતિક સંપત્તિ, સાધનોં, સુવિધાઓં કો પ્રગતિ કા આધાર માનનેવાલે અંતતઃ નિરાશ તથા નિઃશેષ ક્યોં હોતે જા રહે હૈ? તો આખિર ક્યા હૈ પ્રગતિ કા સચ્ચા પૈમાના?

ઇસ પ્રશ્ન કે ઉત્તર મેં મધ્યકાલીન

સંત ગુરુ નાનકજી કહતે હૈ-
રામ નામ એક અંક હૈ,
સબ સાધન હૈ શૂન્ય;
એક ગર સબ ગર,
એક રહે દસ ગુન;
ઇસ પંક્તિ કા આશય હૈ કિ જિસ પ્રકાર એક અંક કે બિના શૂન્ય કા કોઈ મૂલ્ય નહીં હૈ, ઁસી પ્રકાર અધ્યાત્મ કે બિના અન્ય સાધન ઢી અર્થવિહીન હૈ।

ભારત કે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન કહતે હૈ- "The soul of our progress is the progress of our soul." આધ્યાત્મિક વિકાસ ઢી સચ્ચા વિકાસ હૈ।

ઇન મહાપુરુષોં, વિચારકોં યા કવિયોં કા પ્રગતિ કે સાધન યા ઉપકરણોં સે કોઈ વિરોધ નહીં હૈ। પર હાં, ઁનકા મત હૈ કિ યે સાધન-ઉપકરણ ઢી મૂલ્યવાન હોંગે યદિ ઇન્હેં આધ્યાત્મિકતા કે સાથ જોડ દિયા જાે।

ભારત કો વિકસિત દેશોં કી શ્રેણી મેં લાને કે લિે વિશ્વ પ્રસિદ્ધ પરમાણુ વૈજ્ઞાનિક ઔર ઁગોલશાસ્ત્રી શ્રી અબ્દુલ કલામ સાહબ કે નેતૃત્વ મેં દેશ કે

500 બુદ્ધિજીવિયોં ને એક સાથ વિચાર-વિમર્શ ઔર અનુસંધાન કરકે વિકાસ કે પાંચ ક્ષેત્રોં કો નિશ્ચિત કિયા। કલામ સાહબ ઇસ વિષય કો લેકર દિનાંક ૩૦-૬-૨૦૦૧ કો દિલ્લી મેં સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સે મિલને પહુંચે। કલામ સાહબ ને દેશ કે વિકાસ કે પાંચ બિન્દુઓં કો સ્વામીજી કે સમક્ષ રઁા- 1. શિક્ષા ઔર સ્વાસ્થ્ય સુરક્ષા 2. કૃષિ ઔર સંબંધિત ક્ષેત્ર 3. સૂચના ઔર સંચાર 4. બુનિયાદી ઢાંચા (ઇંફ્રા સ્ટ્રક્ચર) ઔર 5. મહત્ત્વપૂર્ણ તકનીકી સંરચના। ઁનકી બાત સુનકર પ્રમુખસ્વામી મહારાજ ને તુરંત કહા, "પાંચ બિંદુઓં કે સાથ છઠા બિંદુ જોડે - ઇશ્વર મેં શ્રદ્ધા ઔર આધ્યાત્મિકતા।

ઇસસે ઢી ઁસે યોગ્ય નાગરિક તૈયાર હોંગે જો ભારત કો એક વિકસિત રાષ્ટ્ર બનાને મેં યોગદાન દેંગે। આધ્યાત્મિક ધન જિતના મજબૂત હોગા, ઁતના ઢી યહ સાંસારિક ધન ઁસકે સાથ આેગા।"

કલામ સાહબ ને કહા, "શ્રેષ્ઠ

નાગરિક કેવલ સરકારી નિયમોં સે નહીં બનતે, યહ તો આપ જૈસે સંતોં કે આશીર્વાદ સે ઢી બનતે હૈ, આપકે દવારા નિર્મિત અક્ષરધામ જૈસે સંસ્કાર કેન્દ્રોં કો દેખકર ઁસા લગતા હૈ કિ આપ પ્રતિવર્ષ એક લાખ સંસ્કારી યુવા તૈયાર કર સકતે હૈ।" પ્રમુખસ્વામી મહારાજ ને અપની કીર્તિ ઔર પ્રશંસા કે પુષ્પોં કો ગુરુ યોગીજી મહારાજ કે ચરણોં મેં અર્પણ કરતે હુે બતાયા, "હમારે ગુરુ કહતે થે કિ સંસ્કાર ઔર સદગુણોં કો બાલ-માનસ મેં ઢી ડૂઢ કરવાકર એક પૂર્ણ વિકસિત રાષ્ટ્ર કી નીંવ રઁી જા સકતી હૈ।"

કલામ સાહબ ને ઢી સહર્ષ ઇસ માર્ગદર્શન કો સહર્ષ સ્વીકાર કર લિયા ઔર ફિર આગે પૂછા, "પહલે લોગોં કો ધાર્મિક બનાકર કામ શુરુ કરના યા ફિર ઁનોં કાર્ય સમાનાંતર કરે?" સ્વામીજી ને કહા, "ઁનોં સમાનાંતર કરે, વિકાસ કે કાર્ય કો જારી રઁના આવશ્યક હૈ। પર ઔર અપરા વિદ્યા ઁનોં કો સ્વીકાર કર હમારી સંસ્કૃતિ ને વિકાસ કા માર્ગ પ્રશસ્ત કિયા હૈ।"

સ્વામીજી કે ઇસ વિરલ્ન તથા સર્વજીવહિતાવહ માર્ગદર્શન કી ઋણાભિવ્યક્તિ કલામ સાહબ ને તેજસ્વી મન" નામક અપની પુસ્તક મેં વિશદતાપૂર્વક કી હૈ। વે જીવન કે અંત તક સ્વામીજી કી ઇસ આધ્યાત્મિક ઁર્જા સે પ્રભાવિત રહે। આઁર, હમ ઢી અપને દૈનિક જીવન મેં પ્રગતિ કે લિે અધ્યાત્મ કો પૈમાના બનાકર જીવન કે પ્રત્યેક ક્ષણ કો આનંદમય ઉત્સવ બનાઈ

- સાધુ જ્ઞાનાનંદદાસ



મજૂર દિને ટોરોન્ટોમાં વિશાળ રેલી, પડતર માંગણી દોહરાવાઈ

કામદારો માટે સમાન નીતિ, લઘુત્તમ વેતન ૨૦ ડોલર પ્રતિ કલાક, યોગ્યતા મુજબ સુવિધા આપવા માંગણી

ટોરોન્ટો

દર વર્ષે ૧લી મેને વિશ્વભરમાં મજૂર દિન તરીકે ઉજવવામાં આવે છે. ટોરોન્ટો અને ટ્રિવન્સ પાર્કમાં પણ કામદારોનાં યુનિયનોના નેતા, સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ મોટાપાયે રેલીઓનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કામદારો હાલમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેના તરફ સરકાર

અને લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ રેલીમાં એક ઈમરજન્સી ફિઝિશિયન ગેબ્રિઅલ સ્ટીફને ડ્રેનેજ પાર્ક ખાતે મીડિયાને જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહારોગચાળા દરમિયાન જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત સેવામાં લાગ્યાં છે. તેમના માનસ પર પણ સતત તાણ, કામના અવ્યવસ્થિત સ્થળો, દર્દીઓ તેમજ તેમના



સંબંધીઓનાં વર્તનની વિપરિત કામદારો સ્વાભાવિક રીતે જ અસર પડી છે. આ સ્થિતિમાં લાંબા સમયથી પગાર સાથેની

માંદગીની રજા માંગી રહ્યાં છે. અમે તેની ગંભીરતા સમજીએ છીએ. રવિવારે ભારે વરસાદ અને સખત ઠંડા હવામાન વચ્ચે આયોજકો ધ ઓન્ટેરિયો હેલ્થ કો-એલિશન અને ફિલિપિનો વર્કસ સંયુક્ત પર્યાવરણ પરિવર્તન વિરોધી રેલી, કામદારોને થતાં અન્યાય તથા પ્રિમિયર ડગ ફોર્ડના વિરોધમાં આ રેલીઓનું આયોજન કર્યું હતું આ રેલીમાં જોઈન્ટ ક્લાઈમેન્ટ

જસ્ટિસની નેતા જેસે પોતાના કામદારો માટે દરેક માટે સમાન નીતિ, લઘુત્તમ વેતન ૨૦ ડોલર પ્રતિ કલાક, યોગ્યતા મુજબ કામ, સસ્તા મકાન, પગાર સાથેની માંદગીની રજા, પૂરતા ભંડોળ સાથેની જાહેર સેવા, તમામ લોકોને જરૂરી આવકનો આધાર, ક્લાઈમેન્ટ જસ્ટિસ, બધા વચ્ચે સમાનતા અને વર્ગભેદ પક્ષપાત નાબૂદ કરવાની માંગણીઓ કરી હતી.

ઓન્ટેરિયોમાં કોવિડની છટ્ટી લહેરના સંકેત

નવા ૩૧ દર્દીના મોત: સુધરી રહેલી પરિસ્થિતિ વચ્ચે પણ સાવચેતી રાખવી જરૂરી

ઓન્ટેરિયો

ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯ સાયન્સ એડવાઈઝરી ટેબલના ડીરેક્ટર ડો. પીટર જુનીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થવાનાં બનાવો અને ઈન્કેક્શનો ફેલાવાનાં આંકડાઓ વેસ્ટ વોટરમાં દર્શાવવામાં આવ્યા હતા, તે મુજબ બંનેમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. મને લાગે છે કે આપણે સાચે માર્ગે છીએ અને જો આપણે આ રીતે આપણું કામ ચાલુ રાખીશું તો આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય બની જશે.

પરંતુ પીટર જુનીએ ચેતવણી આપતાં



જણાવ્યું હતું કે, હજુ પણ કોવિડ માથું ઉચકી શકે છે. સાવધાનપૂર્વક વર્તન કરવું એ હજુ પણ જરૂરી છે. આપણે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવા જેવા પગલાંઓ તરફ આંખ આડા કાન કરવાનાં નથી. મોતનાં જે નવા ૩૧ કેસ નોંધાયા છે, તે કદાચ


કોવિડ-૧૯ની છટ્ટી લહેર પણ હોઈ શકે. શહેરમાં હાલમાં અંદાજે ૮૦થી ૯૦ હજાર લોકોમાં રોજ વાઈરસ ફેલાઈ રહ્યો છે, એમ વેસ્ટ વોટરનો ડેટા જણાવે છે. આ દરમિયાન બુધવારે દવાખાનાં દાખલ કરવાનાં કેસોમાં સહેજ ઘટાડો થયો હતો. એક દિવસ અગાઉ મંગળવારે કોવીડથી અસરગ્રસ્ત ૧૬૯૯ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯૯ દર્દીઓને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેની સંખ્યા મંગળવારે ૨૦૨ હતી અને ૯૪ લોકોને શ્વાસમાં તકલીફ પડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

યુરોપિયન યુનિયને એપલ વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ અંગેની તપાસ આદરી

બ્રસેલ્સ

યુરોપિયન યુનિયને જણાવ્યું છે કે તેનું માનવું છે કે એપલે પોતાના ઈજારાશાહીનો ફાયદો ઉઠાવીને પોતાની પેમેન્ટ સિસ્ટમ એપલ પેના હરીફોને મર્યાદિત તકો આપી છે. ૨૭ દેશોનું સંગઠન યુરોપિયન કમિશન ૨૦૨૦થી ટેકનોલોજી કંપની એપલની વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે. કમિશનને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એપલે પોતાના ડિવાઈસ પર પોતાની પ્રતિસ્પર્ધી મોબાઈલ એપ ડેવલોપર્સ માટે જરૂરી સુવિધા આપી નથી. ઈયુ કોમ્પિટિશન કમિશનર માર્ગેથે વેસ્ટાગેરે જણાવ્યું છે

કે અન્ય હરીફ કંપનીઓને દૂર રાખીને એપલે પોતાના એપલ પે વોલેટને સંરક્ષણ પુરુ પાડ્યું છે. એપલે પોતાના ઈજારાશાહીનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય કર્યું છે જે કાયદા અનુસાર ગેરકાયદે છે. જો કે કમિશને એ જણાવ્યું નથી કે જો કંપની દોષિત પુરવાર થશે તો તેને કેટલી રકમનો દંડ ફટકારવામાં આવશે. કમિશને વધુમાં જણાવ્યું છે કે એપલના આ કૃત્યને કારણે ગ્રાહકોને ઓછી પસંદગી પ્રાપ્ત મળી છે અને અન્ય હરીફ કંપનીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમિશને આ સંબંધમાં એપલ વિરુદ્ધ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્શન મોકલ્યું છે.



CLUB CERAMIC

Porcelain Tiles : Premium Quality and Best Price

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



TILES • BACKSPASH • LAMINATE • VINYL • HARDWOOD

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent,
QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200
Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1,
Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850

CAMBRIDGE

15 Sheldon Dr, Cambridge,
ON N1R 6R8
+1-647-542-1508 ,
+1-647-527-6030

<https://clubceramic.com> Email : sales@clubceramic.com